



ડૉ. બાબાસાહેબ આંબેડકર
ઓપન યુનિવર્સિટી

CYS-01
યોગવિજ્ઞાનનો
પ્રમાણપત્ર અભ્યાસક્રમ

વિભાગ-1

યોગ પરિચય-મહર્ષિ પતંજલિ યોગદર્શનમૃ

ખંડ-1

યોગ પરિચય

એકમ-1:

યોગનો સંક્ષિપ્ત પરિચય

05

એકમ-2:

યોગની ભામક માન્યતાઓ અને તેનું ખંડન

10

એકમ-3:

યોગનું સાચું સ્વરૂપ

17

એકમ-4:

યોગનાં પરંપરાગત પુસ્તકોનો પરિચય

23

એકમ-5:

યોગસૂત્રનો અભ્યાસ

33

લેખક

ડૉ. વિકમ બી. ઉપાધ્યાય

૩/બી, જીવન સ્મૃતી સોસાયરી,
મિરાભીકા સ્કુલ પાસે, નારણપુરા,
અમદાવાદ - 380013.

વૈદ્ય શ્રી. ફાલ્ગુનભાઈ પટેલ

ઈ/૧, શુભલક્ષ્મી પેલેસ
ભૂયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ,
ઘાટલોડિયા,
અમદાવાદ - 380061.

ડૉ. કમલેશ રાજગોર

સેનેટ મેમ્બર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,
૮/૮૦, શ્રધ્યાદિપ કોમ્પ્લેક્સ,
અંકુર ચાર રસ્તા, નારણપુરા,
અમદાવાદ - 380013.

પરામર્શક (વિષય)

શ્રી. બિમાનજી પાલ

વિભાગ અધ્યક્ષ, યોગ કેન્દ્ર,
ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ,
અમદાવાદ.

પરામર્શક (ભાષા)

શ્રી. યોગોન્દ્રભાઈ વ્યાસ

૩૪૭, સરસ્વતીનગર,
આજાદ સોસાયરી નાલુક,
અમદાવાદ.

સંયોજન સહાય

શ્રી. એસ. એચ. બારોટ

મદદનીશ કુલસચિવ
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
ડફનાળા, શાહીભાગ, અમદાવાદ - 380 003.

પ્રકાશક

કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
સરકારી બંગલા નંબર-૯, ડફનાળા, શાહીભાગ, અમદાવાદ - 380 003 ટે.નં. 22869690
 © સર્વ હક સ્વાધીન. આ પુસ્તકના લખાણ યા તેના કોઈ પણ ભાગને
 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની લેખિત સંમતિ વગર
 મિભિયોગ્રામી દ્વારા યા અન્ય કોઈ પણ રીતે પુનઃમુદ્રિત કરવાની મનાઈ છે.

એકમ-૧ : યોગનો સંક્ષિપ્ત પરિચય :

આ એકમમાં સૌપ્રथમ ‘યોગ’ શબ્દનો અર્થ સમજાવવામાં આવ્યો છે. ત્યાર બાદ યોગની કેટલીક વ્યાખ્યાઓ કરી તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. યોગનું મૂળ ભારત છે. ભારતીય સંસ્કૃતિના આ વિભિન્ન અંગ વિશે માહિતી મેળવ્યા બાદ આધુનિક સમયમાં યોગની ઉપયોગિતા વિશે વાત કરવામાં આવી છે.

માણખ્ય :

- 1.1 હેતુ
- 1.2 પ્રસ્તાવના
- 1.3 ‘યોગ’ શબ્દનો અર્થ
- 1.4 યોગનો સામાન્ય અર્થ
- 1.5 યોગનું મૂળ
- 1.6 આધુનિક યુગમાં યોગનું મહત્વ
- 1.7 સારાંશ
- 1.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો

1.1 હેતુ:

આ એકમના અભ્યાસને અંતે તમે :

- યોગનો શાબ્દિક અર્થ જાણી શકશો.
- યોગની કેટલીક વ્યાખ્યાઓ સમજ યોગ શું છે, તેની પ્રાથમિક સમજ કેળવી શકશો.
- યોગનો ઉદ્ભબ ક્યાંથી અને ક્યારે થયો તે વિશે માહિતી મેળવી શકશો.
- આજના આધુનિક યુગમાં યોગના મહત્વ વિશે તથા તેની ઉપયોગિતા વિશે જાણી શકશો.

1.2 પ્રસ્તાવના:

યોગ ભારતની મ્રાચીન વિદ્યા છે. આપણા ઋષિમુનીઓએ આપેલું વરદાન છે. આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી એ આપણી ફરજ છે. આજ-કાલ કુદકે ને ભૂસકે યોગના કલાસીસો અને શિલ્પિઓ શરૂ થઈ ગયા છે, એ જોતાં લાગે કે યોગની પ્રગતિ થઈ રહી છે. પરંતુ વાસ્તવમાં યોગનો સાચો અર્થ ખૂબ જ ઓછા લોકો જાણે છે. ‘યોગ’ એ જીવન જીવવાની કળા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરી યોગમાં આગળ વધી શકાય છે. તેથી સાચી માહિતી અને સચોટ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.

1.3 ‘યોગ’ શબ્દનો અર્થ :

યુજ્યતે અનેન ઇતિ યોગ : ।

‘યોગ’ શબ્દ સંસ્કૃત ભાષાના ‘પુજ્ઞ’ ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ ‘જોડાણ’ એવો થાય છે. આ જોડાણના પણ અનેક અર્થ રજૂ કરવામાં આવ્યા છે, જેમ કે, જીવત્મા અને પરમાત્માનું જોડાણ, ચિત્ત અને ચૈતન્યનું જોડાણ, શરીર, મન અને આત્માનું ઈશ્વર સાથેનું જોડાણ. અર્થ ગમે તે હોય, પણ અંતિમ લક્ષ્ય તો આત્મસાક્ષાત્કાર જ છે.

1.4 યોગનો સામાન્ય અર્થ :

વિવિધ કારણોથી લોકો યોગનો અભ્યાસ કરે છે. કોઈ વ્યામામ માટે તો કોઈ ચિકિત્સા તરીકે, કોઈ સૌન્દર્ય મેળવવા તો કોઈ તનાવ ઘટાડવા, સૌને એનાથી ફાયદો તો થાય છે. પરંતુ યોગ એ માત્ર ઉપર્યુક્ત બાબતો માટે મર્યાદિત નથી. તેનો અર્થ તો ખૂબ જ વિશાળ છે.

યોગ તમામ ક્ષેત્રે ઉપયોગી છે. તમામ લોકો યોગ કરી શકે છે. તેણું મહત્વ અને તેના ફાયદા વિશે આપણે આગળના એકમમાં જાણીશું. યોગની કેટલી વ્યાખ્યાઓ નાચે પ્રમાણે છે, જેને સંવિસ્તર એકમ-3 માં સમજશું.

- સમત્વનું યોગ ઉચ્ચતે | અર્થાત્ યોગ એટલે સમતા.
- યોગ : કર્મસુ કૌશલમું | કર્મમાં કુશળતા એટલે યોગ.
- યોગ એટલે ચેતનાનો વિકાસ.
- યોગ એટલે મહર્ષિ પતંજલિનું યોગદર્શન. ગે
- યોગ : ચિત્તવૃત્તિ નિરોધ : | અર્થાત્ ‘યોગ’ એટલે ચિત્તવૃત્તિઓ પરનો કાબૂ.

યોગની કોઈપણ પરિભાષાને ઊડાણથી સમજશું તો સાંભળવામાં ભલે અલગ હોય, પણ તેણું અંતિમ લક્ષ્ય તો એક જ છે.

આ પરિભાષા પરથી ખ્યાલ તો આવે જ છે કે યોગ એક અધ્યાત્મવિદ્યા છે, તેમાં પૂર્ણતાની વાતો છે. કદાચ શરૂઆતમાં આ સમજશું અધરૂ થઈ પડશે, પરંતુ ધીમે ધીમે આગળના એકમોનો અભ્યાસ કર્યા બાદ યોગના સાચા અર્થનો ખ્યાલ આવશે.

યોગ એક પ્રાયોગિક વિજ્ઞાન છે, એટલે કે તેમાં પ્રયોગો કરવા પડે છે. જેમ તરવા વિશે ગમે તેટલા પુસ્તકો વાંચીએ છીતાં તરતા ન આવડે, તેના માટે પાણીમાં ઝંપલાવવું જ પડે છે. એ જ પ્રમાણે યોગમાં માત્ર વાંચીને, સમજને કે વિચારીને આગળ વધવું શક્ય નથી. પ્રયોગો કરવા પડે છે. સતત, નિરંતર, લાંબો સમય, આદરપૂર્વક તથા સંપૂર્ણ શ્રદ્ધાથી યોગાભ્યાસ કરવામાં આવે તો જ તે દફ બને છે.

☛ તમારી પ્રગતિ ચકાસો :

(1) યોગ એટલે શું ? તમારા વિચારો જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....

(2) ‘યોગ’ શબ્દનો અર્થ સમજાવો.

.....
.....
.....
.....
.....
.....

(3) યોગની કોઈપણ નજી પરંપરાગત વ્યાખ્યા કે પરિભાષા લખો.

.....
.....
.....
.....

1.5 યોગનું મૂળ :

યોગવિદ્યા ભારતાથી સંસ્કૃતના અમૂલ્ય સંપાત્તે છે. તેનો ઠાંટાણ વક્તો જુનો છે. પેંડા અને ઊપાંનખદાંમાં તેનો ઉલ્લેખ છે. તે સમયે દરેક જ્ઞાન મૌખિક આપવામાં આવતું, લખવાની કંઈ ખાસ વ્યવસ્થા નહોતી. આથી યોગશાસ્ત્ર કોણે અને ક્યારે આરથ્યું તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આવી ઉપકારક બાબતો ઈશ્વરે કહી છે એમ માનવામાં આવે છે.

ભારત એ યોગીઓ અને ઋષિમુનીઓનું કેન્દ્ર છે. અહીની ભૂમિ જ એવી છે કે કોઈપણ વ્યક્તિ સાધના દ્વારા યોગ સિદ્ધ કરી શકે છે. ભારતના ઋષિમુનીઓ અભ્યાસ દ્વારા અનંત સુધી પહોંચી શક્યા હતા. કુદરતના સાનિધ્યમાં રહીને તેના પ્રયોગાત્મક અભ્યાસ દ્વારા ભારતના ઋષિમુનીઓએ કેટલાક સિદ્ધાંત તારચેલા, તેમાંથી પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો માર્ગ વિકસાવ્યો. પ્રાચીન ભારતમાં શરીર, શાસ અને મનનો યોગવિદ્યા દ્વારા ઊડાણપૂર્વક અભ્યાસ થયો, જેવો ક્રયાંય નથી થયો. હવે આજકાલ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોએ સિદ્ધ કર્યું છે કે વ્યક્તિત્વના વિકાસ માટે યોગ પૂર્ણ પદ્ધતિ છે. ભારતની સંસ્કૃતિના અમર વારસાનો સ્વીકાર પદ્ધિમના દેશોએ પણ કર્યો, અને યોગ તરફ દુનિયાનું ધ્યાન દોરાયું.

ભારતની સંસ્કૃતિમાં છ દર્શનોનું ખૂબ જ મહત્વ છે, તેમાં એક યોગશાસ્ત્ર છે. આ યોગવિદ્યાનો વૈજ્ઞાનિક ફેલે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિએ ‘યોગદર્શન’ની રચના કરી ત્યારથી યોગ એ મહર્ષિ પતંજલિએ આપેલું ચિત્તશુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે.

1.6 આધુનિક યુગમાં યોગનું મહત્વ :

પહેલાના સમયમાં ઋષિમુનીઓ 150-200 વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જીવતા હતા. તેમની આયુષ્ય મર્યાદા વધુ હોવાનું કારણ તેમનું શાંતિમય, સરળ, સારું તથા પ્રકૃતિમય જીવન હતું. વિજ્ઞાનની પ્રગતિની સાથે સાથે સુખ સંગવડાનાં અનેક સાધનો મળ્યાં. સાચા સુખથી ધીમે-ધીમે મનુષ્ય દૂર અને દૂર ભાગતો રહ્યો. જીવન અટપું અને તનાવગ્રસ્ત બન્યું. આ માટે માત્ર મેડિકલ સારવાર પર્યાપ્ત ન રહી. આ પરિસ્થિતિને પહોંચી વળવા યોગનું શરદી સ્વીકારવામાં આવ્યું. આજકાલ તો વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને મેડિકલ સાધનો પણ પૂરક તત્ત્વ તરીકે યૌગિક જીવન પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો છે. આજની દોડધામભરી જીવન પદ્ધતિમાં શરીરિક અને માનસિક રોગના ઉપાય તરીકે ડોક્ટરો તથા મનોવિજ્ઞાનિકો ‘રિલેક્સેશન’નું મહત્વ સ્વીકારવા લાગ્યા છે. થાકેલા શરીર અને મનમાંથી વ્યક્તિને બહાર લાવવાના ઉપાયો તો યોગવિદ્યામાં હજારો વર્ષો પહેલાં શોધી કાઢ્યા છે.

આધુનિક જીવન પ્રવૃત્તિમય જીવન કહેવાયું છે, પરિણામે સતત સંઘર્ષ સાથે જીવન જીવનું પડે છે. બાળપણથી જ સંઘર્ષના પરિણામે માનસિક તનાવનો અજ્ઞાણતાં જ મનુષ્ય ભોગ બને છે. આ જોતાં લાગે છે કે જીવનનો સ્વાભાવિક આનંદ લૂટાઈ ગયો છે. વર્તમાનપત્રો દ્વારા જાણી શક્ય છે કે આધુનિક યુગમાં બુધ્યિશાળી વ્યક્તિ બુધ્યિપૂર્વક કેવાં ખોટાં કામો કરે છે. ભૌતિક સુખ-સંગવડો મેળવવા વિકૃત વર્તન કરે છે. સત્ય, પ્રમાણિકતા અને સંદૃગ્ધાંશો વગેરેની વાતો અવાસ્તવિક લાગે છે. નકારાત્મક વલાડો, તનાવ, છેતરપણી વ્યાપક બન્યાં છે. ભૌતિક પ્રગતિના પરિણામે દુઃખ અને અશાંતિ વધ્યા છે, માનવ અને માનવતા તો જાણો ખોવાઈ ગયાં છે. આ બાબુ પરિસ્થિતિ પર કાબુ મેળવવો એ આજના યુગની જરૂરિયાત છે. પોતાની જાત પર કાબુ પ્રામ કર્યા વગર તે શક્ય બનવાનું નથી. આ આધુનિક વ્યક્તિ માટે હવે યોગ એ દવા છે.

શરીરની સાથે સાથે મન માટે પણ સારાં પોષક તત્ત્વો મળવાં જરૂરી છે, કારણ કે બધી ચિત્તાઓનું કારણ મન છે. આ મન પર કાબુ મેળવવાનો ઉપાય યોગ પાસે છે. બહારની દુનિયાને તો આપણે જાણી છે, પરંતુ આપણી જાણી છે. આથી યોગશાસ્ત્રની અધરની

યોગ પરિચય દુનિયાને જાળી શક્યા નથી. માનવના મન પર ભાર વધી રહ્યો છે તેને પહોંચી વળવા મનનો વિકાસ જરૂરી છે, જેનું એકમાત્ર સાધન યોગ જ છે.

આમ, આધુનિક યુગમાં જો યોગને વહી લેવામાં આવે તો, વિજ્ઞાન અને યોગના સમન્વયથી વક્તિ ખૂબ પ્રગતિ સાધી શકે છે, તથા આજની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

૭ તમારી પ્રગતિ ચકાસો :

(4) યોગની વૈજ્ઞાનિક ફેબે સૌપ્રથમ રજૂઆત કોણે કરી ?

.....
.....

(5) મહર્ષિ પતંજલિએ શેની રચના કરી ?

.....
.....

(6) યોગની શરૂઆત ક્યાંથી થઈ અને કોણે કરી ?

.....
.....
.....
.....
.....

(7) આધુનિક જીવનમાં યોગનું મહત્વ - તમારા વિચારો વ્યક્ત કરો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

1.7 સારાંશ :

યોગ વિશેની પ્રાથમિક સમજ આપણે કેળવી, યોગ એ ભારતીય પરંપરાનું બહુમૂલ્ય અંગ છે. આજના આ આધુનિક યુગમાં યોગવિદ્યાનો અભ્યાસ કરવાથી ધ્યાન ફાયદા મેળવી શકાય છે, સાથે સાથે તનાવમુક્ત જીવન તથા આંતરિક સુખની પ્રાપ્તિ થાય છે. ભારત અધ્યાત્મનો દેશ છે અને અધ્યાત્મની મદદથી આપણે ઈશ્વરને પામી શકીશુ.

1.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

- (1)
- (2) ‘યોગ’ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘જોડાણ’ એવો થાય છે. આ જોડાણની જુદી જુદી પરિભાષાઓ આપવામાં આવી છે.
- (3) ક) ‘યોગ’ એટલે આત્મા અને પરમાત્માનું મિલન.
ખ) ‘યોગ’ એટલે કર્મમાં કુશળતા.
ગ) ‘યોગ’ એટલે ચિત્તવૃત્તિ પરનો કાબૂ.
- (4) મહર્ષિ પતંજલિ
- (5) ‘યોગદર્શન’
- (6) ‘યોગ’નું મૂળ ભારત છે, યોગવિદ્યા ખૂબ જ પ્રાચીન છે. તે સમયે ગુરુ-શિષ્ય પરંપરા હોઈ બધુ જ્ઞાન મौખિક રહેતું. તેથી યોગની શરૂઆત કોણે અને ક્યારે કરી તે કહેવું શક્ય નથી. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. છતાં આવી ઉપકારક બાબતોના પ્રણોત્તા ઈશ્વર માનવામાં આવે છે.

એકમ - 2 : યોગની ભામક માન્યતાઓ અને તેનું ખંડન

આ એકમમાં યોગ વિશેના ખોટા ઘ્યાલોની ચર્ચા કરવામાં આવી છે. યોગ શું નથી તે જગ્ઞાવી યોગ ખરેખર શું છે, તે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યોગ આજકાલ વેપાર બનતો જાય છે. આથી કોઈ સ્વાર્થી યોગનો પોતાના ફાયદા માટે ઉપયોગ ન કરે તથા જનસમાજને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરે, તે માટે તેના ભામક પ્રચારને અટકાવવો જરૂરી છે.

માળખું :

- 2.1 હેતુ
- 2.2 પ્રસ્તાવના
- 2.3 યોગ ગૃહસ્થઓ માટે નથી
- 2.4 યોગ એટલે ચમત્કાર
- 2.5 યોગ એટલે સૌન્દર્ય વધારનાર અભ્યાસ
- 2.6 યોગ એટલે ચિકિત્સા પદ્ધતિ
- 2.7 યોગ એક ધર્મ
- 2.8 યોગ એટલે વ્યાયામ
- 2.9 સારાંશ
- 2.10 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો

2.1 હેતુ :

આ એકમના અભ્યાસના અંતે તમે :

- યોગ ગૃહસ્થઓ માટે પણ છે તે સમજી શકશો.
- યોગનું લક્ષ્ય ચમત્કાર નથી તે જાણી શકશો.
- યોગ એ સુંદરતા વધારવા માટે નથી.
- યોગનું લક્ષ્ય સારવાર નથી તે સમજી શકશો.
- યોગ એક માનવ ધર્મ છે.
- યોગ કસરત નથી તે જાણી શકશો.

2.2 પ્રસ્તાવના :

યોગ ધર્ષો મહત્વનો તથા ફાયદાકારક વિષય છે, છતાં તેના અભ્યાસીઓ ધર્ષા ઓછા છે; કારણ કે યોગ વિશે સમાજમાં અનેક ભામક માન્યતાઓ પ્રવર્તે છે. પરિજ્ઞામે જનસમાજને જે વાસ્તવિક લાભ મળવો જોઈએ તે મળતો નથી.

યોગ શું છે, તે જાણતાં પહેલા યોગ શું નથી તે જાણી લઈએ તો યોગને સમજવો સરળ થઈ પડે છે. પથ્થરમાંથી મૂર્તિ ઘડવી હોય તો પથ્થરનો જે ભાગ મૂર્તિ નથી, તે દૂર કરવાથી આપોઆપ સુંદર સ્પષ્ટ મૂર્તિ ઊપસી આવે છે. તેમ યોગ શું નથી, તે સમજવાથી યોગનું સાચું સ્વરૂપ સમજાય છે.

યોગ વિશેની કેટલીક ભામક માન્યતાઓ તથા દુષ્ટચાર નીચે મુજબ છે, જેના લીધે વર્ષોથી જનસમાજ આ અતિમૂલ્યવાન વિષયથી વંચિત રહ્યો છે.

આમક માન્યતાઓ

- યોગ ગૃહસ્થાઓ માટે નથી.
- યોગ એટલે ચમત્કાર.
- યોગ એટલે સૌન્દર્યવર્ધક અભ્યાસ.
- યોગ એટલે ચિકિત્સાપથ્યતિ.
- યોગ એટલે ધર્મ.
- યોગ એટલે વ્યાયામ.

આમક માન્યતાઓનું ખંડન

- યોગનો અભ્યાસ દરેક વ્યક્તિ કરી શકે છે.
- યોગનું લક્ષ્ય ચમત્કાર નથી.
- સૌન્દર્યપ્રાપ્તિ માત્ર યોગની આડપેદાશ છે, ધ્યેય નથી.
- યોગનો ઉદ્ભબ સારવાર માટે થથો નથી.
- ... માનવર્ધણું છે.
- યોગ એ કોઈ વ્યાયામ પદ્ધતિ કે કસરત નથી.

યોગની આમક માન્યતાઓ તથા તેનું ખંડન અર્થાત્ યોગ શું નથી તે આપણે જાણ્યું. હવે તે દરેક વિરો ટૂંકમાં નીચે મુજબ માહિતી આપી છે, તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

2.3 યોગ ગૃહસ્થો માટે નથી :

જનસમાજમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે યોગ એ સાધુ-ભાવાઓ જ કરી શકે. યોગનું નામ સાંભળતાં જ આપણા મનમાં લાંબી દાઢીવાળા, ભગવાં વસ્ત્રો પહેરેલા તથા જંગલ કે પર્વતો પર રહી સાધના કરનારા યોગી મહારાજનું ચિત્ર આવી જાય છે. આ કારણે યોગનો વિષય અમુક માણસો પૂરતો મર્યાદિત રહ્યો છે.

સાચા અર્થમાં યોગને કોઈ બાધ દેખાવ સાથે સંબંધ નથી, યોગ માટે ભગવાં વસ્ત્રો પહેરી હિમાલય પર તપ કરવું જરૂરી નથી. એક ગૃહસ્થ પોતાના ગૃહસ્થ જીવનનું કર્તવ્ય નિભાવતાં નિભાવતાં સારી રીતે યોગનો અભ્યાસ કરી શકે છે. આજના આધુનિક સમયમાં યોગ સંસારીઓને વધુ ઉપયોગી છે. યોગથી વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વમાં હકારાત્મક પરિવર્તન આવે છે.

શ્રીમદ્ ભગવત્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને યોગવિદ્યાનો ઉપદેશ ખૂબ જ સુંદર રીતો આપ્યો છે. શ્રીકૃષ્ણ તથા અર્જુન કોઈ સાધુ ન હતા, પણ સંસારી હતા. આ ઉદાહરણથી તમે સ્પષ્ટ રીતે સમજ શકો છો કે યોગ એ ગૃહસ્થો તથા સામાન્ય માનવીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

યોગ ગૃહસ્થો માટે પણ છે

1.4 યોગ એટલે ચમત્કારો :

બીજાઓ ના કરી શકે તેવું કરી બતાવીએ તેને ચમત્કાર કહેવાય. કોઈ રમતવીર લાંબો સમય સતત અભ્યાસ કરે તો તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ જ રીતે યોગમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ યોગમાં સિદ્ધિઓને મહત્વ આપવાની મનાઈ છે. સિદ્ધિઓ અર્થાત્ ચમત્કારો તરફ આકાર્ષિય છે, તે ક્યારેય યોગનો ઊડો અભ્યાસ કરી શકતા નથી.

યોગના અભ્યાસથી પાણી પર ચાલવું, જમીનથી અધ્યર ચાલવું વગેરે જેવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે, જેને સામાન્ય

જનતા ચમત્કાર માને છે, પરંતુ આવી શક્તિઓ આગળ વધવા વાપરવાની છે, પ્રદર્શન માટે નથી. છતાં આજકાલ યોગની વાતો મ્રયોગશાળામાં ચકાસાતી હોઈ તે ચમત્કારિક મટી વૈજ્ઞાનિક બની છે.

યોગનું લક્ષ્ય ચમત્કારો નથી

2.5 યોગ એટલે સૌન્દર્યવર્ધક અભ્યાસ :

આજ યોગની લોકપ્રિયતા વધવાનું કારણ એ છે કે યોગ સૌન્દર્યવર્ધક અભ્યાસ છે. યોગથી શારીરિક સૌન્દર્ય વધે છે, પરંતુ યોગમાં માત્ર બહારના દેખાવ સાથે કોઈ સંબંધ નથી. યોગનાં અભ્યાસમાં શરીરના બાબ્ધ સૌન્દર્ય વધારવા કરતાં વ્યક્તિના આંતરિક સૌન્દર્ય વધારવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. યોગ એ ચહેરાને ચમકીલો બનાવવા માટે કે શરીરને સુડોળ બનાવવા માટે માત્ર નથી. બાબ્ધ સૌન્દર્ય તો માત્ર તેની આડપેદાશ છે, ઘેય નાથી.

સુંદરતા વધારવા માટે યોગ નથી

2.6 યોગ એટલે ચિકિત્સા પદ્ધતિ :

આજકાલ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે યોગનો ઉપયોગ વધતો જાય છે. ચિકિત્સા એ યોગનું એક પાસું જરૂર છે, પણ માત્ર રોગ મટાડવો એ યોગનું ઘેય નથી. યોગની વિવિધ પ્રક્રિયાઓથી ધ્યાન રોગોમાં સુધારો થાય છે, પરંતુ બધા રોગો મટી શકે એવો દાવો કરી શકાય નાથી. યોગથી શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે, પરંતુ માત્ર ચિકિત્સા પદ્ધતિ તરીકે યોગનો ઉપયોગ કરવો એ એક ગેરસમજ છે

યોગનો ઉદ્દ્દ્દેશ ચિકિત્સા માટે થયો નથી

2.7 યોગ એક ધર્મ :

વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં યોગ સ્વીકારાયો હોવાથી યોગ એક ખાસ ધર્મનો ભાગ છે, તેવી ખોટી માન્યતા પ્રવર્ત્તી રહી છે. યોગ એ કોઈ તત્ત્વજ્ઞાન નથી. તેના અભ્યાસમાં કોઈ ચોક્કસ પ્રકારના ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જરૂરી નથી. આસ્તિક તથા નાસ્તિક બંને માટે તે ઉપયોગી છે. યોગ દ્વારા કોઈપણ કેન્દ્રે પ્રગતિ સાધી શકાય છે. કોઈપણ વ્યક્તિ પોતાના ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી યોગનો અભ્યાસ કરી શકે છે. તેના માટે કોઈ ડિયાકાંડ કરવા પડતા નથી. આમ, યોગ એ કોઈ એક ધર્મ નથી, પરંતુ માત્ર માનવર્ધમ છે.

યોગ એ કોઈ એક ધર્મ નથી

2.8 યોગ એટલે વ્યાયામ :

યોગના આસનો તથા પ્રાણાયામ આજકાલ ખૂબ જાહીરતા બન્યા છે. આસનોનું નિર્દર્શન કસરત જેવું દેખાય છે. સામાન્ય જનતા સમક્ષ યોગનું માત્ર શારીરિક મૂલ્ય રજૂ થતું હોઈ યોગ એક વ્યાયામ પદ્ધતિ છે, તેવી ગેરસમજ ઊભી થઈ છે. યોગ એટલે આસન અને પ્રાણાયામ એમ માનવામાં અન્વેષે છે, પરંતુ આસન તથા પ્રાણાયમ જેટલો મર્યાદિત અભ્યાસ યોગ નથી, તે તો યોગનો માત્ર નાનો ભાગ છે. શારીરિક ડિયાઓ એ યોગનું સાચું કે પૂર્ણ સ્વરૂપ નથી, તેમજ વ્યાયામ કે કસરત શબ્દથી આપણે જે સમજાએ છીએ તેનાથી યોગ તદ્દન ભિન્ન છે.

યોગ અને વ્યાયામ વર્ણણના તફાવત

આપણે સામાન્ય અર્ધમાં જેને વ્યાયામ પદ્ધતિ કહીએ છીએ, તે યોગથી તદ્દન ભિન્ન છે. વળી, યોગમાં માત્ર યોગાસનો નથી. યોગાસનને સામાન્ય જનતા કસરત માને છે, જે શરીરને સુડોળ બનાવે છે. પરંતુ વાસ્તવમાં યોગ અને કસરત

વચ્ચે આસમાન જમીનનું અંતર છે. આગળ જગતાવું તે મુજબ, યોગાસનો તો યોગનો માન એક ભાગ છે. યોગનો અર્થ તો ખૂબ જ વ્યાપક છે, જે આપણે આગળ જાણીશું. યોગ અને વ્યાયામ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :

- નિયમિત વ્યાયામ અર્થાત્ કસરત કરવાથી સ્નાયુઓ મોટા અને મજબૂત બને છે, જ્યારે યોગાસનો અંતરિક મજબૂતાઈ લાવે છે તથા શરીર લચીલું અને ધારીલું બને છે.
- યોગમાં શાસ પર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. યોગાસન હોય કે પ્રાણ્યામ શાસ પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે વ્યાયામવીરો શાસ પર ખાસ ધ્યાન આપતા નથી. પ્રાચીન ઋષિમુનીઓએ શાસ અને મનનો ઊડાણપૂર્વક અભ્યાસ કર્યો અને તેનો શરીર સાથે સંબંધ જાણ્યો. શાસની ગતિને વિશેષ લયમાં સ્થાપી દી, તો શરીર અને મનમાં નકારાત્મકતા આવશે નહિ. યોગમાં શાસ લેવા માટે મુખ્યત્વે ત્રણ કિયાની મદદ લેવાય છે.

(એ) ઉરોદરપટલની મદદથી.

(બી) છાતીની મદદથી.

(સી) ખબાની મદદથી.

(શાસ ભરીએ છીએ ત્યારે પ્રથમ પેટ અર્થાત્ (ઉરોદરપટલ, તારબાદ છાતી અને અંતે ખબાનું હલનચલન થાય છે. શાસ છોડતાં આનાથી ઊંઘી પ્રક્રિયા થાય છે.)

- યોગમાં સ્પર્ધાનું તત્ત્વ નથી. તેમાં હાર-છત નથી, જ્યારે વ્યાયામમાં સ્પર્ધાના પરિણામે વ્યક્તિત્વ પર ખૂબ ઊડી અસર પડે છે. હારનાર ખેલાડીને માનસિક રીતે ધડી અસરો થતી હોય છે.
- યોગમાં નિવૃત્તિકાળ નથી. કોઈપણ વ્યક્તિ કોઈપણ ઉમરે યોગનો અભ્યાસી બની શકે છે, જ્યારે કસરતમાં દરેક ઉમરની વ્યક્તિ કરી શકતી નથી. વ્યાયામમાં અમૂક ઉમરે નિવૃત્તિકાળ આવી જાય છે.
- યોગનું લક્ષ્ય પરમપદને પ્રાપ્ત કરવાનું છે. તે માટે પોતે જ સાધન છે જેનો ઉપયોગ કરી ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરવાનો છે, જ્યારે કસરત કે વ્યાયામમાં જતવું એ લક્ષ્ય છે. તથા તેના માટે સામાન્ય રીતે મેદાનો, સાધનો જોઈએ.
- યોગ ખૂબ જ શાંતિથી, ધીરજથી, સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક કરવામાં આવે છે, જ્યારે કસરત ઝડપી, કાઢાયક તથા પૂરી શક્તિ લગાડીને કરાય છે.
- કસરતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્નાયુને હલનચલન આપી શારીરિક તંદુરસ્તી જાળવવાનો છે. તેના અંતે થાક અનુભવાય છે, જ્યારે યોગાસનના અભ્યાસના અંતે કદ્યના ધબકારા કે શાંતની ગતિ વધતી નથી તથા સ્કૂર્ટિનો અનુભવ થાય છે.
- કસરતથી શરીર, શાસ અને મનમાં તનાવ ઉત્પન્ન થાય છે, જ્યારે યોગાભ્યાસથી મનમાં શાંતિ થતાં સ્કૂર્ટિ અનુભવાય છે.

યોગ પરિચય આ ઉપરાંત બીજા ધકા તફાવતો બનેમાં છે, જેને ટૂંકમાં નીચેના કોડા પરથી સમજી શકાય છે :

યોગ	વ્યાયામ
સ્થિરતા	ગતિશીલતા
સૂખપૂર્વક	કષ્ટપૂર્વક
માનસિક શક્તિ પર ભાર અપાય છે	શારીરિક શક્તિ પર ભાર અપાય છે
અંતર્મુખી	બહિર્મુખી
સાત્ત્વિકતા	રાજાસેકતા, તામસિકતા
નિવૃત્તિકાળ નથી	નિવૃનિકાળ આવે છે
સ્પર્ધાનું તત્ત્વ નથી	સ્પર્ધા હોય છે
સાથીદારની જરૂર નથી	બીજાની જરૂર પડે છે
શાસ પર ખૂબ ભાર અપાય છે	શાસ પર વધારે ધ્યાન અપાણું નથી.

યોગ એ શારીરિક કસરત નથી

જ તમારી પ્રગતિ ચકાસો :

(1) યોગ વિશેના ખોટા ધ્યાલો જગ્ઘાવો તથા તેનું ખંડન કરો.

(2) યોગ અને વ્યાયામ વચ્ચેનો તફાવત ટૂંકમાં સમજાવો.

(3) શું યોગ એ માત્ર સાહુસંતો જ કરી શકે ? તમારા વિચારો જણાવો.

(4) યોગ એ સુંદરતા વધારવા માટે છે ?

(5) યોગમાં આસ કઈ રીતે લેવાય છે ?

2.9 સારાંશ :

આ એકમના અભ્યાસથી યોગ શું નથી તે સ્પષ્ટ થાય છે, યોગ એ સામાન્ય જનતા માટે છે. આજના તનાવગ્રસ્ત યુગમાં યોગ ખૂબ જ ઉપયોગી છે, તેનું લક્ષ્ય સુંદરતા પ્રાપ્ત કરવી કે શારીરિક તંદુરસ્તી મેળવવી તે નથી. ચમત્કારોને પણ યોગમાં મહત્વ નથી, યોગ તથા વ્યાયામ વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. યોગમાં સ્થિરતા, સુખ તથા સાત્યિકીતા છે, જ્યારે વ્યાયામ કે કસરતમાં ગતિશીલતા, કષ્ટ તથા ફુંઝ છે. યોગ શું નથી તે જાણ્યા બાદ હવે યોગ ખરેખર શું છે તે જાણવું સરળ થઈ પડશે.

2.10 તમારી પ્રગતિ યકાસવા માટેના જવાબો :

યોગ વિશેના ખોટા ખ્યાલો

- ‘યોગ’ ગૃહસ્થો માટે નથી.
- ‘યોગ’થી સુંદરતા વધે છે.
- ‘યોગ’ એક ધર્મ છે.
- ‘યોગ’થી ચમત્કારો કરી શકાય છે.
- ‘યોગ’ રોગો દૂર કરવા માટે છે.
- ‘યોગ’ એટલે કસરત.

યોગ વિશેના સાચા ઘ્યાલો

- ‘યોગ’ ગૃહસ્થો માટે પડી છે.
- ‘યોગ’ આંતરિક સુંદરતા વધારવા માટે છે.
- ‘યોગ’ એક વિશિષ્ટ ધર્મ નથી.
- ચમત્કારો યોગનું લક્ષ્ય નથી.
- ‘યોગ’નો ઉદ્દ્દ્દ્દુષ રોગ દૂર કરવા માટે નથી.
- યોગ તથા કસરત વચ્ચે ખૂબ અંતર છે.

(2)

યોગ	વાયામ
સ્થિરતા	ગતિશીલતા
સૂખપૂર્વક	કષ્ટપૂર્વક
માનસિક શક્તિ પર ભાર અપાય છે	શારીરિક શક્તિ પર ભાર અપાય છે
અંતમુખી	બહિમુખી
સાત્ત્વિકતા	રાજસિકતા, તામસિકતા
નિવૃત્તિકાળ નથી	નિવૃત્તિકાળ આવે છે
સ્પર્ધાનું તત્ત્વ નથી	સ્પર્ધા હોય છે
સાથીદારની જરૂર નથી	બીજા-ની જરૂર પડે છે
શાસ પર ખૂબ ભાર અપાય છે	શાસ પર વધારે ધ્યાન અપાણું નથી.

(3) ના, યોગ એ માત્ર સાધુ સંતો માટે નથી. આજકાલ સમાજમાં એવી માન્યતા છે કે યોગ એટલે હિમાલયમાં જઈને કે જંગલમાં કોઈ સાધના કરે તે, પરંતુ વાસ્તવમાં યોગને આવા બહારી દેખાવ સાથે કોઈ સંબંધ નથી. આજના તનાવચ્ચેસન જીવનમાં દરેક ગૃહસ્થે યોગ કરવાનું જરૂરી છે. યોગ અધ્યાત્મવિદ્યા છે, જે દરેક વ્યક્તિ કોઈ પડી સમયે, કોઈપણ ઉમરે કરી શકે છે. કોઈ પડી જાતિ કે ધર્મના લોકો ખૂબ જ સારી રીતે યોગને જ્ઞાન-મૃત્યુના ચક્કરમાંથી દૂર થઈ શકે છે.

(4) ખાસ કરીને બહેનોમાં આજે એવી માન્યતા પ્રવર્તે છે કે યોગથી સુંદરતા વધે છે, યહેરા પર ચમક આવે છે. શારીરિક રીતે શરીર સુંદર બને છે, વજન ઘટાડવા માટે ઉપયોગી છે. પરંતુ યોગમાં વ્યક્તિના બાબત દેખાવને નહિ, પરંતુ આંતરિક સૌન્દર્ય વધારવા પર ભાર મૂળવામાં આવ્યો છે. શારીરિક તંદુરસ્તી એ તો માત્ર આડપેદાશ છે, ધ્યેય નહિ.

(5) યોગમાં શાસ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીન ઋષિમુનીઓએ શાસ અને મનનો ઊડાશપૂર્વક અભ્યાસ કર્યો અને તેનો શરીર સાથે સંબંધ જાડ્યો. શાસની ગતિને વિશેષ લયમાં સ્થાપી દો, તો શરીર અને મનમાં નકારાત્મકતા આવશે નહિ. યોગમાં શાસ લેવા માટે મુખ્યત્વે જ્ઞાન કિયાની મદદ લેવાય છે.

- ઉરોદરપટલની મદદથી.
- છાતીની મદદથી.
- ખભાની મદદથી.

(શાસ ભરીએ છીએ ત્યારે પ્રથમ પેટ અર્થાત્ ઉરોદરપટલ, સારબાદ છાતી અને અંતે ખભાનું હલનચલન થાય છે. શાસ છોડતાં આનાથી ઊંધી પ્રક્રિયા થાય છે.)

એકમ : ૩ - યોગનું સાચું સ્વરૂપ

અગાઉના એકમમાં આપણે યોગની ભામક માન્યતાઓ અર્થાત યોગ શું છે તે વિશે વાત કરી. યોગની ગ્રાથમિક સમજ તો આપણે મેળવી ચૂક્યા છીએ. હવે, આ એકમમાં યોગની વિવિધ વ્યાખ્યાઓ દ્વારા, યોગ શું છે, તેનો ઊંડાશપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. શાસ્ત્રોમાં યોગની અનેક વ્યાખ્યાઓ થયેલ છે, તેમાંથી કેટલાક અર્થ અહીં આ એકમમાં સમાવ્યા છે.

માળખું :

- 3.1 હેતુ
- 3.2 પ્રસ્તાવના
- 3.3 શ્રીમદ ભગવદગીતા અનુસાર યોગ
- 3.4 મહર્ષિ પતંજલિ અનુસાર યોગ
- 3.5 યોગની અન્ય વ્યાખ્યાઓ
- 3.6 સારાંશ
- 3.7 પારિભાષિક શબ્દો
- 3.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

3.1 હેતુ

આ એકમના અંતે તમે,

- ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને યોગ વિશે સમજ આપતાં તેની વ્યાખ્યાઓ કરી છે. તેમાંથી બે વ્યાખ્યા વિશે સમજ કેળવીશું.
- મહર્ષિ પતંજલિએ તેમના યોગસૂત્રોમાં બીજા જી સૂત્રમાં યોગની વ્યાખ્યા કરી છે, ને વિસ્તારથી સમજશું.
- આ ઉપરાંત યોગની અન્ય કેટલીક વ્યાખ્યાઓ જાડી યોગને સમજવાનો પ્રયત્ન કરીશું.

3.2 પ્રસ્તાવના

યોગ એ ખૂબ જ વિશાળ વિષય છે, તેની કોઈ એક ચોક્કસ કે સચોટ વ્યાખ્યા કરી ન શકાય. તેને એક વ્યાખ્યામાં બાંધી દઈને તેને મર્યાદિત ન બનાવી શકાય. તેનું સ્વરૂપ ખૂબ જ વિશાળ છે તેની અનેક વ્યાખ્યાઓ થયેલી છે. જુદીજુદી વ્યાખ્યાઓ જુદા-જુદા દસ્તિબિદ્ધુથી થયેલી હોય છે. યોગની અનેક સંકલ્પનાઓ છે. આ એકમમાં મુખ્યત્વે આપણે ભગવતગીતા અનુસાર યોગની જે વ્યાખ્યા છે તે પ્રથમ જાડીશું. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ યોગની મુખ્યત્વે બે સંકલ્પનાઓ જાળાવે છે.

“યોગः કર્મસુ કૌશલમ् ।”

“સમત્વમ् યોગમુચ्यતे ।”

મહર્ષિ પતંજલિ, જે વૈજ્ઞાનિક યોગના પ્રણેતા માનવામાં આવે છે તેમણે યોગની વ્યાખ્યા નીચે મુજબ કરી છે.

“યોગः ચિત્તવૃત્તિ નિરોધः ।”

આ ઉપરાંત યોગની અન્ય કેટલીક વ્યાખ્યાઓ આપણે ટૂંકમાં જાડીશું. આ પરથી તમને ખ્યાલ આવશે કે યોગ ખરેખર શું છે. યોગ કોઈ કસરત કે ધર્મ નથી. તે ચયત્કાર કે સૌન્દર્ય પ્રામિ કરવાનું સાધન નથી. પરન્તુ તે તો જીવન જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જીવનના લક્ષ્ય સુધી પહોંચવાનો આધ્યાત્મિક માર્ગ છે. ઈશ્વરને મેળવવાનો રસ્તો છે. સુખ ભૌતિક પદાર્થોમાં નહિ પરન્તુ આપણી અંદર છે, આ બાબત સમજાવી યોગ સુખ પ્રામિના સાધન તરીકે કાર્ય કરે છે. આ યોગ વિશે હવે આપણે ઊંડાશપૂર્વક વાત કરીશું.

3.3 શ્રીમદ ભગવદ ગીતા અનુસાર યોગ

“યોગः કર્મસુ કौશલમ् ।”

અર્થાત् “કર્મમાં કુશળતા જ યોગ છે.”

શ્રીમદ ભગવત ગીતામાં યોગની આ વ્યાખ્યામાં ‘કર્મ’ અને ‘કુશળતા’ એ બે શબ્દો સમજવા જરૂરી છે. યોગની આ વ્યાખ્યા સમજી શકાશે,

આખી જિંદગી મામાણિકતાપૂર્વક બધાં કાર્યો કરવાં તેને કર્મ કહી શકાયે? ધન, સત્તા તથા ભૌતિક સુખસર્વદો મેળવવા કરેલાં કાર્યો કર્મ ગણાય? કર્મને સાદી ભાષામાં કાર્ય કહી શકાય પરન્તુ ક્ષું કાર્ય? કાર્ય કઈ રીતે કરવું? મૃત્યુનો સમય જ્યારે નજીક આવે છે, ત્યારે જીવનનાં તમામ ભૌતિક સુખો નિરર્થક લાગે છે. મરનારનું કલ્યાણ કરવા સૌ ધાર્મિક પુસ્તકોનું વાંચન, દાન વગેરે કરે છે. ભાવતા ભોજનની જગ્યાએ ગંગાજળ તથા તુલસીપત્ર આપાય છે. આવાં કાર્યો આપણે કરીએ છીએ છતાં સૂક્ષ્મ રીતે સમજતા નથી. અર્થાત માનવજીવનનું ઘેય જીજો તથા તે પ્રાપ્ત કરવા માટે કાર્ય કરો. યોગશાસ્ત અનુસાર જીવનમાં કરેલ કાર્યો અંતે તો નિરર્થક જ બની જાય છે. કારણ કે જીવનના અંતિમ લક્ષ્ય પ્રતિ આપણી જીગૃતિ નથી. આત્મસાક્ષાત્કાર અથવા તો સાચા સુખની માઝિ આપણા જીવનનું અંતિમ ઘેય છે. અને જે કાર્ય આપણને અમુક ઘેય સુધી પહોંચાડવામાં મદદ કરે અથવા પહોંચાડે છે, તેને જ સાચા અર્થમાં કર્મ કહેવાય છે. એટલે કે જીવનનો જે અંતિમ ઘેય વિચાર્ય હોય તેને પ્રાપ્ત કરવા કરેલાં કાર્યો જ કર્મની અંદર આવે, અન્ય નહિ.

હવે, કુશળતાનો અર્થ સમજીએ આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ફળ મળે છે. સારાં કામનાં સારાં અને ખરાબ કામનાં ખરાબ ફળ મળે છે. પરન્તુ આપણે કુશળતા તો આ કાર્યનું જે ફળ મળે છે તેમાં આસક્તિ ન રહે તેમાં પ્રાપ્ત કરવાની છે. આપણે સહજ રીતે ઘણાં કાર્યો કરીએ છીએ જેમ કે શાસ લઈએ તો ફેફસાં પર બોજો નથી પડતો એ જ રીતે આંખો પટપટાવીએ તો આંખો પર બોજો નથી પડતી. આ ડિયાઓ આપણે પ્રયત્નપૂર્વક કરતા નથી. આ રીતે કરેલા કાર્યો સારા હોય કે ખરાબ કર્મફળ સર્જીતું નથી. કાર્યો કરવા છતાં તેની માયામાં બંધાય નહિ તે કુશળતા.

કર્મમાં કુશળતા એને કહેવાય જ્યારે એ કર્મ આપણને બંધનમાં નાખતું નથી. ફળની આશાં સાથે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે સુખ કે દુઃખ કોઈ પણ ફળ પ્રદાન થાય છે અને જે સુખ કર્મ દ્વારા મળે છે, તે પણ કેટલાક સમય બાદ દુઃખમાં ફેરવાઈ જાય છે. આથી, કર્મની કુશળતા એને કહેવાય જ્યારે આપણે કર્મના ફળની આશાનો ત્યાગ કરીને માત્ર કર્તવ્ય સમજીને નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરીએ. આ રીતે ફળ તો મળે છે, પરન્તુ કર્મફળની ઈચ્છા ન હોવાથી આપણે બંધનમાં નથી આવતા અને ધીમે-ધીમે જીવનના અંતિમ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ.

“સમત્વમ् યોગમુચ્યતे ।”

અર્થાત् યોગ એટલે સમતા

શ્રીમદ ભગવતગીતામાં કરેલી યોગની વ્યાખ્યાઓ પૈકીની એક વ્યાખ્યા આ છે. જે સ્થિતિમાં શરીર અને મનની સમતા છે, તે વિશેષ અવસ્થા એટલે યોગ આ સમતાને બે અર્થમાં લઈ શકાય છે.


1) વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વની સમતા

2) વ્યક્તિના બહારના વર્તનની સમતા

મનુષ્ય વ્યક્તિત્વ વિશે આપણે આગળ માનસિક સ્વાસ્થ્યમાં સમજીશું. આ વ્યક્તિત્વના મુખ્યત્વે પાંચ વિભાગ છે, જે નીચેની આકૃતિ પરથી સમજી શકાય છે.

શરીર, પ્રાણ, મન અને બુધ્ય આ બધામાં સમતા જ યોગ છે. સામાન્ય રીતે આપણું શરીર અને મન સાથે નથી હોતું. શારીરિક કાર્ય કરીએ છીએ તો ઘણી વાર મન સાથે નથી રહેતું. ઘણી વખત માનસિક એવા વિચારો આવતા રહે છે, જેમાં શરીર અને શાસ સાથે નથી હોતા, ન તો બુધ્ય સહકાર આપે છે. આ પરથી સમજી શકાય છે કે આપણી અંદર જ કેટલી અસમતા છે. આ અસમતામાંથી આપણે બહાર નીકળી સંપૂર્ણ સમતા પ્રાપ્ત કરવાની છે, જેને યોગ કહેવાય છે.

સાથે-સાથે બહારના વર્તનમાં પણ સંપૂર્ણ સમતાની જરૂર છે. વિવિધ વિપરીત અવસ્થાઓ જેમ કે, સુખ-દુઃખ, શીત-ઉષ્ણા, માન-અપમાન, પાપ-પુણ્ય વગેરેમાં મનને સમાન સ્થિતિમાં રાખવું તે જ યોગ છે.



આમ, સમતા જ યોગ છે. દરેક પરિસ્થિતિને સમાન ગણવી, અને અંતિમ લક્ષ્યને પામ કરવા માટે આગળ વધા જવું જોઈએ.

3.4 મહર્ષિ પતંજલિ અનુસાર યોગ

“યોગ: ચિત્તવૃત્તિ નિરોધः ।”

અર્થાત् ચિત્તવૃત્તિને રોકવી તે યોગ છે

મહર્ષિ પતંજલિએ તેમના યોગદર્શનના પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે “યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ” ચિત્તવૃત્તિને રોકવાથી જીવનનું અંતિમ લક્ષ્ય મેળવી શકાય છે. ચિત્તવૃત્તિને સમજવા માટે એક ઉદાહરણ લઈએ.

એક સરોવરનું શુધ્ય અને પારદર્શક પાણી છે, જે સ્થિર હોવાના લીધે સરોવરની નીચે બધું સ્પષ્ટ જોઈ શકાય છે. સરોવરમાં કોઈ કારણથી વમળ ઉત્પત્તિથાય, તો નીચે જોઈ શકતું નથી. અહીં આપણે ચિત્તવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. સરોવરનું તાણીયું આત્મા છે. અને આપણે બહાર ઉભા છીએ. વચ્ચે ચિત્તના વિચારોના લીધે વમળ ઉત્પત્તિથાય છે અને બહારથી આપણે આત્માને જોઈ શકતા નથી અર્થાત સમજ શકતા નથી એટલે કે જ્યાં સુધી આપણા મનમાં વિચાર છે, ત્યાં સુધી આપણે આપણાં સ્વરૂપને આત્માને જોઈ નથી શકતા. આ માટે સરોવરના પાણીને શાંત પાડવું પડે, અર્થાત् મનના વિચારો, તરંગોને શાંત પાડવા જોઈએ. જ્યારે સંપૂર્ણ રીતે વિચારશુન્ય અવસ્થા પ્રાપ્ત થશે, ત્યારે આપણે, આપણું વિકિતિવ સંકલિત થશે. એટલે કે બધાં જ સત્યો સમજાઈ જશે.

આપણું મન ખૂબ જ ચંચળ છે. એક સેકન્ડમાં હજારો વિચાર કરી નાબે છે. આ વિચારોમાં મોટાભાગના તો બિનજરૂરી અને નકામા હોય છે. તેઓ આપણા કાર્યને નુકશાન પહોંચાડે છે. કોઈ પણ કાર્ય કરવા લાંબો સમય સ્થિર રહેવું પડે, એટલે કે એકાગ્રતા રાખવી પડે આ એકાગ્રતા માટે પ્રયત્ન કરવો એ જ યોગની પ્રક્રિયા છે:-

ચિત્તવૃત્તિ એટલે કે મનના વિચારો પર કાબૂ આવતાં વિકિતિને પોતાની શક્તિનું ઊંડાણ સમજાય છે. નકામા વિચારોને દૂર રાખીને વિકિતિ યોગમાર્ગમાં આગળ વધતો જાય છે. અને અંતે પરમપદને પ્રાપ્ત કરે છે.

3.5 યોગની અન્ય વ્યાખ્યાઓ

- યોગ એટલે જોડાણ. અગાઉ આપણે એકમાં જાણ્યા તે મુજબ યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે, જે ‘યુઝ’ ધાતુ પરથી આવ્યો છે.
- યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન

- મનની એકાગ્રતા એટલે યોગ
- શરીર, મન, અને ઈન્ડ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવવો તેને યોગ કહે છે.
- યોગ એટલે આત્મસાક્ષાત્કાર

→ તમારી પ્રગતિ ચકાસો

1) ખાલી જગ્યા પૂરો

- 1) યોગની વ્યાખ્યાઓ થયેલી છે.
- 2) યોગ એટલે આત્મા અને નું ભિલન
- 3) મહર્ષિ પતંજલિએ તેમના યોગદર્શનના અધ્યાયમાં યોગની વ્યાખ્યા કરેલ છે.

2) યોગની કોઈપણ ત્રણ વ્યાખ્યા જણાવો.

.....

.....

.....

.....

.....

3) ચિત્તવૃત્તિ પરનો નિરોધ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

4) મનુષ્ય વ્યક્તિત્વ આકૃતિ દોરી સમજાવો.

.....

.....

.....

.....

3.6 સારાંશ

યોગની અનેક વ્યાખ્યાઓમાંથી કેટલીક પારિભાષાઓ આપણે જાડી તે પરથી યોગ ખરેખર શું છે તે વિશે થોડો ધ્યાલ આવ્યો હશે. યોગ એ અધ્યાત્મવિદ્યા છે. તેને સમજવી થોડી કઠોન છે, પરન્તુ જીવનને યોગમય બનાવવું, તેને જીવનમાં (ઉત્તારવું ખૂબ જ કઠિન છે. યોગને સમજ, જાડી, યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ યોગ દ્વારા પરમપદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

3.6 પારિભાષિક શબ્દો

નિરર્થક : અર્થ વગરનું જેનો કોઈ જ મતલબ નથી તેવું

આસક્રિત : કોઈપણ વસ્તુ કે વ્યક્તિ તરફનું આકર્ષણ કે જેંચાણ

અસમતા : સમાનતા ન હોવી તે અથવા તો અમુક વસ્તુ વ્યવસ્થિત ન હોવી તે

ચિત્તવૃત્તિ : ચિત્તના વિચારો એટલે તે મનમાં ચાલતા વિચારો.


3.7 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો

- 1) (1) અનેક
 (2) પરમાત્મા
 (3) પ્રથમ

- 2) (1) યોગ એટલે જોડાણ
 (2) યોગ એટલે સમતા
 (3) યોગ એટલે ચિત્તવૃત્તિ પરનો કાબૂ

3) ચિત્તવૃત્તિને રોકવી તે યોગ છે. મહર્ષિ પતંજલિએ તેના યોગદર્શનના પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરતાં જ્ઞાનાયું છે કે “યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ” ચિત્તવૃત્તિને રોકવાથી જીવનનું અંતિમ લક્ષ્ય મેળવી શકાય છે. ચિત્તવૃત્તિને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. એક સરોવરનું શુદ્ધ અને પારદર્શક પાડી છે, જે સ્થિર હોવાના લીધે સરોવરની નીચે બધું સ્પષ્ટ જોઈ શકાય છે. સરોવરમાં કોઈ કારણથી વમળ ઉત્પન્ન થાય, તો નીચે જોઈ શકાતું નથી. અહીં આપણે ચિત્તવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. સરોવરનું તળીયું આત્મા છે અને આપણે બહાર ઉભા છીએ વચ્ચે ચિત્તના વિચારોના લીધે વમળ ઉત્પન્ન થાય છે અને બહારથી આપણા આત્માને જોઈ શકતા નથી અર્થાત સમજી શકતા નથી એટલે કે જ્યાં સુધી આપણા મનમાં વિગાર છે, ત્યાં સુધી આપણે આપણા સ્વરૂપને આત્માને જોઈ નથી શકતા. આ માટે સરોવરના પાડીને શાંત પાડવું પડે, અર્થાત્ મનના વિચારો, તરંગોને શાંત પાડવા જોઈએ. જ્યારે સંપૂર્ણ રીતે વિચારશુન્ય અવસ્થા પ્રાપ્ત થશે, ત્યારે આપણું વ્યક્તિત્વ સંકલિત થશે. એટલે કે બધાં જ સત્યો સમજાઈ જશે.

4) વ્યક્તિત્વના મુખ્યત્વે પાંચ વિભાગ છે. શરીર, પ્રાણ, મન અને બુધ્યિ આ બધામાં સમતા જ યોગ છે. સામાન્ય રીતે આપણું શરીર જ યોગ છે. સામાન્ય રીતે આપણું શરીર અને મન સાથે નથી હોતું. શારીરિક કાર્ય કરીએ છીએ તો ઘણી વાર મન સાથે નથી રહેતું. ઘણી વખત માનસિક એવા વિચારો આવતા રહે છે, જેમાં શરીર અને શ્વાસ સાથે નથી હોતા, ન તો બુધ્યિ સહકાર આપે છે. આ પરથી સમજી શકાય છે કે આપણી અંદર જ કેટલી અસમતા છે. આ અસમતામાંથી આપણે બહાર નીકળી સંપૂર્ણ સમતા પ્રાપ્ત કરવાની છે, જેને યોગ કહેવાય છે. સાથે-સાથે બહારના વર્તનમાં પણ સંપૂર્ણ સમતાની જરૂર છે. વિવિધ વિપરીત અવસ્થાઓ જેમ કે, સુખ-દુઃખ, શીત-ઉષ્ણ, માન-અપમાન, પાપ-પુણ્ય વગેરેમાં મનને સમાન સ્થિતિમાં રાખવું તે જ ધોગ છે.



એકમ-4: યોગના પરંપરાગત પુસ્તકોનો પરિચય:

યોગ એ ખૂબ જ ગ્રાચીન વિદ્યા છે. તેના વિશે સચોટ માહિતી આપણા પરંપરાગત પુસ્તકોમાંથી મેળવી શકાય છે. આગળના એકમોમાં આપણે યોગ શું છે તથા શું નથી તેના વિશે જાણ્યું. હવે, યોગના પુસ્તકોના પરિચય દ્વારા યોગને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું.

માળખું:

- 4.1 હેતુ
- 4.2 પ્રસ્તાવના
- 4.3 હઠયોગ પ્રદીપિકા
- 4.4 પતંજલિ યોગસૂત્ર
- 4.5 સારાંશ
- 4.6 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

4.1 હેતુ:

આ એકમના અભ્યાસને અંતે તમે :

- તમે હઠયોગના પરંપરાગત પુસ્તકોમાંથી હઠયોગ પ્રદીપિકા વિશે વિસ્તારથી સમજશો તથા તેની પ્રેરણાથી યોગમાર્ગ પર આગળ વધી શકશો.
- મહર્ષિ પતંજલિ રચિત યોગસૂત્ર વિશે પ્રાથમિક માહિતી મેળવી શકશો. યોગસૂત્ર યોગનું વૈજ્ઞાનિક સ્વરૂપ દે.

4.2 પ્રસ્તાવના:

યોગ ભારતીય સંસ્કૃતનું બહુમૂલ્ય અંગ છે. જ્યારે છાપકામની પણ શોધ થઈ નહોતી, ત્યારે ભારતના ઋષિમુનીઓએ આ યોગશાસ્ત્રની શોધ કરી હતી. પ્રથમ તો ચુડુ-શીષ્ય પરંપરા અનુસાર આ તમામ જ્ઞાન મૌખિક હતું. ધીરે-ધીરે આ જ્ઞાન કેટલીક ભાષાઓ જેવી કે સંસ્કૃતમાં રચાયું તથા લખાયું, વિવિધ ઋષિમુનીઓ તથા યોગીઓ અને વિદ્વાનોએ પોતપોતાની રીતે ટીકાઓ પણ કરી. વિવિધ બહુમૂલ્ય ગ્રંથોની રચના પણ થઈ, યોગ એ ખૂબ જ વિશાળ વિવિધ છે. એ જ રીતે તેમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં પુસ્તકો રચાયાં છે. આપણા પરંપરાગત મૂળભૂત ગ્રંથો સંસ્કૃત ભાષામાં હોઈ તેના અનેક અનુવાદો પણ થયા છે. જે વ્યક્તિ તે અનુવાદને જે રીતે સમજ શકે તે ખરું. પોતાની શક્તિ અનુસાર કોઈપણ વ્યક્તિ વિવિધ અર્થોને તથા તેમાં છુપાપેલા રહસ્યોને જાણી શકે છે. કેટલાક પુસ્તકો નીચે મુજબ છે. તેમાંથી મહત્વાના બે વિશે આપણે વિસ્તારથી જાણીશું.

- હઠયોગ પ્રદીપિકા
- યોગસૂત્ર
- ધેરંડ સંહિતા
- શિવસંહિતા

4.3 હઠયોગ પ્રદીપિકા:

'હઠયોગ પ્રદીપિકા'ની રચના સ્વાત્મારામ નામના મહાન યોગી દ્વારા થઈ છે. વિવિધ યોગમાર્ગમાં હઠયોગનું સ્થાન મહત્વાનું છે, જે વિશે આપણે અગાઉ જાણ્યું. આ હઠયોગની સાધના વિશેની વાત આ હઠયોગ પ્રદીપિકામાં છે. હઠયોગ અંગેની એક મહત્વપૂર્ણ તથા અધિકૃત ગ્રંથ ગણાય છે. હઠયોગને લગતા અન્ય વિવિધ સાહિત્યોમાં આનુસ્થાન મહત્વાનું તથા પ્રમાણભૂત છે. તેની રચના ખૂબ જ સુંદર તથા સચોટ છે. ખૂબ જ લંબાશપૂર્વક ન કહેતાં સ્વાત્મારામમાં ચાર મુખ્ય ઉપદેશોમાં હઠયોગની સિદ્ધિ માટેના ચાર મુખ્ય સાધનોની મુદ્દાઝર તેમજ સચોટ માહિતી

સ્વાત્મારામ રચિત આ ગ્રંથની પહેલાં હઠયોગ તથા રાજ્યોગ બને બ્રિન્ન-બ્રિન્ન યોગમાર્ગ તરીકે પ્રસિદ્ધ હતા. સ્વાત્મારામે આ બંનેનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાત્મારામના મતે હઠયોગ માત્ર એક સાધન છે, જેના દ્વારા રાજ્યોગ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. રાજ્યોગ વિના હઠયોગ માત્ર ખોટો પ્રયાસ જ છે. આ મત હઠયોગ પ્રદીપિકાનો છે.

હઠયોગ :

હઠયોગ વિશે તો આપણે આગળ સમજવાના જ છીએ, પરંતુ છતાં અહીં ખૂબ જ ટૂંકાખમાં તેના વિશે માહિતી મેળવી લઈએ. જેથી વધુ સારી રીતે તમે સમજ શકશો.

હઠયોગમાં ‘હ’ અર્થાત સૂર્ય અને ‘ઠ’ અર્થાત્ ચંદ્ર. આ યોગમાં સૂર્ય તથા ચંદ્રનો યોગ - એક્ય થવાના લીધે હઠયોગ તરીકે ઓળખાય છે. હઠયોગ એટલે આસન, પ્રાણાયામ તથા મુદ્રાઓના પદ્ધતિસરના અભ્યાસપૂર્વક, કુંડલીની જાગરણ દ્વારા સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવા માટેની સાધન પદ્ધતિ.

આમ, હઠયોગ એ યોગના વિવિધ યોગમાર્ગમાંનો એક માર્ગ છે, જેણું લક્ષ્ય સમાપ્તિ છે, અર્થાત્ ઈશ્વરસાક્ષાત્કાર કે મોક્ષ છે.

હઠયોગના જુદા જુદા ગ્રંથોમાં સાધનનાં અંગો અને તેના કામમાં વિવેપતા જોવા મળે છે. શ્લોકોની સંખ્યા પણ 331, 401, 500 વગેરે જુદી જુદી છે. આપણે અહીં સ્વાત્મારામ રચિત હઠયોગ પ્રદીપિકાને પ્રમાણભૂત અથ ગણીને તેનો અભ્યાસ કરીશું.

હઠયોગ પ્રદીપિકા :

હઠયોગ પ્રદીપિકામાં કુલ ચાર પ્રકરણો આર્થાત્ સાધના પદ્ધતિ છે, જેને ઉપદેશ એવું નામ આપવામાં આવ્યું છે. ચારેય ઉપદેશોમાં શ્લોકોની સંખ્યા અનુક્રમે $67 + 78 + 130 + 14 =$ કુલ 389 છે. આ ચારેય ઉપદેશોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને હઠયોગમાં સિદ્ધ મેળવી શકાય છે.

પ્રથમ ઉપદેશ : આસનવિધિકથન

- પ્રથમ ઉપદેશને આસનવિધિકથન કહેવામાં આવે છે.
- પ્રથમ ઉપદેશની શરૂઆતના પ્રથમ તથા દ્વિતીય બંને શ્લોક મંગલાચરણના છે. તેમાંથી પ્રથમ શ્લોક ‘ઘરડસંહિતા’ નામના ગ્રંથનો છે. બીજા તથા ત્રીજા શ્લોકમાં સ્વાત્મારામનું નામ આવે છે.
- હઠયોગીના જીવન પદ્ધતિ વિશે આ ઉપદેશમાં જાળવાયું છે. હઠયોગ માટે ભિતાછાર ઉત્તમ છે. ઘઉં, ચોખા, જવ, દૂધ, ધી, માખાણ, ભાજી, લીલા ચણા વગેરે ઉત્તમ ગણાય છે.
- હઠયોગીના ગુણો વિશે જણાવતાં સ્વાત્મારામ કહે છે કે તે ધીરજ, સાહસ, ઉત્સાહ, સંકલ્પ તથા અભ્યાસ અને શ્રદ્ધા પરાવતો હોવો જોઈએ.
- હઠયોગીના રહેવાના સ્થળ વિશે જણાવાયું છે કે તે ગુરુની નજીક એકાંતમાં કુટિરમાં રહેતો હોવો જોઈએ.
- હઠયોગમાં આસન પંચલિં રચિત અષાંગ્યોગની જેમ સ્થિર તથા સુખપૂર્વક કરવામાં આવતા નથી. અહીં આસન એક વિશિષ્ટ શારીરિક સ્થિતિ છે, જેના દ્વારા પ્રાણ નચારનો દેતું સિદ્ધ કરવામાં આવે છે. આસન અભ્યાસથી કુંડલીની જાગરણની પ્રક્રિયામાં મદદ મળે છે, તેમ પણ કહેવાયું છે.
- સ્વાત્મારામના મતે રાજ્યોગનું ફળ પ્રાપ્ત કરવા માટે જરૂરી એવાં મુખ્ય આસનો વસિષ્ઠ વગેરે મુનીઓ તથા મત્સ્યેન્દ્ર વગેરે યોગીઓ વડે કહેવામાં આવ્યાં છે, જે નીચે ગુજરાત છે.

- स्वस्तिकासन
- गोमुखासन
- वीरासन
- धनुरासन
- भत्येन्द्रासन
- पश्चिमोत्तानासन
- फूर्मासन
- कुक्कुटासन
- उत्तानकुर्मासन
- भयूरासन
- शवासन

આ વિવિધ આસનોમાંથી કેટલાંક આસનોનો આપણે પ્રાયોગિકમાં અભ્યાસ કરીશું.

- અંતે, મિતાધારનું વિસ્તારથી વર્ણન કરીને પ્રથમોપદેશ પૂર્ણ કરે છે.

દ્વિતીય ઉપદેશ : પ્રાણાયામકથન :

- આસન બાદ પ્રાણાયામના અભ્યાસ વિશે વાતો આ દ્વિતીય ઉપદેશમાં કરવામાં આવી છે.
- ગુરુના ઉપદેશ પ્રમાણે જ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ, તેમ સૌ પ્રથમ જણાવવામાં આવ્યું છે.
- પ્રાણાયમ હઠયોગની કેન્દ્રસ્થ સાધના છે. પૂર્ક-કુંભક-રેચક, એ મુજબ હરરોજ સવારે, બપોરે, સાંજે તથા મધ્યરાત્રિએ ધીરે-ધીરે 80 વખત અભ્યાસ કરવાનું જણાવાયું છે.
- ષટ્કર્મનું મહત્વ સમજવતાં તેનું નિરૂપણ થયું છે. ષટ્કર્મ નીચે પ્રમાણે છે.

- (1) ધૌતિ
- (2) બસ્તિ
- (3) નેત્રી
- (4) ત્રાટક
- (5) નૌલી
- (6) કપાલભાતી

- ષટ્કર્મના વર્ણન બાદ આઠ પ્રકારના કુંભકો (પ્રાણાયામ)નું વર્ણન છે :

- (1) સૂર્ય લેદન પ્રાણાયામ
- (2) ઉજાયી પ્રાણાયામ
- (3) સીતકારી પ્રાણાયામ
- (4) શીતલી પ્રાણાયામ
- (5) ભસ્ત્રિકા પ્રાણાયામ
- (6) ભામરી પ્રાણાયામ
- (7) મૂર્ખર્ણ પ્રાણાયામ
- (8) ખાવીની પ્રાણાયામ

- પ્રાણાયામમાં કુંભક, રેચક તथા પૂરકનો સમાવેશ થાય છે, જેમાં કુંભક મુખ્ય છે. કુંભકના બે પ્રકાર પડે છે.
- પ્રાણાયામનું મહત્વ તથા ઉપયોગિતા દર્શાવી, અહીં દ્વિતીય ઉપદેશ પૂર્વી કરવામાં આવ્યો છે.



દ્વિતીય ઉપદેશ : મુદ્રા કથન

આસન અને પ્રાણાયામની જેમ બંધ, મુદ્રા પણ કુંડલીની જાગરણ માટેની સાધના છે. મુદ્રામાં આસન અને પ્રાણાયામ એ બંનેનો સમન્વય સાધવામાં આવે છે, તેથી આ અભ્યાસ વધુ અસરકારક અને જોખમી છે. આસન-પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કર્યા હોય અને શરીર પ્રાણને તૈયાર કર્યા બાદ આનો અભ્યાસ કરવો.

બંધ એટલે કે શરીરના સાયુઓને વિશિષ્ટ સ્થિતિમાં બાંધીને રાખવા, એથી શરીરમાં ઊર્જાને વિશિષ્ટ જગ્યાએ બાંધી રાખવી પડે છે. શરીરમાં મુદ્રા દ્વારા મન સ્થિર થાય છે અને એવી મનોશારીરિક સ્થિર સ્થિતિ થાય છે, જે આપણા મનને વિશિષ્ટ સ્થિતિમાં બાંધી રાખે છે.

કુંડલીની બંધ કરવનારી દસ મુદ્રાઓનું વર્ણન નીચે મુજબ છે, જેનો મહર્ષિ પતંજલિ રચિત યોગસૂત્રમાં ઉલ્લેખ નથી.

- મહામુદ્રા
- જેયરી
- મહાવેદ
- વજોલી
- શક્કિયાલન
- ઉડીયાનબંધ
- જાલંઘર બંધ
- મૂલબંધ
- વિપરીતકરણી
- મહાબંધ

દેરંડસહિતામાં આ સિવાય પણ ધર્ષણી મુદ્રાઓનું વર્ણન છે. તેમાં અચિનીમુદ્રા, ભુજંગીમુદ્રા, માંડુકીમુદ્રા વગેરે નાંધનીય છે.

ઉપરોક્ત મુદ્રાઓ શ્રીગુરુ આદિનાથ શંકરે કહેલી છે, તેથી તેનો ઉપદેશ કરનાર પણ સ્વાત્મારામના મતે સાક્ષાત્ ઈશ્વર જ છે. આ મુદ્રાઓના અભ્યાસથી વ્યક્તિ અમર થઈ જાય છે એટલે કે મૃત્યુનો ડર નથી રહેતો. આ અભ્યાસ દેવતાઓ માટે પણ દુર્લભ છે, તેથી રત્ના પિતારાની જેમ ધૂપાયેનો રાખવો જોઈએ. આ મુદ્રાઓ અણિમા, ભાહિમા વગેરે આઠ સિદ્ધિઓ આપનારી છે.

ચોથો ઉપદેશ : સમાધિલક્ષણ

સુષુપ્તાનો માર્ગ ખુલતાં કુંડલીની જાગૃત થવા માટે છે અને ઉપર ઉઠવા માટે છે. એક-એક ચક ભેદ કરીને શરીરમાં નાદ પેદા કરશો. આ નાદને અનુસંધાન કરીને પકડતું એ જ નાદાનુસંધાન, અવાજ બે કે તેથી વસ્તુના કંપની તથા નાદ આધાત કે ધર્ષણથી પેદા થાય છે એ ખાસ ધ્યાન રાખવું. સતત અને નિરંતર ભક્તિ દ્વારા જ આ પ્રામ કરી શકાય છે. મન પ્રાણનો પારસ્પરિક સંબંધ છે. મન ઈન્દ્રસ્વામિ છે, મનનો સ્વામિ પ્રાણ છે પ્રાણનો નાથ લય છે અને લયનો સ્વામિ નાદ છે.

જેમ પાણીમાં મીહું એકરસ થઈ જાય તેમ આત્મા અને મન એક થઈ જાય તેને સમાધિ કહે છે. પ્રાણ મંદ થઈ ચિત્તમાં લીન થઈ જાય ત્યારે બંનેની એકરૂપતા થવાના લીધે સમાધિ ભણે છે. આ એકરૂપતા અને સમતા થવાથી ઈચ્છાનો. અભાવ થાય છે, અર્થાત્ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય છે જેને સમાધિ કહેવાય છે. સમાધિની અવસ્થા શુન્ય પણ છે અને પૂર્ણ પણ છે. ખુલ્લા આકાશમાં મૂકેલ ઘડાની જેમ પડા છે. સાગરમાં ડૂબાડી રાખેલા ઘડાની જેમ પૂર્ણ પણ છે. ત્યારબાદ, અંતે રાજ્યોગપદ પર આરૂપ થઈ ગયેલા યોગીનું લક્ષ્ણ આપી ગ્રંથનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.

- સમાધિ એ યોગની ખૂબ જ ઉચ્ચસ્તરની પ્રક્રિયા છે, તેના અર્થ વિશે આપણે રાગળ સમજીશું. સામાન્ય ભાષામાં કહીએ તો ; જેમ પાણીમાં મીહું એકરસ થઈ જાય તેમ આત્મા અને મન એક થઈ જાય તેને સમાધિ, મોક્ષ, આત્મસાક્ષાત્કાર વગેરે કહી શકાય.
- સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ, તેનો અર્થ, મહત્વ વગેરે વિશે વાતો કરવામાં આવી છે.
- ત્યારબાદ, અંતે રાજ્યોગ પદ પર આગળ વધેલ યોગીનાં લક્ષ્ણો દર્શાવી આ ગ્રંથનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.

હઠયોગની અન્ય બાબતો :

- કેટલાક સ્થળે હઠયોગપ્રદીપિકામાં પાંચમો ઉપદેશ જોવા મળે છે. પણ તેમાં ખોટી રીતે થયેલી સાધનાથી ઉદ્ભવતા દોષોને કાબૂમાં લાવવાની રીતો આપવામાં આવી છે, જેને હઠયોગ સાથે સંબંધ નથી. પાંચમા ઉપદેશની રચના પણ નભણી છે. ચોથા ઉપદેશમાં ફળશુદ્ધિ આપી ઉપસંહાર પણ કરવામાં આવ્યો છે. ખોટી રીતે સાધના કરવામાં આવતાં જે દોષો ઉદ્ભવે છે તે બધાને કાબૂમાં લેવા, ચિકિત્સાર્� આ ઉપદેશ છે, એમ માનવામાં આવે છે.
- એ વાત સારી છે કે, ‘હઠયોગપ્રદીપિકા’, ‘ગોરક્ષશતક’, ‘ધેરંડસંહિતા’ વગેરે હઠયોગના ગ્રંથોમાં યમ-નિયમનો યોગાંગો તરીકે વિચાર થયેલો ખાસ જોવા મળતો નથી, પરંતુ એનો અર્થ એ નથી કે હઠયોગના સાધકને તેની આવશ્યકતા નથી. સમગ્ર ભારતીય સાધનામાં યમ-નિયમ પાયારુપ અને સર્વસામાન્ય સાધના હોવાથી તેની અનિવાર્યતા અને આવશ્યકતા કષ્ટ વગર સમજ લેનાની હોય. ‘સિદ્ધ-સિદ્ધાંત પદ્ધતિ’ તથા ‘વશિષ્ઠ સંહિતા’માં યમ-નિયમનું વિશદ વર્ણન જોવા મળે છે.
- સાધકની જીવન પદ્ધતિ વિશે પણ પ્રથમ ઉપદેશમાં જીવાવવામાં આવ્યું છે. હઠયોગી માટે મિતાહાર ઉત્તમ છે. ઘઉં, ચોખા, જવ, દૂધ, ધી, માખણ, ભાજી, લીલા ચણા, સૂર્ય, મધ્ય નક્ષત્રમાં હોય ત્યારે એકહું કરેલું પાણી ઉત્તમ ગણાય છે. તેનું કુટિર એકાંતમાં, ગુરુની નજીક લોવું જોઈએ. તેને ધીરજ, સાહસ, ઉત્સાહ, સંકલ્પ, લોકસંગનો પરિત્યાગ, અભ્યાસ અને શ્રદ્ધા, આ જરૂરી છે.

4.4 પંતંજલિ યોગસૂત્ર :

યોગ એ ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ જૂનું તથા સચોટ પાસું છે. યોગવિદ્યાની શરૂઆત ખૂબ જ પ્રાચીન છે. કોણે અને ક્યારે તેની શોધ કરી તે જાણી શકાયું નથી. આથી આવી ઉપકારક બાબત ઈશ્વર દ્વારા કહેવામાં આવી છે, એવું સ્વીકારાયું છે.

યોગનું જ્ઞાન ગુરુ-શીખ પરંપરા અનુસાર ધીરે-ધીરે વિસ્તરનું ગયું. મહર્ષિ પંતંજલિએ તનો ખૂબ જ ઊડાળપૂર્વક અભ્યાસ કર્યો તથા તે આખા જ્ઞાનને વૈજ્ઞાનિક સ્વરૂપ આપી યોગસૂત્રની રચના કરી. આ યોગસૂત્રની રચનાઓ ખૂબ જ ઉચ્ચતમકોટિની છે. તેની વિશેષતા એ છે કે સામાન્ય વ્યક્તિ પણ યોગનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરી શકે છે. તેમાં દરેક પ્રકારના માણસો માટે વ્યવસ્થા છે.

મહર્ષિ પતંજલિએ આખા યોગસૂત્રને મુખ્યત્વે ચાર ભાગોમાં વહેંચી દીકું છે :

- (1) સમાધિપાદ
- (2) સાધનપાદ
- (3) વિભૂતિપાદ
- (4) કેવલ્યપાદ

સમાધિપાદ

- સમાધિપાદના પ્રથમ સૂત્રમાં પતંજલિમુની અનુશાસનની વાત કરે છે એટલે કે યોગ એ અનુશાસન છે, એમ જાળાવી આગળ યોગની વ્યાખ્યા કરે છે.
- યોગની વ્યાખ્યા કરતા બીજા સૂત્રમાં ‘યોગ એટલે ચિત્તવૃત્તિ પરનો નિરોધ’ એમ જાળાવવામાં આવ્યું છે.
- વૃત્તિઓ તથા નિરોધની વાત આગળ લંબાવી અભ્યાસ તથા વૈરાગ્યની વાતો રચવામાં આવી છે. સતત તથા લાંબો સમય અભ્યાસ કરવાથી તથા વૈરાગ્યથી સમાધિ પ્રાપ્ત કરવાની વાતો છે.
- આથી આગળ ઈશ્વરનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરની વ્યાખ્યા, નામ, સ્વરૂપ, પ્રમાણ, ઈશ્વરપ્રાણિધાન વગેરે વિશે તે જાળાવે છે.
- સાધનમાં આવતા અંતરાયો તથા ઉપવિધનોની વાત કરી તેના નિવારણના ઉપાય પણ બતાવ્યા છે.
- સમાધિની અવસ્થાની વાતો કરી, અંતે પ્રથમ પાદ પૂર્વી કરવામાં આવ્યો છે.
- આ સમાધિપાદના કેટલાંક સૂત્રોનું વિસ્તારથી વર્ણન આપણે આગળના એકમમાં જાડીશું, જેથી આ વિશે વધુ સારી રીતે જાળકારી મેળવી યોગમાર્ગમાં સરળતાથી આગળ વધી શકીશું.

સાધનપાદ

સાધનપાદમાં સાધનાના નિશ્ચિત સ્તર સુધી માહિતી છે, જેથી સાધનની ચોક્કસ આધ્યાત્મિક પ્રગતિ થાય છે તથા સાધનપાદમાં સાધનાના નિર્ધિત સ્તર સુધી માહિતી છે, જેથી સાધનની ચોક્કસ આધ્યાત્મિક પ્રગતિ થાય છે તથા મહર્ષિ પતંજલિએ યોગના નવા અભ્યાસીની ઉપેક્ષા નથી કરી. તેમના માટે પણ સચોટ માર્ગદર્શન આપ્યું છે.

સાધનપાદમાં જાળાવવામાં આવ્યું છે કે સાધનાની શરૂઆત કઈ રીતે શરૂઆત કરી નિર્ધિત આગળ વધી શકાય. આ રીતે એકદમ નવા યોગાભ્યાસીને પ્રેરણ આપી છે.

- કિયાયોગથી શરૂઆત કરતાં મહર્ષિ પતંજલિએ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણધાનનું મહત્વ બતાવ્યું છે.
- ત્યારબાદ વિવિધ કલેશોની સમજ આપી તેના નિવારણની વાત વિસ્તારપૂર્વક કરવામાં આવી છે.
- અષ્ટાંગયોગ અર્થાત્ સમાધિ પ્રાપ્ત કરવાના આઠ પગથિયાં છે. જેનું વર્ણન ખૂબ જ વિસ્તારથી તથા તેનું ફળકથન પણ કર્યું છે.
- અષ્ટાંગયોગ : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા અંતે સમાધિ - દરેકની વ્યાખ્યા, પ્રકારો, ફળ વગેરે વાતો કરતા-કરતા, તેનું મહત્વ દર્શાવી સાધનપાદ સંપૂર્ણ કર્યો છે. છતાં અહીં ધ્યાન તથા સમાધિની સ્થિતિનું વર્ણન નથી, જે આગળ વિભૂતીપાદમાં દર્શાવાયું છે.

વિભૂતિપાદ

- વિભૂતિપાદ એ પતંજલિના યોગસૂત્રમાં ગ્રીજું પાદ છે. તે ની શરૂઆત યોગની ઉચ્ચતમ સ્થિતિ ધારણા-ધ્યાનથી થાય છે. આગળના સાધનપાદના અષ્ટાંગયોગના અદ્દરો સૂત્રો અહીં પ્રથમ ચાર કામમાં સમાવવામાં આવ્યાં છે.
- યોગસાધકને યોગાભ્યાસ દ્વારા શું પ્રાપ્ત થશે, જે આ પાદમાં બતાવ્યું છે. ઐશ્વર્ય કે ઘ્યાતિ પ્રાપ્ત થતી હોવાથી તેને વિભૂતિપાદ એવું નામ આપવામાં આવ્યું છે.
- ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેય નાટે મહર્ષિ પતંજલિએ ‘સંયમ’ એવો શષ્ટ વાપરીને સંયમનાં

વિવિધ ફળ બતાવ્યાં છે, જેને યોગનું મહત્વ કે સિદ્ધિ કે વિભૂતિ કહે છે.

- અંતે સાધકે સિદ્ધિઓથી આકાર્ષિત ન જવું જોઈએ, એમ જાણાવી સાચા માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

કેવલ્યપાદ

- આ ચોથા પાદમાં કેવલ્ય પ્રાપ્ત કરવા યોગ્ય ચિત્તના સ્વરૂપ વિશે વાત કરી છે. સાથે સાથે યોગદર્શનના સિદ્ધાંતમાં જે જે શંકાઓ હોઈ શકે છે, તેનું સમાવાન કર્યું છે.
- અંતે ધર્મમેધ સમાધિનું વર્ણન કરીને તેના ફળ તથા ગુણો વિશે વાત કરી છે.
- કેવલ્ય-સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવી, તે સ્થિતિનું વર્ણન કરી ગ્રંથને પૂર્ણ કર્યો છે.

અન્ય બાબતો :

- મોટાભાગનાં યોગનાં દરેક પુસ્તક કે ગ્રંથમાં આસનોનું વર્ણન જરૂરી હોય છે, પરંતુ મહર્ષિ પતંજલિના યોગસૂત્રમાં એકપણ આસનનું નામ કે વર્ણન નથી. તેમણે માત્ર આસનની વ્યાખ્યા તથા તેનું મહત્વ અને શાયદાની વાત કરી છે. આસન સ્થિરતા અને સુખપૂર્વક કરાય છે એમ જાણાવી સાંનું માર્ગદર્શન પુરું પાડે છે. તેમના દરેક શબ્દ તથા સૂત્રને ખૂબ જ ઉંડાણથી સમજવો જરૂરી છે.
- વિવિધ યોગમાર્ગમાંથી પતંજલિ મુનીએ અણાગયોગની રચના કરી અને તેના દરેક પાસાનું વિસ્તૃતમાં વર્ણન કર્યું છે. જેઓ યોગમાર્ગના નવા વિદ્યાર્થી છે, જેઓ યોગ વિશે જાણતા નથી, તેમનો પણ પતંજલિ મુનીએ વિચાર કર્યો છે. ખૂબ જ સરળતાથી સમજાય તેવાં આઠ પગથિયાનું વિસ્તૃતમાં વર્ણન કરી નવા વિદ્યાર્થીનો માટે એક માર્ગદર્શકનું કામ કર્યું છે.
- મહર્ષિ પતંજલિની રચનાઓ અદ્ભૂત છે. વૈજ્ઞાનિકરૂપમાં ખૂબ જ સુંદર સમજ આપી છે. વર્ષો પદેલાં થયેલ આ રચનાઓ એટલી સચ્ચોટ અને સુંદર છે કે આજના આધુનિક યુગમાં પણ તે ફરેકને ઉપયોગી બના શકે તેમ છે.

તમારી પ્રગતિ ચકાસો :

(1) યોગનાં પરંપરાગત પુસ્તકોનાં નામ આપો.

.....
.....
.....
.....
.....

(2) 'દધ્યોગ પ્રદીપિકા'ના રચયિતા કોણ હતા ?

.....
.....

(3) 'દધ્યોગ પ્રદીપિકા'માં કેટલા ઉપદેશો છે ? કયા કયા ?

.....
.....
.....
.....
.....

- (4) મુદ્રા એટલે શું? પરંપરામાં કઈ મુદ્રાઓનું વર્ણન છે?

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

- (5) પતંજલિ મુનીએ ક્યા યોગનું વર્ણન કર્યું છે? તેનાં પગથિયાં જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

- (6) ‘યોગસૂત્ર’માં કટલા પાદ છે? ક્યા કયા? દરેકમાં કઈ બાધતનો સમાવેશ કરવામાં આવ્યો છે? ટૂંકમાં જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

4.5 સારાંશ :

યોગના પ્રમાણભૂત ગ્રંથોમાંથી હઠયોગ પ્રદીપિકા તથા યોગસૂત્રો વિશે આપણે જાણ્યું. હજારો વર્ષો પહેલાં થયેલ આ રચનાઓ આજના સમયમાં પણ બંધ બેસે છે. બંને ગ્રંથોનો આધાર લઈ અન્ય ઘડાં પુસ્તકો લખાયાં છે તથા ટીકાઓ કરાઈ છે. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ ગ્રંથોનું માર્ગદર્શન મેળવીને યોગમાર્ગમાં સરળતાથી આગળ વધી શકાય છે.

4.6 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

- (1) ● હઠયોગ પ્રદીપિકા
- પતંજલિ યોગસૂત્ર
- ધૈર્યસંહિતા
- શિવસંહિતા

(2) સ્વાત્મારામ

(3) ચાર ઉપદેશો છે :

- (1) આસનવિધિકથન
- (2) પ્રાણાયામકથન
- (3) મુદ્રાકથન
- (4) સમાવિલક્ષણ


(4) મુદ્રાની વ્યાખ્યા :

આસન અને પ્રાણાયામની જેમ બંધ, મુદ્રા પગ કુંડલીની જાગરડા માટેની સાધના છે. મુદ્રામાં આસન અને પ્રાણાયામ એ બંનેનો સમન્વય સાધવામાં આવે છે, તેથી આ અભ્યાસ વહુ અસરકારક અને જોખમી છે. આસન-પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કર્યો હોય અને શરીર પ્રાણ રે તેયાર કર્યા બાદ આનો અભ્યાસ કરવો.

કુંડલીની બંધ કરાવનારી દસ મુદ્રાઓનું વર્ણન નીચે મુજબ છે,

- મહામુદ્રા
- ખેચરી
- મહાવેદ
- વજોલી
- શક્કિયચાલન
- ઉડીયાનબંધ
- જાલંધર બંધ
- મૂલબંધ
- વિપરીતકરણી
- મહાબંધ

(5) પતંજલિ મુનીએ અષ્ટાંગયોગનું વર્ણન કર્યું છે તેના પગથિયા નીચે મુજબ છે.



(6) યોગસૂત્રમાં ચાર પાદનું વર્ણન છે.

- (1) સમાવિપાદ
- (2) સાધનપાદ
- (3) વિભૂતિપાદ
- (4) ક્રવલ્યપાદ

દરેક પાદમાં મુખ્યત્વે નાચેની બાબતોનો સમાવેશ કરવાનાં આવ્યો છે.

- | | | |
|----------------|---|--|
| (1) સમાવિવાદ | : | <ul style="list-style-type: none"> ● ચિત્તની વૃત્તિઓ ● હશ્ચ ● અંતરાયો અને તેનું નિવારણ |
| (2) સાધનપાદ | : | <ul style="list-style-type: none"> ● કિયારોગ ● કલેજ અને તેનું નિવારણ ● અષ્ટાંગયોગનાં પાંચ પગથિયાં |
| (3) વિભૂતિપાદ | : | <ul style="list-style-type: none"> ● અષ્ટાગયોગનાં ગ્રાશ પગથિયા ● અભ્યાસ દ્વારા પ્રાપ્તિ |
| (4) ક્રવલ્યપાદ | : | <ul style="list-style-type: none"> ● ચિત્તનાં સ્વરૂપો ● શંકારો અને સમાધાન ● સમાધિનું વર્ણન |

એકમ-5 : યોગસૂત્રોનો અભ્યાસ :

આગણના એકમમાં આપણે મહર્ષિ પતંજલિ રચિત ‘યોગસૂત્ર’ વિશે અભ્યાસ કર્યો. આ યોગસૂત્રોમાંથી કેટલાક અર્દી ૨૪૪ કરવામાં આવ્યા છે. જેથી યોગસૂત્રને વધારે સારી શીતે સમજ શકાય. આ ઉપરાંત મહર્ષિ પતંજલિની ઉત્તમ રચનાઓ જાડી શકાય. વૈજ્ઞાનિક દાસ્તિકોણથી યોગાભ્યાસ કરવામાં આ યોગસૂત્રો મૂલ જ ઉપયોગી નીવડે છે.

માળખું :

- 5.1 હેતુ
- 5.2 પ્રસ્તાવના
- 5.3 યોગસૂત્ર - સમાધિપાદ
- 5.4 યોગસૂત્ર - સાધનપાદ
- 5.5 સારાંશ
- 5.6 તમારી મગ્રતિ ચકસવા માટેના જવાબો.

5.1 હેતુ :

આ એકમના અભ્યાસ અંતે તમે :

- મહર્ષિ પતંજલિ રચિત યોગસૂત્રો જાડી શકશો.
- યોગસૂત્રના પ્રથમ બે પાદ સમાધિપાદ તથા સાધનપાદનાં કેટલાંક સૂત્રોનો અભ્યાસ કરી શકશો.

5.2 પ્રસ્તાવના :

સાધનપાદ, સમાધિપાદ, વિભૂતીપાદ તથા કેવલ્યપાદ - આ ચાર ઉત્તમ કોટિની રચનાઓમાંથી આપણે પ્રથમ બે પાદનાં કેટલાંક સૂત્રોનો અભ્યાસ કરીશું, જે યોગમાર્ગમાં આગળ વધવામાં ખૂબ જ ઉપયોગી નીવડેશે.

5.3 યોગસૂત્ર સમાધિપાદ :

(1) પ્રમાણવિપર્યય નિદ્રા સ્મृતય : । (યોગસૂત્ર 1.6)


અર્થ :

પ્રમાણ	:	સત્તેજ્ઞાન
વિપર્યય	:	મિથ્યાજ્ઞાન
વિકલ્પ	:	અનુમાન
નિદ્રા	:	સ્વખ વગરની નિદ્રા
સ્મृતય :	:	યાદશક્તિ

પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મृતિ એવા વૃત્તિઓના પાંચ પ્રકારો છે.

સમજૂતી :

ચિત્તની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ચિત્તને મન, બુદ્ધિ અને અહંકારથી ઓળખી શકાય. ચિત્તમાં વૃત્તિઓનો ઉત્પન્ન થાય છે તથા વૃત્તિઓથી કર્મો થાય છે. કર્માની લીધે ચિત્તમાં નવી વૃત્તિ પેદા થાય છે. આ ચક ચાલ્યા કરે છે. યોગથી આ ચકને રોકી શકાય છે.



આ પાંચેય વૃત્તિઓના પ્રકાર પાડી આગળ સૂત્ર 7થી 11માં તે દરેક વિશે સમજાવવામાં આવ્યું છે, જેથી મનમાં કોઈ શંકા ન રહે.

- (1) પ્રમાણ : પ્રમાણ એટલે સત્યજ્ઞાન, જે બીજાને કંઈ શકાય, તેમાં જ્ઞાન પ્રકાર પડે છે.
- (1) પ્રત્યક્ષ પ્રમાણ, જેમાં ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે.
 - (2) અનુમાન પ્રમાણ, જેમાં પદાર્થમાં રહેલા સામાન્ય ગુણના લીધે તે પદાર્થનું જ્ઞાન થાય છે.
 - (3) આગમ પ્રમાણ, જેમાં વેદ કે કોઈ સત્યવાદી વચનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
- (2) વિપર્યય : વિપર્યય એટલે ભિદ્યજ્ઞાન. ઈન્દ્રિયોની ભર્યાદાને લીધે જે વસ્તુ જેવી હોય તેવી કાયમ દેખાતી નથી. જેમ કે એક વ્યક્તિ અંધારામાં પડેલ દોરડાને સાપ માને છે. એ જ રીતે અનિત્ય શરીરને નિત્ય સમજવું.
- (3) વિકલ્પ : વિકલ્પ એટલે કલ્પના. જેનું વસ્તુ તરીકે અસ્તિત્વ ન હોવા છતાં માત્ર શર્ષદો દ્વારા વર્ત્તિન કરાય છે. જેમ કે વંધ્યાનો પુત્ર
- (4) નિદ્રા : જે સમયે મનુષ્યને કોઈપણ પ્રકારનું જ્ઞાન નથી તે જ્ઞાનના અભાવવાળી સ્થિતિ નિદ્રા. સમાવિમાં અર્થાત् યોગની ઉર્યતમ સ્થિતિઓ પ્રાપ્ત કરવામાં બાધક છે.
- (5) સ્મૃતિ : અનુભવેલી વસ્તુઓનું સ્મરણ થયું તેને સ્મૃતિ કે યાદશક્તિ કહેવાય છે.

(2) અભ્યાસવૈગ્યાભ્યાં તિતનિરોધ : || (યોગસૂત્ર 1.12)

અર્થ :

- અભ્યાસ : અભ્યાસ, પુનરાવર્તન
- વૈગ્ય : અનાસક્તિ
- તિતનિરોધ : નિરોધ શક્ય છે

અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિરોધ શક્ય છે.

સમજૂતી :

મહર્ષિ પતંજલિ આ સૂત્ર અગાઉ વૃત્તિઓની વાત કરતા હતા. આ વૃત્તિઓને રોકવા માટે અભ્યાસ અને વૈરાગ્ય એ બે રૂસ્તા બતાવ્યા છે. આ અભ્યાસ તથા વૈરાગ્ય વિશે પણ આગળ 16માં સૂત્ર સુધી ઊડાણપૂર્વક વાતો કરે છે.

● અભ્યાસ :

મનની સ્થિરતા મેળવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે, તે એ અભ્યાસ કહેવામાં આવે છે. મન સ્વભાવથી જ ચંચલ છે તથા તેને કોઈ એક ધ્યેયમાં સ્થિર કરવા માટે પારંવાર પ્રયત્ન કરવો પડે છે, તેને અભ્યાસ કે પુનરાવર્તન કહેવાય છે. આ અભ્યાસ માટેની શરત બતાવતાં મહર્ષિ પતંજલિ કહે છે કે અભ્યાસનું લાંબો

સમય, નિરંતર, ઉત્સાહપૂર્વક સેવન કરવાથી જ દઢતા આવે છે. આથી, યોગાભ્યાસીઓએ સાધનાથી ક્યારેય થાકું નહિએ.

- વૈરાગ્ય :

વૈરાગ્યનું ભારતીય સંસ્કૃતિમાં આગવું મહાવ છે. આ વૈરાગ્યનાં કેટલાંક સ્તર છે. આમાંથી વશિકાર વૈરાગ્ય જ સાધક માટે ઉપયોગી છે.

- (1) પતમાન વૈરાગ્ય : જેમાં સાધક અનાસક્ત થવા માટે કોશીશ શરૂ કરે છે.
- (2) બ્યાંડેક વૈરાગ્ય : જેમાં સાધક કોઈ એક વસ્તુ પ્રત્યે આસક્ત રહે છે.
- (3) એકેન્દ્રિય વૈરાગ્ય : જેમાં સાધકને એક ઇન્દ્રિય પર કાબૂ મેળવવાનું બાકી છે.
- (4) વશિકાર વૈરાગ્ય : જેમાં સાધક પાંચેય ઇન્દ્રિયો પર સંપૂર્ણરૂપે જ્ય પ્રામ કરે છે. જેમાં કોઈપણ વસ્તુ પર કોઈપણ પ્રકારનું આકર્ષણ રહેતું નથી. આ વૈરાગ્યથી જ સાધકને સિદ્ધિ મળે છે તથા યોગમાર્ગમાં આગળ વધે છે.

(3) ઈશ્વરપ્રણિધાનાદ્રા ॥ (યોગસૂત્ર 1.23)

અર્થ :

- ઇશ્વર : ઈશ્વર
પ્રણિધાનામ् : સમર્પજ્ઞ કરો
દ્વા : અથવા
(અથવા ઈશ્વર સમર્પજ્ઞ કરો)

સમજૂતી :

જ્યારે સાધક ઈશ્વરને જ્ઞાની લે છે, ત્યારે અન્ય પદાર્થનું આકર્ષણ દૂર થાય છે. બધી કિયાઓ ઈશ્વરને સમર્પજ્ઞ કરી દેવી તથા તેના ફળની ઈશ્વરા ન રાખવી તે ઈશ્વરપ્રણિધાન છે. ઈશ્વર વિશે વધુ વાત કરતાં મહર્ષિ પતંજલિ આગળના સૂત્રોમાં વિસ્તારથી જાણાવે છે.

- ઈશ્વરનું સ્વરૂપ :

ઇશ્વર પ્રણિધાનની સિદ્ધિ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના થઈ શકતી નથી, માટે મહર્ષિ પતંજલિ ઈશ્વરનું લક્ષણ બતાવતાં કહે છે કે ઈશ્વર વિશેષ પ્રકારનો પુરૂષ છે. જે કર્મ, કર્મનું ફળ, કર્મશય વગેરેથી મુક્ત છે, પ્રભાવહીન છે. મહર્ષિ પતંજલિ અનુસાર, ઈશ્વર શરીરધારી નથી. જે લોકો ઈશ્વરને સ્વીકારતા નથી તેઓ તથા જીવને જ ઈશ્વર માને છે, તેઓની માન્યતા સમામ થાય છે.

- ઈશ્વરનું પ્રમાણ :

મહર્ષિ પતંજલિ ઈશ્વરનું સ્વરૂપ સમજીવ્યા બાદ તેનું પ્રમાણ આપતાં કહે છે કે તે ઈશ્વરમાં જ્ઞાનનું જે જ્ઞાન છે તે બધું વિદ્યમાન છે. ઈશ્વર સમાન બીજો કોઈ વિદ્યાન થયો નથી, છે નહિ તથા થશે પણ નહિ.

- ઈશ્વરનો પ્રભાવ :

ઈશ્વરના પ્રભાવની વાત કરતાં પતંજલિ મુનિ જાણાવે છે કે તે કાળથી પર, જોથી પ્રથમ અને મહાનગુરુ છે. ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે કારણ કે તેનો કોઈ કાળમાં નાશ થતો નથી. તે સર્વવ્યાપી, સર્વસ્વ અને સર્વશક્તિમાન હોવાથી તેને શરીરની જેંડર નથી. અન્ય જેટલા પણ ગુરુઓ છે, તેઓ ઈશ્વરે કહેલા જ્ઞાનને તેણે બનાવેલા શરીર તથા ઇન્દ્રિયોની મદદથી અન્યને કહે છે.

- ઈશ્વરનું નામ :

ઈશ્વરના નામ અંગે મહર્ષિ પતંજલિ કહે છે કે તેનો વાયક શબ્દ પ્રજ્ઞાવ છે. પ્રજ્ઞાવ એટલે ઓમ્ (ॐ). જ્યારે સાધક ઈશ્વરનું સ્વરૂપ અને તેના નામને બરાબર જ્ઞાની લે છે, તો તેને યોગમાર્ગનાં સફળતા મળે છે.

- ઈશ્વરનો જપ :

પ્રજ્ઞાવ અર્થાત્ ઊં નો અર્થ સાથે જપ કરવો જોઈએ. ઈશ્વરનો મનમાં વિચાર કરો. પ્રથમ વાકીથી બોલીને જપ કરવામાં સફળતા રહે છે. જ્યારે જપનો અભ્યાસ દઢ થઈ જપ તારે મનથી જપ કરવામાં મુશ્કેલી પડતી નથી. અર્થ સહિત જપ કરવાથી મન વશમાં આવે છે તથા ઈશ્વરમાં પ્રેમ તથા શ્રદ્ધા દઢ બને છે.
- ઈશ્વરપ્રણિધાનનું કળા :

પ્રજ્ઞાવ જપ કરવાથી યોગમાર્ગમાં આવતા અંતરાયો દૂર થાય છે. વિધિપૂર્વક જપ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે તથા આનંદ અને સુખની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

આમ, મહર્ષિ પતંજલિએ તેમનાં યોગસૂત્રોમાં પ્રથમ યાદ રામાયિધામાં 23થી 29 સૂત્રોમાં ઈશ્વર વિશે સચોટ વર્ણન કર્યું છે, જે કોઈપણ સાધકને ઉપયોગી થાય તેનું છે.

(4) વ્યાધિસત્યાનસંશય પ્રમાદાલસ્યાવિરતિ - ભાન્તિદર્શના લબ્ધભૂમિકાત્વાનવસ્થિત ત્વનિ ચિત્તવિક્ષેપાસ્તેઙ્નતરાય : ||

અર્થ:

વ્યાધિ	:	બિમારી, રોગ
સત્યાન	:	જડતા
સંશય	:	અવિશ્વાસ
પ્રમાદ	:	ચંચળતા
આલસ્ય	:	આણસ
અવિરતિ	:	તીવ્ર આસક્તિ
ભાન્તિદર્શન	:	ખાદુ સમજવું
આલબ્ધભૂમિકાત્વ	:	એકાગ્રતાનો અભાવ
અનવસ્થિત	:	અસ્થિરતા
ત્વનિચિત્ત	:	નવ ચિત્તમાં
વિક્ષેપ	:	તકલીફ
અસ્તેઅન્તરાય:	:	આ અંતરાયો છે.

રોગ, જડતા, શંકા, પ્રમાદ, આણસ, તીવ્ર આસક્તિ, મિથ્યા અનુભાવ, એકાગ્રતાનો અભાવ, અસ્થિરતા એ નવ ચિત્તમાં વિક્ષેપ કરનારા યોગમાર્ગના અંતરાયો છે.

સમજૂતી :

આ અંતરાયોમાંથી પ્રથમ બે શારીરિક છે તથા અન્ય માનસિક છે. મહર્ષિ પતંજલિ અનુસાર આ અંતરાયોનું સ્વરૂપ સમજૂતે.

- (1) વ્યાપિ : શરીર, ઈન્દ્રિયો કે ચિત્તમાં કોઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થાય તો તેને 'વ્યાપિ' કહેવાય છે.
- (2) જડતા : સાધનોમાં પ્રવૃત્તિ ન હોવાના સ્વલ્બરને જડતા કહેવાય છે. યોગસાધનામાં અરૂપી એ જડતા છે.
- (3) શંકા : પોતાની શિક્ષણોમાં અથવા તો યોગના ફળમાં સંદેહ હોય તો તેને શંકા કહેવાય. બીજી રીતે કહીએ તો ઈશ્વરને જ્ઞાનયા માટે પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ ઈશ્વર કે નહિ તે ખબર નથી એમ માનવું એ શંકા છે.
- (4) પ્રમાદ : એક વિશેષ પ્રકારની સ્થિતિ જેથાં માણસ પોતાના મન પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે.

- (5) અવિરતી : કોઈ પણ વસ્તુ પર તીવ્ર આસક્તિ જેને દૂર કરવી ખૂબ કઠિન છે.
- (6) આજસ : શરીર અને મનમાં ગુરુત્વ થવાથી યોગાભ્યાર છોડી ટેવો એ આજસ છે.
- (7) આનિદર્શન : જરૂને ચેતન અને ચેતનને જરૂર સમજવા આનિદર્શન છે.
- (8) એકાગ્રતાનો : એક વિશેષ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રયત્ન કરીએ છીએ છતાં તે સ્થિતિ
- અભાવ પ્રાપ્ત કરી શકતી નથી, તેને અલબ્યાભ્યિક્તવ કહે છે. આનાથી સાધકનો ઉત્સાહ ઓછો થઈ જાય છે.
- (9) અસ્થિરતા : એક વખત દીર્ઘ અભ્યાસ બાદ વિશેષ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ બીજી વખત સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી.

આ બધા યોગમાર્ગના અંતરાયો છે, વિધિપૂર્વક ઈશ્વરપ્રાણિધાન કરવાથી આ અંતરાયો દૂર થાય છે. આથી આગળ મહર્ષિ પતંજલિ તેમના સૂત્રમાં જ્ઞાને છે કે, દુઃખ, ક્ષોભ, મુખ્યારી તથા અનિયમિત શાસ્ત્રોશાસ વિક્ષેપોની સાથે જ ઉત્પન્ન થાય છે.

- (1) દુઃખ : જેથી પીડિત થયેલ પ્રાણી તેના વિનાશ માટે પ્રયત્ન કરે છે તે દુઃખ કહેવાય છે.
- (2) દીર્ઘનિઃશ્વરી : ઈચ્છાની પૂર્તિ ન થવાથી, મનનો ક્ષોભ અથવા તો આઃસન્તા દીર્ઘનિઃશ્વરી છે.
- (3) અંગમેજધત્વ : શરીરના અંગોમાં બિનજરૂરી કંપન થવું એ અંગમેજધત્વ છે.
- (4) અનિયમિત શાસ્ત્રોશાસ : શાસ્ત્રોશાસ પોતાની ઈચ્છા વિરુદ્ધ ચાલવા, અનિયતંશુમાં રહેવા એ ઉપિવદન છે.

અંતરાય નિવારણા :

યોગસાધકનું લક્ષ્ય ચિત્તવૃત્તિઓનો નિરોપ કરવાનું, અંતરાય નિવારણનું હોય છે. અને માટેનો ઉપાય જગ્યાવતાં મહર્ષિ પતંજલિ કહે છે કે, અંતરાયો અને ઉપિવધનો દૂર કરવા એક તત્ત્વનો અભ્યાસ કરલો. જોઈએ. અહીં ‘એકત્તત્વ’ શાસ્ત્રનો જુદા જુદા મતો ઉદ્ભાવે છે એક મત અનુસાર ઈશ્વર એકત્તત્વ છે, જેમાં અન્ય કોઈ વસ્તુનું ભિન્નશી નથી. વિધનોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર એક ઈશ્વરમાં જ છે, અન્ય કોઈ જરૂર તત્ત્વમાં નથી. જ્યારું બીજા મત અનુસાર કોઈ પણ વસ્તુ પર ચિત્તને વારંવાર સ્થિર કરવાના પ્રયત્નથી પણ એકાગ્રતા આવે છે અને અંતરાયોનો નાશ થાય છે. આમ, એક તરફ ચિત્તની એકાગ્રતાનો નાશ થાય છે. આમ, એક તરફ ચિત્તની એકાગ્રતા તો બીજી બાજુ ઈશ્વર સ્મરણ પર ભાર મૂક્યાયો છે.

આમ, પતંજલિ મુનીએ યોગસાધકના માર્ગમાં આવતા અંતરાયો પ્રત્યે વાકેફ કરી, તેના નિવારણ માટેનો માર્ગ સૂચવીને એક માર્ગદર્શકનું કાર્ય કર્યું છે. વળી, અંતરાયો તથા તેના નિવારણનું કરેલું વિશ્વેષણ ખરેખર તર્કસંગત છે.

5.4 યોગસૂત્ર સાધનપાદ :

- (1) તપ: સ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાનિ ક્રિયાયોગ : (યોગસૂત્ર 2, 1)

અર્થ :

તપ	:	તપ
સ્વાધ્યાય	:	સ્વાધ્યાય
ઇશ્વર	:	ઇશ્વર
પ્રણિધાનાનિ	:	સમર્પણ
ક્રિયાયોગ	:	ક્રિયાયોગ

તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન ક્રિયાયોગ છે.

સમજૂતી :

કિયાયોગ નામ જ સૂચવે છે કે તેનું સ્વરૂપ વિશેષ કરીને કિયાત્મક છે પરંતુ કોઈ પણ કિયાને કિયાયોગ કહી શકાય નહિ. કિયાયોગ એટલે એવી કિયાઓનો સમૂહ જે અધ્યાત્મ મન્યે દોણી જાય.

કિયાયોગની વ્યાખ્યા :

તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન - આ ત્રણે યમ, નિયમ વગેરે યોગના અંગોમાં નિયમોની અંદર આવી જ જાય છે, છતાં ત્રણે સાધનોનું વિશેષ મહત્વ અને એમની સુગમતા દર્શાવવા માટે પહેલા 'કિયાયોગ' એવા નામથી અલગ વર્ણન કર્યું છે.

તપ કિયાત્મક છે. સ્વાધ્યાય જ્ઞાનાત્મક વિશેષ છે અને ઈશ્વરપ્રણિધાન ભાવાત્મક છે. માનવચેતનાના ત્રણ પાસાંઓ - કિયા, ભાવ અને જ્ઞાનને દર્શિ સમક્ષ રાખી સાધન સ્વરૂપોને. ત્રણ વિશાળ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણેય સાધન સમૂહો આરંભમાં તો કિયાત્મક જ રહેવાના અને તેથી ત્રણેને કિયાયોગ કહેલ છે.

હવે, આ ત્રણેય સાધનોના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

તપ :

તપ શબ્દ તપ ધ્યાન પરથી બન્યો છે. તેનો સામાન્ય અર્થ 'તપવું' એવો ગાય છે. જેમ સુવર્ણને તપાવવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ બળી જાય છે અને સુવર્ણ શુદ્ધ બને છે. તેમ સાધકના શરીર અને ચિત્તને તપાવીને તેમને પરિશુદ્ધ કરનારી કેટલીક સાધનાઓને તપ કહે છે.

પ્રત, ઉપવાસ, સ્નાન, તીર્થયાત્રા વગેરે તપનાં ભાવ સ્વરૂપો છે. નિષ્ઠામ ભાવથી તપનું પાલન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે.

તપનો સૂક્ષ્મ અર્થ પ્રાણાયમ છે. પ્રાણાયમ : પરં તપ : ૧ આ વિધાનમાં પ્રાણાયમને સર્વોચ્ચ તપ માનવામાં આવ્યું છે. શરીર અને મનની અશુદ્ધિઓ દૂર કરવા પ્રાણાયમનું મૂલ્ય આંકીએ તેથું ઓછું છે.

તપના ત્રણ પ્રકાર છે.

- | | | |
|----------------|---|--|
| (1) વાચિક તપ | : | સત્ય, પ્રિય અને હિતકર વાચી |
| (2) શારીરિક તપ | : | સાત્ત્વિક આધારિતવધાર, જીત, ઉપવાસ, ઈન્ડ્રિયોનો સંયમ |
| (3) માનસિક તપ | : | મૌન, સમતા, ભાવશુદ્ધિ, મનોનિગ્રહ, ચિત્તની પ્રસન્નતા વગેરે |

સ્વાધ્યાય :

સ્વાધ્યાયની ત્રણ કક્ષાઓ છે :

- (1) શાસ્ત્રોનું વિધિવત અધ્યયન
- (2) અધ્યયન કરેલા વિષય પર ચિત્તન-મનન
- (3) પ્રશ્નાવ, ગાયત્રી આદિ મંત્રોનો અર્થસહિત જાપ


આ સિવાય સૂક્ષ્મ સ્તર પર આપણા પોતાના જીવનના અધ્યયનનું નામ સ્વાધ્યાય છે. એટલે કે સાધકને પ્રામ વિવેક દ્વારા પોતાના દોષોને શોધીને નીકળતા રહેવું જોઈએ.

પ્રાચીન કાળથી ભારતવર્ષમાં એક દંતકથા કહેવાતી આવી છે કે, રાજહંસ આગળ દૂધ અને પાણી બેળાં કરીને મૂકીશું તો તે માત્ર દૂધ પી જશે અને પાણીને પડતું મુકશે, એટલા માટે જ્ઞાનનો જરૂરી સારાંશ જ ગ્રહણ કરવો અને બાકીની ખટપટની બિનજરૂરી તકરારોને છોડી દેવી.

ઇશ્વરપ્રણિધાન :

ઇશ્વરમાં સમર્પિત થઈ જવાને ઇશ્વરપ્રણિધાન કહેવાય છે. એમનાં નામ, તૃપ, લીલા, પામ, ગુજ અને પ્રભાવ વગેરેનું શ્રવણ, કીર્તન અને મનન કરવું, બધાં કર્મો ભગવાનને સમર્પિત કરી દેવા, સર્વ ઇચ્છાઓ ભગવત ઇચ્છામાં વિલોપ, ભગવાનમાં પોતાના અહંકારનું વિસર્જન, એમની આજ્ઞાનું પાલન કરવું, એમાં જ અનન્ય ગ્રેમ કરવો - આ બધા ઇશ્વરપ્રણિધાનના અંગ છે.

માત્ર 195 સૂત્રના બનેલા નાનકડા અને અતિ સંક્ષિપ્ત ગ્રંથ 'યોગસૂત્ર'માં ઇશ્વરપ્રણિધાન શબ્દ ચાર વખત વપરાયો છે, એટલી હકીકત આનું મૂલ્ય સમજવા માટે પર્યાપ્ત ગણાવી જોઈએ.



- (2) યમનિયમાસન પ્રાણયામ પ્રત્યાહારધારણા ધ્યાન સમાધપીડ - બાવડગાનિ (યોગસૂત્ર 2, 29)

યમ, નિયમ, આસન, પ્રાશાયામ, પ્રત્યાહાર, ધર્મશાસ્ત્ર, ધ્યાન, સમાધિ આ બાઠ યોગનાં અંગો છે.

અર્થ :


યમ	:	-યમ
નિયમ	:	નિયમ
આસન	:	આસન
પ્રાણયામ	:	પ્રાશાયામ
પ્રત્યાહાર	:	પ્રત્યાહાર
ધરણા	:	ધર્મશાસ્ત્ર
ધ્યાન	:	ધ્યાન
સમાધિ	:	સમાધિ
અષ્ટી	:	આઠ
અંગાનિ	:	અંગુ

યોગ પરિચય


૪મ, નિયમન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારકા, ધ્યાન, સમાધિ આ આઠ યોગનાં અંગો છે.
સમજૂતી :

મહર્ષિ પતંજલિએ સાધનપાદના આ 29માં સૂત્રથી શરૂ કરીને વિલૂંઃપાદના ત્રીજી સૂત્ર સુધી અષ્ટાંગયોગનું ખૂલ્ય જ વિસ્તારથી વર્ણન કર્યું છે. આ અષ્ટાંગયોગ વિશે આપણે એકમ-છ્યથી વિસ્તારથી સમજીશું. પરંતુ અત્યારે ટૂંકમાં માહિતી મેળવી લઈએ.

(1) ૪મ :



(2) નિયમ :



(3) આસન : સ્થિર તથા સુખપૂર્વક કરવામાં આવે તે આસ ।

(4) પ્રાણાયમ : શ્વાસ-પ્રશ્વાસની ગતિ પર નિયમન તે પ્રાણાયમ


(5) પ્રત્યાહાર : હિન્દ્રિય પર નિયમન તે પ્રત્યાહાર

(6) ધારકા : મનની એકાગ્રતાનો અભ્યાસ તે ધારકા

(7) ધ્યાન : ધારકાની પરિપક્વતા તે ધ્યાન

(8) સમાધિ : હિશ્ર સાક્ષાત્કાર

આ આઠ યોગનાં આઠ અંગો કે પગથિયાં છે. એક પછી એક આ પગથિયાં ચઢીને અંતે ઈશ્વરસાક્ષાત્કાર કરવાનો છે.



5.5 सारांश :

આ એકમના અભ્યાસથી આપણે વૃત્તિઓ તથા તેના નિરોધની વાત કરી, ઈશ્વર શું છે? તથા તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. યોગમાર્ગમાં આવતા અંતરાયો, ઉપવિષ્ટો તથા તેને દૂર કરવાના ઉપાયો વિશે પણ જાણ્યું. કિયાપોગનું મહત્વ તથા કલેશ વિશે માહિતી મેળવી. અધારાંગયોગ જે યોગનું વૈજ્ઞાનિક દસ્તિકોણથી નિરૂપણ કરાયું છે, તેના પ્રાથમિક જાણકારી મેળવી.

☞ तमारी प्रगति यकासो :

- (1) મહારિ પતંજલિ અનુસાર ઈશ્વરનું વર્ણન કરો.

યોગ પરિચય

(2) વૃત્તિના પ્રકાર જણાવો.

(3) અંતરાયો કેટલા છે ? કયા કયા ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(4) કિયાયોગ એટલે શું ?

(5) અષાંગયોગ શું છે ?

5.6 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

(1) ઈશ્વરનું સ્વરૂપ, પ્રમાણ, પ્રભાવ અને નામ

• **ઈશ્વરનું સ્વરૂપ :**

ઈશ્વર પ્રણિયાનના સેંદ્રિકિ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના થઈ શકતી નથી, માટે મહર્ષિ પતંજલિ ઈશ્વરનું લક્ષણ બતાવતાં કહે છે કે ઈશ્વર તિશેષ પ્રકારનો પુરુષ છે. જે કર્મ, કાંતું ફળ, કર્માશય વગેરેથી મુક્ત છે, પ્રભાવદીન છે. મહર્ષિ પતંજલિ અનુસાર, ઈશ્વર શરીરધારી નથી. જે લોકો ઈશ્વરને સ્વીકારતા નથી તેઓ તથા જવાને જ ઈશ્વર માને છે, તેઓની માન્યતા સમામ થાય છે.

• **ઈશ્વરનું પ્રમાણ :**

મહર્ષિ પતંજલિ ઈશ્વરનું સ્વરૂપ સમજાવ્યા બાદ તેનું પ્રમાણ આપતાં કહે છે કે : ઈશ્વરમાં ત્રણો કણનું જે જ્ઞાન છે તે બધું વિદ્યમાન છે. ઈશ્વર સમાન બીજો કોઈ વિદ્યાન થયો નથી, છે નહિ તથા થશે પણ નહિ.

• **ઈશ્વરનો પ્રભાવ :**

ઈશ્વરના પ્રભાવની વાત કરતાં પતંજલિ મુનિ જણાવે છે કે તે કણથી પર, સૌંદર્ય પ્રથમ અને મહાનગુરુ છે. ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે કારણ કે તેનો કોઈ કણમાં નાશ થતો નથી. તે સર્વવ્યાપી, સર્વસ્વ અને સર્વશક્તિમાન હોવાથી તેને શરીરની જરૂર નથી. અન્ય જેટલા પણ ગુરુઓ છે તોઓ ઈશ્વરે કહેલા જ્ઞાનને તેણે બનાવેલા શરીર તથા ઈન્દ્રિયોની મદદથી અન્યને કહે છે.

• **ઈશ્વરનું નામ :**

ઈશ્વરના નામ અંગે મહર્ષિ પતંજલિ કહે છે કે તેનો વાચક શબ્દ પ્રણાવ છે. પ્રણાવ = ટેલે ઓમ્ (ઉં). જ્યારે સાપ્તક ઈશ્વરનું સ્વરૂપ અને તેના નામને બરાબર જાણી લે છે, તો તેને યોગમાર્ગમાં સફળતા મળે છે.

- (2)
- પ્રમાણ
 - વિપર્યય
 - વિકલ્પ
 - નિત્રા
 - સ્મૃતિ

(3) અંતરાયો 9 પ્રકારના છે

- 1) વ્યાધિ
- 2) જડતા
- 3) શંકા
- 4) પ્રમાદ
- 5) અવિરતી
- 6) આળસ
- 7) બાન્તિદર્શન
- 8) એકાગ્રતાનો અભાવ
- 9) અસ્થિરતા

(4) તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ કિયાયોગ છે એમ મહર્ષિ પતંજલિ તેમના યોગસૂત્રના સાધનપાદના પ્રથમ સૂત્રમાં જણાવે છે.

કિયાયોગ નામ જ સૂચયે છે કે તેનું સ્વરૂપ વિશેષ કરીને કિયાત્મક છે. પરંતુ કોઈ પણ કિયાને કિયાયોગ કહી શકાય નહિ. કિયાયોગ એટલે અંવી કિયાઓનો સમૂહ જે અધ્યાત્મ ગ્રન્થે દોરી જાય.

કિયાયોગની વ્યાખ્યા :

તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાર્થિધાન - આ ત્રણે ધર્મ, નિયમ વગેરે યો "ના અંગોમાં નિયમોની અંદર આવી જ જાય છે, છતાં ત્રણે સાધનોનું વિશેષ મહત્વ અને એમની સુગમતા દર્શાવવા માટે પહેલાં 'કિયાયોગ' એવા નામથી અલગ વર્ણન કર્યું છે.

તપ કિયાત્મક છે. સ્વાધ્યાય જ્ઞાનાત્મક વિશેષ છે અને ઈશ્વરપ્રાર્થિધાન ભાવાત્મક છે. માનવચેતનાનાં ત્રણ પાસાઓ - કિયા, ભાવ અને જ્ઞાનને દર્શિ સમક્ષ રાખી સાધન સ્વરૂપોને ત્રણ વિશાળ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણેય સાધન સમૂહો આરંભમાં તો કિયાત્મક જ રહેવાના અને તેથી ત્રણેને કિયાયોગ કહેલ છે.

હવે, આ ત્રણેય સાધનોના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

તપ :

તપ શબ્દ તપ ધાતુ પરથી બન્યો છે. તેનો સામાન્ય અર્થ 'તપવું' એવો થાય છે. જેમ સુવર્ણને તપાવવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ બળી જાય છે અને સુવર્ણ શુદ્ધ બને છે. તેમ સાધકના શરીર અને ચિત્તને તપાવાને તેમને પરિશુદ્ધ કરનારી કેટલીક સાધનાઓને તપ કહે છે.

પ્રત, ઉપવાસ, સ્નાન, તીર્થયાત્રા વગેરે તપના ભાવ સ્વરૂપો છે. નિર્જામ ભાવથી તપનું પાલન કરવાથી મનુષ્યનું અંત:કરણ શુદ્ધ થાય છે:

તપનો સૂક્ષ્મ અર્થ પ્રાણાયમ છે. પ્રાણાયમ : પરં તપ : ૧ આ વિધાનમાં પ્રાણાયમને સર્વોચ્ચ તપ માનવામાં આવ્યું છે. શરીર અને મનની અશુદ્ધિઓ દૂર કરવા પ્રાણાયમનું મૂલ્ય આંકીએ તેટલું ઓછું છે.

તપના ત્રણ મુકાર છે.

- | | | | |
|-----|------------|---|---|
| (1) | વાચિક તપ | : | સત્ય, પ્રિય અને હિતકર વાચી |
| (2) | શારીરિક તપ | : | સાત્ત્વિક આધારિવિદ્ધાર, પ્રત, ઉપવાસ, ઈન્દ્રિયોનો સંયમ |
| (3) | માનસિક તપ | : | મૌન, સમતા, ભાવશુદ્ધિ મનોનિગ્રહ, ચિત્તની પ્રસન્નતા વગેરે |

સ્વાધ્યાય :

સ્વાધ્યાયની ત્રણ કક્ષાઓ છે :

- (1) શાસ્ત્રોનું વિધિવત અધ્યયન
- (2) અધ્યયન કરેલા વિષય પર ચિત્તન-મનન
- (3) પ્રાણવ, ગાયત્રા આદિ મંત્રોનો અર્થસહિત જાપ

આ સિવાય સૂક્ષ્મ સ્તર પર આપણા પોતાના જીવનના અધ્યયનનું નન્દા સ્વાધ્યાય છે. એટલે કે સાધકને પ્રામ વિવેક દ્વારા પોતાના દોષોને શોધીને નીકળતા રહેવું જોઈએ.

પ્રાચીન કાળથી ભારતવર્ષમાં એક દંતકથા કહેવાતી આવી છે કે, રાજહંસ આગળ દૂધ અને પાણી ભેગાં કરીને

મૂડીશું તો તે માત્ર દૂધ પી જશે અને પાણીને પડતું મુકશે, એટલા માટે જ્ઞાનનો જરૂરી સારાંશ જ ગ્રહણ કરવો અને બાકીની ખટપટની બિનજરૂરી તકરારોને છોડી દેવી.

ઈશ્વરપ્રણિધાન :

ઈશ્વરમાં સમર્પિત થઈ જવાને ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. એમનાં નામ, રૂપ, લીલા, ધામ, ગુણ અને પ્રભાવ વગેરેનું શ્રવણ, કીર્તન અને મનન કરવું, બધાં કર્મો ભગવાનને સમર્પિત કરી દેવાં સર્વ ઈશ્વરાઓ ભગવત ઈશ્વરમાં વિલોપ, ભગવાનમાં પોતાના અહેકારનું વિસર્જન, એમની આશાનું પાલન કરવું, એમાં જ અનન્ય પ્રેમ કરવો - આ બધાં ઈશ્વરપ્રણિધાનના અંગ છે.

માત્ર 195 સૂત્રના બનેલા નાનકડા અને અતિ સંક્ષિમ ગ્રંથ 'ધોરસૂત્ર'માં ઈશ્વરપ્રણિધાન શબ્દ ચાર વખત વપરાયો છે, એટલી હકીકત આનું મૂલ્ય સમજવા માટે પર્યાપ્ત ગણાવી જોઈએ.

(5) યમનિયમાસન પ્રાણાયામ પ્રત્યાહારધારણ ધ્યાન સમાધીણ - ષાવડ્ગાનિ (ધોરસૂત્ર 2, 29)


અર્થ :

યમ	:	યમ
નિયમ	:	નિયમ
આસન	:	આસન
પ્રાણાયામ :		પ્રાણાયામ
પ્રત્યાહાર	:	પ્રત્યાહાર
ધારણા	:	ધારણા
ધ્યાન	:	ધ્યાન
સમાધિ	:	સમાધિ
અણી	:	અઠ
અંગાનિ	:	અંગ


યમ, નિયમન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ આઠ યોગનાં અંગો છે.

સમજૂતી :

મહર્ષિ પતંજલિએ સાધનપાદના આ 29માં સૂત્રથી શરૂ કરીને વિભૂતીપાદના ત્રીજા સૂત્ર સુધી અણંગયોગનું ખૂબ જ વિસ્તારથી વર્ણિન કર્યું છે. આ અણંગયોગ વિશે આપણે એકમ-9થી વિસ્તારથી સમજૂતું. પરંતુ અત્યારે ટૂંકમાં માહિતી મેળવી લઈએ.



(2) નિયમ :



(3) આસન : સ્થિર તથા સુખપૂર્વક કરવામાં આવે તે આસન

(4) પ્રાણાયામ : શ્વાસ-પ્રશ્વાસની ગતિ પર નિયમન તે પ્રાણાયામ

(5) પ્રત્યાહાર : ઈન્દ્રિય પર નિયમન તે પ્રત્યાહાર

(6) ધારણા : મનની એકાગ્રતાનો અભ્યાસ તે ધારણા

(7) ધ્યાન : ધારણાની પરિપક્વતા તે ધ્યાન

(8) સમાધિ : ઈશ્વર સાક્ષાત્કાર



ડૉ. બાબાસાહેબ અમંબેડકર
ઓપન યુનિવર્સિટી

CYS-01
યોગવિજ્ઞાનનો
પ્રમાણપત્ર અભ્યાસક્રમ

વિભાગ-1

યોગ પરિચય-મહર્ષિ પતંજલિ યોગદર્શનમ્

ખંડ-2

યોગ પરિચય

એકમ-6:

યોગના વિવિધ પ્રકારો -1

06

એકમ-7:

યોગના વિવિધ પ્રકારો -2

15

એકમ-8:

અષ્ટાંગયોગ-યમ,નિયમ

24

એકમ-9:

અષ્ટાંગયોગ - આસન, પ્રાણાયામ

35

એકમ-10:

અષ્ટાંગયોગ - પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ

43

લેખક

ડૉ. વિક્રમ બી. ઉપાધ્યાય

૩/બી, જીદુન સ્વંતી સોસાયટી,
મિરાભીકા સુલ પાસે, નારશાપુરા,
અમદાવાદ -380013.

વૈદ્ય શ્રી. કાળુનભાઈ પટેલ

૬/૭, શુભલક્ષ્મી પેલેસ
લૂધારુંગદેવ ચાર રસ્તા, સોલા રોડ,
ઘાટલોડિયાં,
અમદાવાદ -380061.

ડૉ. કમલેશ રાજગોર

સેનેટ મેમ્બર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,
૪/૮૦, શ્રદ્ધાદિપ કોમ્પ્લેક્સ,
અંકુર ચાર રસ્તા, નારશાપુરા,
અમદાવાદ-380013.

પરામર્શક (વિષય)

શ્રી. બિમાનજી પાંડુ

વિભાગ અધ્યક્ષ, યોગ કેન્દ્ર,
ગુજરાત વિધાનીઠ, આશ્રમ રોડ,
અમદાવાદ.

પરામર્શક (ભાષા)

શ્રી. યોગેન્ડ્રભાઈ વ્યાસ

૩૪૭, સરસ્વતીનગર,
આંગાદ સોસાયટી નાણક,
અમદાવાદ.

સંયોજન સહાય

શ્રી. એસ. એચ. બારોટ

મદદનીશ કુલસચિવ
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
ડફનાળા, શાહીબાગ, અમદાવાદ - 380 003.

પ્રકાશક

કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
સરકારી બંગલા નંબર-૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ - 380 003 ટે.નં. 22869690

© સર્વ હક સ્વાધીન. આ પુસ્તકના લખાણ યા તેના કોઈ પણ ભાગને
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની લેખિત સંભતિ વગર
ભિન્નભિન્ન દ્વારા યા અન્ય કોઈ પણ રીતે પુનઃમુદ્રિત કરવાની મનાઈ છે.

ખડ-2 : યોગ પરિચય

યોગ વિશેની માધ્યમિક ભાહિતી આપણે આગળના એકમોમાં જોકી, તેની પરિભાષા તથા બામક માન્યતાઓનું ખંડન કર્યું. યોગના અંતિમ લક્ષ્યને પહોંચવા માટે તેના વિવિધ માર્ગોની ભાહિતી આપણે આ ખંડમાં જોઈશું. એકમ-6 તથા 7માં વિવિધ યોગમાર્ગો વિશે જ્ઞાનકારી આપવામાં આવી છે. અણંગયોગ, જે મહર્ષિ પતંજલિ રચિત ‘યોગદર્શન’માં વિસ્તારપૂર્વક જ્ઞાનવાયો છે, તેની ભાહિતી એકમ-8, 9 તથા 10માં છે.

અણંગ યોગનાં કુલ આठ પગથિયાં અર્થાત આઠ અંગો છે. તે દરેક વિશે આપણે વિસ્તારપૂર્વક સમજશું. દરેકનું મહત્વ તથા તેની મદદથી યોગના અંતિમ લક્ષ્ય, મોકા કે આત્મસાક્ષાત્કાર સુધી કરી રીતે પહોંચવું તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે.

એકમ-6 : યોગના વિવિધ પ્રકારો

આ એકમમાં યોગના અંતિમ લક્ષ્યને પહોંચવા માટેના વિવિધ માર્ગો જીતાવવામાં આવ્યા છે, તે યોગમાર્ગો શું છે તથા તેને કઈ રીતે અનુસરીને આગળ વધાય તેની માહિતી વિસ્તારથી આપવામાં આવી છે. આ વિવિધ યોગ માર્ગમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને અનુરૂપ તે કોઈપણ માર્ગ આગળ વધી શકે છે. દરેક યોગનું એક આગામું વિશિષ્ટ મહત્વ છે.

માર્ગભૂં :

- 6.1 હેતુ
- 6.2 પ્રસ્તાવના
- 6.3 ભક્તિયોગ
- 6.4 જ્ઞાનયોગ
- 6.5 કર્મયોગ
- 6.6 કર્મ-ભક્તિ-જ્ઞાનયોગનો સમન્વય
- 6.7 સાંચાશ
- 6.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

6.1 હેતુ:

આ એકમના અભ્યાસના અંતે તમે :

- ભક્તિયોગ વિશે માહિતી મેળવી શકશો.
- જ્ઞાનયોગ વિશે જ્ઞાનમાર્ગ પર આગળ વધી શકશો.
- કર્મ અને કર્મના સિદ્ધ્યાંત જ્ઞાની શકશો.
- ઉપરના ગ્રંથો યોગ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલ છે તે જ્ઞાની શકશો.

6.2 પ્રસ્તાવના :


શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે શા માટે જન્મ્યા છો? તમ કોઈ પ્રાર્થના, વનસ્પતિ કે જીવજ્ઞતુ નહિ, પણ માનવ જ શાથી થયા? આ જન્મ અને મૃત્યુ શું છે? શાથી છે? તમારા આ માનવજીવનનો હેતુ શું છે? તમારા જીવનના લક્ષ્ય વિશે ક્યારેય વિચાર્યુ છે? માનવજીવનનો વિશિષ્ટ હેતુ છે. આ હેતુને મોક્ષ કે ઈશ્વર સાક્ષાત્કાર જેવા અનેક નામોથી ઓળખાય છે. જીવનનો હેતુ ધન પ્રાપ્તિ, સંતતિ કે કીર્તિ મેળવવી તે નથી, માનવજીવનનું ઉચ્ચ ધ્યેય હોવું જરૂરી છે. વિશ્વના મહાન વ્યક્તિઓએ જીવનના ધ્યેય વિશે વિપુલ માર્ગદર્શન આપેલ છે.

જીવનના નિર્ધારિત ધ્યેયને પહોંચી વળવા માટે અનેક માર્ગનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે, આ ઉપરાંત કેટલાક જ્ઞાની વિદ્બાનોએ પણ માર્ગો બતાવ્યા છે. જેટલા વિવિધ માર્ગો છે, તેટલા યોગના પ્રકારો છે. પરંતુ જેમ સાઈકલના આરા જુદી જુદી દિશામાંથી આવે છે, પણ અંતિમ લક્ષ્ય તો એક જ બિંદુ છે. તે રીતે વિવિધ માર્ગો ભવે અલગ હોય પણ અંતે લક્ષ્ય એક જ છે.

વિવિધ રૂચિ તથા શક્તિવાળી વ્યક્તિઓ માટે વિવિધ માર્ગો છે, વ્યક્તિ પોતાને અનુરૂપ માર્ગ પસેંદ કરી શકે છે. જેમ કે બુદ્ધિશાળી ભાષણ જ્ઞાન મ્યાપ કરીને, શક્તિશાળી હઠયોગ દ્વારા તથા ભાવનાપ્રથાન વ્યક્તિ ભક્તિ દ્વારા યોગસિદ્ધ કરી શકે છે. ભારતની સંસ્કૃતિ ખૂબ જ વિશાળ છે, છતાં દરેકને અનુકૂળ માર્ગ મળી રહે છે. આ યોગમાર્ગોના વિવિધ પ્રકારો નીચે મુજબ છે, જેમાંથી કેટલાક વિશે આપણે ઊડાણપૂર્વક માહિતી મેળવીશું.

- ભક્તિયોગ
- જ્ઞાનયોગ

- कर्मयोग
- सांख्ययोग
- हठयोग
- अष्टांगयोग
- अनासक्तियोग
- हुडलिनी योग
- तंत्रयोग
- मंत्रयोग
- राजयोग
- लययोग



6.3 भक्तियोग :

'भक्तियोग' ना बे शब्द 'भक्ति' अने 'योग' बनेनु पौतपोतानु असित्व छे, परंतु बने शब्द ज्ञेय छे त्यारे तेनी भद्रानता वधी थाय छे. भक्ति शब्द संस्कृतना 'भज्' पातु परथी आव्यो छे, जेनो अर्थ समर्पित थई जुँ ऐवो थाय छे. भक्तियोग ईश्वर साथेना ज्ञेयाङ्कनी आध्यात्मिक प्रवृत्ति छे.

मनुष्यनी जे भावना के लागळीओ छे, तेनो उपयोग करवानो उपाय भक्तियोगमां बताव्यो छे. भक्ति द्वारा आपणे आपणी लागळीओ के भावनाओने ईश्वरना चरणे धरीअे छीअे, अने अंते ईश्वरनां दर्शन थाय छे.

भक्तियोग सौना भाटे सरण अने सुलभ छे. आथी दरेक धर्ममां भक्तिनु स्थान प्रथम छे. वली, ते बीजा मार्ग करतां यउियातो छे कारण के ते अहेतुक छे. तेमांथी मणतो आनन्द ज तेनु परिक्षाम छे. भक्तियोगनी विशिष्टता ऐ छे के क्रीढपश्च व्यक्ति भक्ति द्वारा परमपद माम करी शके छे. पछी अले ते गरीब होय के पैसादार, भणेलो होय के अभक्ष, शारीरिक रीते तंदुरस्त होय के निर्भूष, गमे ते कुण के गमे ते उभरनो होय, दुराचारी व्यक्ति पश्च भक्ति द्वारा पोतानु छवन सुधारी शके छे. जेनु उदाहरण वालिमकी छे, दालियो लूटारो रामभाक्ति द्वारा वालिमकी बन्यो.

जेम मूँगो माणस पोते लीधेला स्वादनु वर्षन करी शक्तो नथी, ते रीते ईश्वर प्रत्येनी भक्तिनु स्वरूप वर्षनी शकानु नथी. छतां आ भक्ति, भक्त तथा ईश्वर विशे समजवा प्रयत्न करीअे.

- ભક્તા :
ભક્તા એને કહેવાય, જે પોતાનું જીવન ઈશ્વરની સેવા માટે સમર્પિત કરે. ભક્તાનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી, જીવનના દરેક કાર્યમાં તે ઈશ્વરનું સ્મરણ કરે છે. એનાં બધાં કાર્યો ઈશ્વર માટે, ઈશ્વર પ્રતિ તથા ઈશ્વર દ્વારા હશે.
- ઈશ્વર :
ઈશ્વર અહીં સાકાર છે. વિશ્વમાં જે થાય છે, તે બધું તેમની ઈશ્વરાથી થાય છે. ઈશ્વર સમર્પિત ભક્તને મદદ કરે છે.
- ભક્તિ :
ભક્તિ એ એવો સેતુ છે જે ભક્ત અને ભગવાનની વચ્ચે સીધો સંપર્ક કરાવે છે.

ભક્તિયોગ વિશે હવે વધુ સમજવા પ્રયત્ન કરીશું.

ભક્તિમાર્ગમાં પ્રગતિ માટેની આવશ્યકતા :

- મનુષ્ય અવતાર
- ઈશ્વરપ્રાર્થિની તીવ્ર આકાંક્ષા
- પ્રાર્થના
- શક્તા અને પ્રેમ
- સત્તસંગ
- સારાં પુસ્તકોનું વાંચન
- સદ્ગુરુ
- ભક્તાનો ભગવાન પ્રત્યે ભાવ.

ભક્તિના પ્રકાર

- નવધા ભક્તિ : નવધા ભક્તિ અર્થાત् નવ પ્રકારે ભક્તિ થઈ શકે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્થન, વંદન, સાધ્ય, દાસ્ય અને આત્મનિવેદન એ ભક્તિના પ્રકારો છે.
- પ્રેમલક્ષ્મા ભક્તિ : મર્યાદામાર્ગ અને પુષ્ટિમાર્ગ થતી ભક્તિનો આમાં સમાવેશ થાય છે.
- સાકાર ભક્તિ : આકારવાળા ઈશ્વર અર્થાત્ મૂર્તિની ભક્તિને સાકાર ભક્તિ કહે છે.
- નિરાકાર ભક્તિ : મૂર્તિરૂપે નહિ પણ જત્તારૂપે ઈશ્વરને પૂજવામાં આવે તેને નિરાકાર ભક્તિ કહેવાય છે.

ભક્તિયોગના માર્ગ :

- ઈશ્વરના નામનું સ્મરણ કરવું.
- ઈશ્વરની લીલાનું કથન કરવું.
- ઈશ્વરની મહાનતાનું ચિંતન કરવું.

ભક્તિ દ્વારા પ્રાપ્તિ :

જેમ ખોતરમાં થઈનું બીજ વાતીએ તો થઈ અને ચોખાનું બીજ વાતીએ તો ચોખા ઉગે, એ રીતે ભક્તિને અનુરૂપ મોકશની પ્રાપ્તિ થાય છે, જેના મુખ્યત્વે ચાર પ્રકાર છે.

- સાલોક્ય મુક્તિ : ભક્ત ઈશ્વરના લોકમાં રહે છે.
- સાર્વય મુક્તિ : ભક્તને ઈશ્વરનું રૂપ તથા કલા પ્રામ થશે.
- સાનિધ્ય મુક્તિ : ભક્તને ઈશ્વરનું સાનિધ્ય પ્રામ થશે.
- સાયુજ્ય મુક્તિ : ભક્ત ઈશ્વરમાં ભળી જશે.

આમ, ઈશ્વરની ભક્તિ દ્વારા મોક્ષ પ્રામ કરવાનો માર્ગ એટલે ભક્તિયોગ. ઈશ્વરમાં શ્રદ્ધા તથા પ્રેમ રાખી, સર્વભાવે તેના શરણે જવાથી તથા ફળની કોઈ આશા ન રાખી ભક્તિમાર્ગ પર આગળ વધાય છે.

6.4 જ્ઞાનયોગ :

જ્ઞાનયોગ દ્વારા પણ સૃષ્ટિનાં રહસ્યોને જ્ઞાણી શકાય છે. જ્ઞાનયોગની સાધના માટે સંયમ, ઈશ્વરકૃપા, સત્સંગ, સારા પુસ્તકોનું વાંચન વગેરે જરૂરી છે. આત્માને જ્ઞાણીને જ્ઞાનયોગ સિદ્ધ થઈ શકે છે. જ્ઞાન દ્વારા ઈશ્વર, આત્મા તથા બ્રહ્માંડને જ્ઞાણી જ્ઞાનયોગી મોક્ષને પામે છે. મૃત્યુ તથા મૃત્યુ પછીનાં રહસ્યો જ્ઞાનયોગી જાણે છે. જ્ઞાનમાર્ગ ભક્તિ તથા કર્મથી આગળનો માર્ગ છે.

જ્ઞાનયોગમાં પ્રગતિ માટેની આવશ્યકતાઓ :

- એકાગ્રતા
- શ્રદ્ધા
- જિશાસા
- નદ્રગુરુ
- મનુષ્ય અવતાર
- નદ્રગ્રંથોનું વાંચન-શ્રવણ

જ્ઞાનના પ્રકાર :

• અપરા વિદ્યા :	અપરાવિદ્યા અર્થાત્ ભૌતિક પદાર્થોનું જ્ઞાન. આ જ્ઞાન શાંદોની મર્યાદામાં હોય છે. વિવિધ વિષયના નિષ્ઠાંતો પોતાના વિષયમાં ઉંઠુ જ્ઞાન ધરાવતા હોય છે, તે ભૌતિક જગત પૂરતુ મર્યાદિત. આવા જ્ઞાનને ‘અપરા વિદ્યા’ કહેવામાં આવે છે.
• પરા વિદ્યા :	પરાવિદ્યાને શબ્દોથી સમજવી ન શકાય. તેમાં આત્મા અને બ્રહ્મને લગતું જ્ઞાન આવે, તેને આપણી ઈન્દ્રિયોથી સમજ કે જ્ઞાણી ન શકાય. આત્માનુભૂતિની વિશિષ્ટ ઘટના બને છે.

જ્ઞાનીનાં લક્ષણો :

- અહિસા અને અદૂષ
- નિરામિમાની
- સરળ સ્વભાવનો
- વિવેકી
- દ્યાવાન
- કામ, કોષ તથા લોભરહિત.

આમ, ઈશ્વરના જ્ઞાનનો સાક્ષાત્કાર કરી ઈશ્વરમાં જોડાવવાના માર્ગને જ્ઞાનયોગ કહે છે. ઈશ્વરની રચના સમજવા મન, બુધ્ય તથા ઈન્દ્રિયથી ઉપર ઉઠવું પડે, અને જ્ઞાન પ્રામ થતાં શંકાઓનું સમાધાન થતાં શાંતિ પ્રામ થાય છે.

૭ તમારી પ્રગતિ ચકાસો :

(1) ભક્તિયોગ શાષ્ટનો અર્થ સમજાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....

(2) ભક્તિયોગની વિશિષ્ટતા જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....

(3) ભક્તિના પ્રકાર જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....

(4) શાનીનાં લક્ષણો ક્યાં હોય છે ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(5) પરાવિધા એટલે શું ?

.....
.....
.....
.....
.....

6.5 કર્મયોગ :

‘જેવુ કરશો તેવુ પામશો’ આ ભાવના ભારતીય સંસ્કૃતિની રગેરગમાં વ્યાપેલી છે, કર્મયોગની પાયાની વાત આ જ છે. આ કર્મયોગના સિદ્ધાંત કઈ રીતે કાર્ય કરે છે તે સમજજું મુશ્કેલ છે. ભગવાન શ્રીકૃષ્ણો ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે, અર્થાતુ તેને સમજવી મુશ્કેલ છે.

સરળ ભાષામાં કર્મની વાખ્યા કરીએ તો કર્મ એટલે કિયા. આપણે જે શારીરિક કે માનસિક કિયા કરીએ છીએ તેને કર્મ કહેવાય. માણસ એક કષણ માટે પણ નિષ્ઠિય રહેતો નથી, જીવનની ઓળખ જ કાર્ય છે. કાર્યની સમાપ્તિ જીવનની સમાપ્તિ. કર્મયોગમાં ફળની આશા છોડી માત્ર ઈચ્છરની પ્રસન્નતા માટે તથા લોકો પકાર માટે કર્મ કરવાનું કહેવાયું છે, અને તે જ સાચો કર્મયોગી બને છે. કર્મયોગમાં વર્તમાનમાં જીવનાનું કહેવામાં આવ્યું છે. મનમાં કોઈ વસ્તુ માટે આકંક્ષા જોગે, ત્યારે સ્થૂળ સ્તર પર આવી કર્મન્દ્રિયોને સંદેશો નણશે અને કાર્ય થશે. તેનાં બે પરિણામ આવી શકે, જે ફળ મળે તે ભૂલી જવાય અથવા ઈચ્છા પૂરી ન થાય તો મનમાં રહી જશે. આ રીતે કાર્ય થાય છે, પણ તુ કર્મયોગી કાર્ય કર્યા બાદ મનમાં નથી રાખતો જેથી રાગ-દ્રોષ ન રહેતાં શાંતિ મળે છે.

કર્મયોગના સિદ્ધાંત :

- દરેક વિલાગ ચલાવવા માટે તથા નિયંત્રણમાં રાખવા કેટલાક કાયદા ઘણાયેલા ડોય છે. તે જ રીતે સૂચિને ચલાવવા તથા અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ કાયદો છે, તેને ‘કર્મનો કાયદો’ કહેવામાં આવે છે.
- કર્મના સિદ્ધાંતની વિશિષ્ટતા એ છે કે તેમાં ક્યાંય પણ અપવાદ કે બાંધુદો નથી, ભગવાન રામના પિતા હોવા છતાં રાજી દશરથને કર્મના નિયમઅનુસાર પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું.
- કર્મ કરીએ એટલે કાર્ય નિશ્ચિત જ છે, કર્મનું ફળ મળવાનું તરત જ શરૂ થઈ જાય છે, તે મળે જ છે, કદાચ લાંબા સમય બાદ ખબર પડે.

કર્મયોગમાં પ્રગતિ માટેની આવશ્યકતાઓ :

- વિવેક
- અકાત્મબોધ્ય
- સતત જગૃતિ
- ફળને સમર્પિત કરવું
- અનાસક્તિ

કર્મના પ્રકારો :

• સંચિત કર્મ	: પૂર્વજન્મનાં એકનિત થયેલા કર્મો, જે આજે પણ સંચિત છે. તે કાર્ય કરતા નથી તથા ફળ નથી આપતાં, માત્ર જમા રહે છે.
• કિયામાલ કર્મ	: આ જન્મમાં થતાં કર્મો, જેને આધારે ભવિષ્ય નક્કી થાય છે.
• પ્રારબ્ધ કર્મો	: પૂર્વજન્મનાં કર્મોમાંથી સંજોગો પ્રામ થતાં આ જન્મમાં ભોગવવાનાં થતાં કર્મો.

વેદાંત પ્રમાણે કર્મો :


• નિષિદ્ધ કર્મ	: શાસ્ત્રના વિધાનને તોડીને કરેલું કર્મ.
• સુકર્મ	: શાસ્ત્રમાં દર્શાવેલ કર્મ.
• અકર્મ	: ફળની અપેક્ષા વગરનું કર્મ.

આમ, અનેક રીતે બંધાયેલો મનુષ્ય કર્મની બાબતમાં સ્વતંત્ર છે, સતકર્મો દ્વારા તે જીવનના લક્ષ્યને પામી શકે છે. કર્મયોગી પ્રમાણે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તેને કહેવાય જે સામે છે, શ્રેષ્ઠ સમય વર્તમાન તથા શ્રેષ્ઠ કાર્ય જે તે કરે છે તે કહેવાય છે.

6.6 કર્મયોગ - ભક્તિયોગ - જ્ઞાનયોગનો સમન્વય :

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્વભૂતેથી કહેલ શ્રીમદ્ ભગવત ગીતાના અણાર અધ્યાય છે. તેમાં પ્રથમ છ અધ્યાયમાં કર્મયોગ, અન્ય છમાં ભક્તિયોગ તથા છેલ્લા છ અધ્યાયમાં જ્ઞાનયોગની વાતો છે. આ ત્રણેયનો વિવેકપૂર્વક સમન્વય થાય, તો કાર્ય પૂર્ણ થાય અર્થાત્ શુદ્ધ બને અને આત્મસાક્ષાત્કાર થાય.

તરફે માર્ગ પર ચાલનાર વ્યક્તિનો ઈશ્વર સાથેનો વ્યવહાર અલગ અલગ હોય છે. કર્મયોગી ‘હું ભગવાનનો ઈશ્વર’, ભક્તિમાર્ગી ‘ભગવાન મારો ઈશ્વર’ તથા જ્ઞાનયોગી ‘હું અને ભગવાન રોક છીએ’ એમ કહે છે. ઉપર દર્શાવેલ તરફે માર્ગ પર ચાલનાર મનુષ્ય અંતે પરમાત્માને પ્રાપ્ત કરે છે.



(6) કર્મયોગનો સિદ્ધાંત સમજાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(7) વેદાંત પ્રમાણે કર્મના પ્રકાર જ્ઞાવો, તે દરેકનો અર્થ સમજાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(8) કર્મ એટલે શું ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (9) કર્મયોગ - ભક્તિયોગ - જ્ઞાનયોગ, એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલ છે ?
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
- (10) શું દરેક માર્ગનું અંતિમ ધ્યેય એક છે ? સમજાવો.
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

6.7 સારાંશ :


યોગના વિવિધ માર્ગોમાંથી પોતાને અનુરૂપ યોગમાર્ગ પર ચાલી શકાય છે, તે દરેકનું લક્ષ્ય એક જ છે. ભક્તિયોગ ભાવનાશીલ વ્યક્તિ માટે તથા જ્ઞાનયોગ જુદ્ધિશાળીઓ માટે છે. વળી, કર્મયોગના સિદ્ધાંતો ખૂબ જ ગહન છે. કોઈપણ માર્ગ પર ચાલીને વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે.

6.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જગ્યાઓ :

- (1) ‘ભક્તિયોગ’ એ ‘ભક્તિ’ તથા ‘યોગ’ એ બે શબ્દનો બનેલો છે. ભક્તિ એ સંસ્કૃતના ભજુ ધતુ પરથી આવેલ છે. તેનો અર્થ ‘સમર્પિત થદુ’ તેવો થાય છે. યોગ અર્થાત् ‘જોડાણ’ જે સંસ્કૃતના ‘યુજુ’ ધતુ પરથી બનેલ છે. ઈશ્વરને સમર્પિત થતાં તેની સાથે જોડાણ થાય છે, એ ભક્તિયોગનો અર્થ છે.
- (2) ભક્તિયોગની વિશિષ્ટતા એ છે કે અભિજા, ગરીબ, પૈસાદાર, જ્ઞાની, નિર્બળ, તંદુરસ્ત, કોઈપણ કુળ કે ઉમરની વ્યક્તિ, આ માર્ગ પર ચાલી પોતાનું જીવન સુધારી શકે છે. કોઈપણ વ્યક્તિ ભક્તિ દ્વારા ઈશ્વરને મેળવી શકે છે. તે સૌના માટે સરળ અને સુલભ છે.
- (3) (i) નવધા ભક્તિ
(ii) સાકાર ભક્તિ
(iii) નિરાકાર ભક્તિ
(iv) ગ્રેમલક્ષ્ણા ભક્તિ
- (4) • અહિસક
• અંદર્ભી
• નિરાભિમાની
• સરળ
• વિવેકી
• દ્યાળુ
• લોભ, કામ તથા કોષરહિત.

- (5) પરાવિદ્યામાં આત્માનુભૂતિની વિશિષ્ટ ઘટના બને છે તેને શબ્દોથી સમજાવવી શક્ય નથી. તે આપણા ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીબ તથા ત્વચાથી સમજી ન શકાય.
- (6) • કર્મ કરીએ એટલે કાર્ય નિશ્ચિંત છે.
• કર્મ કરીએ એટલે તરત જ ફળ મળવાનું શરૂ થઈ જાય છે, કદાચ તે લાંબા સમય બાદ ખબર પડે.
• કર્મના ફળનો સિદ્ધાંત બધા પર સમાન રીતે લાગુ પડે છે. તે ગરીબ, અમીર, પાપી કે સાધુ નથી જોતો.
- (7) • નિષિદ્ધ કર્મ : શાકની વિરૂદ્ધ કર્મ.
• સુકર્મ : શાકમાં જાણાવેલ કર્મ.
• અકર્મ : ફળની અપેક્ષા નાગરનું કર્મ.
- (8) કર્મ અર્થાત્ કિયા આપણે જે શારીરિક કે માનસિક કિયા કરીએ છીએ તેને કર્મ કહેવાય. માણસ એક ક્ષણ માટે પણ નિવૃત્ત થતો નથી, સતત કોઈને કોઈ કાર્ય કરતો જ રહે છે.
- (9) ભગવત ગીતામાં ગ્રહેય યોગના સમન્વયની વાતો કરેલી છે. પ્રથમ છ અધ્યાયમાં કર્મયોગ, બીજા છમાં ભક્તિ તથા અંતે જ્ઞાનયોગની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલ છે. આ ગ્રહેય યોગના સમન્વયથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે, ભલે ગ્રહેય માર્ગ પર ચાલનારના વિચાર જુદા હોય.

આકૃતિ



- (10) હા, કોઈપણ યોગમાર્ગ પર ચાલો, પરંતુ તેનું અંતિમ લક્ષ્ય તો એક જ છુદીંઝેમ સાઈકલના આરા જુદી જુદી દિશામાંથી આવીને અંતે તો એક જ બિન્દુએ જોડાય છે, તે રીતે વિવિધ યોગમાર્ગો પણ એક જ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.

એકમ-7 યોગના વિવિધ પ્રકારો - 2

આગળના એકમની જેમ જ અર્થી યોગના પ્રકારો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ છે, તેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને અનુરૂપ માર્ગ પર આગળ વધી હશર પ્રાપ્તિ થઈ શકે છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ તથા કર્મયોગ વિશે આપણે સમજ્યા, હવે એથી આગળ અન્ય યોગ વિશે જાડીશું.

માળખું :

- 7.1 હેતુ
- 7.2 પ્રસ્તાવના
- 7.3 હઠયોગ
- 7.4 સાંખ્યદર્શન
- 7.5 અનાસક્તિયોગ
- 7.6 કુંડલીની યોગ
- 7.7 સારાંશ
- 7.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

7.1 હેતુ :

આ એકમના અંતે તમે ;

- હઠયોગી, તેનાં લક્ષ્યો તથા સાધનપદ્ધતિ વિશે જાડી અભ્યાસ કરી શકશો.
- ‘સાંખ્યદર્શન’ એ પદ્દર્શનોમાંથી એક છે, તેની પ્રાથમિક માહિતી મેળવી શકશો.
- ગાંધીજીએ કહેલ અનાસક્તિયોગ જાડી શકશો.
- કુંડલીની જગરણની પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી શકશો.

7.2 પ્રસ્તાવના :

જ્ઞાનયોગ, ભક્તિયોગ તથા કર્મયોગ વિશે તો આપણે માહિતી મેળવી, એ જ રીતે અન્ય યોગ વિશે પણ આ એકમમાં માહિતી મેળવીશું. આગળ જગતાંથું એ રીતે બધા જ યોગનું અંતિમ લક્ષ્ય એક જ છે. કેટલાંક વિદ્વાનોએ પોતે અનુભવ કરી વિવિધ માર્ગો દર્શાવ્યા છે, તેમાંથી તમને અનુકૂળ હોય તેવો માર્ગ પસંદ કરી શકાય છે. હઠયોગ તથા સાંખ્યયોગ ખૂબ જ પ્રાચીન છે, અનાસક્તિયોગ ગાંધીજીએ આપ્યો છે. આજકાલ કુંડલીની યોગ પણ ખૂબ જ જાણીતો બન્યો છે, તેના વિશે માહિતી મેળવીશું.

7.3 હઠયોગ :

સામાન્ય રીતે આપણે હઠ શબ્દનો અર્થ જીદ કે ખોટો આગ્રહ એવો કરીએ છીએ, પરંતુ હઠયોગમાં આ અર્થ નથી. હઠ શબ્દમાં બે અક્ષરો છે - ‘હ’ અને ‘ઠ’. નાકના જમણા નસકોરાને ‘હ’ અથવા સૂર્યનાડી કહે છે, જ્યારે ડાબા નસકોરાને ‘ઠ’ અર્થાત્ ચંદ્રનાડી કહે છે. એટલો કે ‘હ’ અને ‘ઠ’ બંને શબ્દો અનુકૂળ જમણા અને ડાબા નસકોરા માટે વપરાય છે.

શું તમે ક્યારેય તમારા શાસને જોયો છે? ક્યા નસકોરાથી શાસ લેવાય છે અને ક્યાથી છોડાય છે? શું બને બાજુ શાસ સમાન રીતે ચાલુ હોય છે? બને નસકોરા સાથે કાર્ય કરે છે? આ બધા પ્રક્રિયાની જવાબ યોગમાં છે. બને નસકોરા સામાન્ય રીતે સાથે ચાલુ નથી હોતા, કેટલોક સમય ડાબુ તો કેટલોક સમય જમણું નસકોરું ચાલે છે. હઠયોગ આ બંને નસકોરાના કાર્યને સમ બનાવવાનો પ્રયત્ન કરે છે, અર્થાત્ બંને નસકોરાથી સમાન રીતે સાથે શાસ લેવાય છે અને છોડાય છે.

હઠયોગ શું નથી ?

- હઠયોગ, હઠપૂર્વક અર્થાતું જીદપૂર્વક કરવાનો યોગ નથી.
- હઠયોગની કિયાઓ તાંત્રિક કિયાઓ નથી.
- હઠયોગમાં ટેટલીક ચમત્કારી શક્તિઓ પ્રામ થાય છે, પરંતુ તેનું ધ્યેય ચમત્કાર નથી, તે તો માત્ર તેની આડપેદાશ છે.
- હઠયોગ માત્ર શારીરિક સાધના નથી.
- આરોગ્ય કે લાંબુ જીવન એ તેનું ધ્યેય નથી.

હઠયોગનો અત્યાસ :

હઠયોગ પ્રદીપિકા, ધેરંડસહિતા, શિવસંહિતા જેવા હઠયોગના ગ્રંથોમાં મુખ્યત્વે ચાર પગથિયાનું વર્ણન છે.

- આસન
- પ્રાણાયામ
- મુદ્રા
- સમાધિ

આસન અને પ્રાણાયામ દ્વારા શારીરિક તથા માનસિક શુદ્ધિ થાય છે. શરીર, શાસ તથા મનના ભળો દૂર થાય છે. મુદ્રા દ્વારા શારીરના અમૃતું ભાગો પર ખાસ પ્રભાવ પડે છે, જેમ કે ગ્રંથિઓ. મુદ્રામાં આસન અને પ્રાણાયામ બંનેનો સમન્વય સાધવામાં આવે છે, અંતે કુંડલીની જાગરણની મદદથી સમાધિની સ્થિતિ સુધી પહોંચાય છે. સમાધિની સ્થિતિનું વર્ણન શક્ય નથી, જેમ પાણીમાં મીઠું એકરસ થઈ જાય તેમ આત્મા અને મન એક થઈ જાય છે.

હઠયોગની અન્ય બાબતો :

- હઠયોગી માટે ભિતાદ્વાર ઉત્તમ છે, અર્થાતું વધારે કે તદ્દન ઓદ્ધું ખાવાની મનાઈ છે. ધર્તિ, ચોખા, જવ, દૂધ, ધી, ભાજી, લીલા ચાંદી વગેરે ઉત્તમ ગણાય છે.
- હઠયોગીની કુટીર એકાંતમાં તથા ગુરુની નજીક હોવી જોઈએ.
- હઠયોગીમાં ધીરજ, સાહસ, ઉત્સાહ, સંકલ્પ, શ્રદ્ધા, અત્યાસ તથા લોકસંગનો ત્યાગ આ બધા ગુણો હોવા જોઈએ.
- હઠયોગ દ્વારા ‘અષ્ટસિદ્ધિ’ પ્રામ થાય છે, અર્થાતું હઠયોગમાં આઠ પ્રકારની સિદ્ધિનું વર્ણન છે. જેમ કે, અદ્યિમાં (નાના થવાની શક્તિ), લઘિમા (વજન ઘટાડવાની શક્તિ), પ્રામિ (ગમે ત્યાં પહોંચવાની શક્તિ) વગેરે.
- હઠયોગમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે, એકાંતસ્થળે ગુરુના સ્તાનેધ્યમાં સાધના કરાય છે. હઠયોગીનું શરીર પાતળું, મુખ પર પ્રસાન્તતા, મધુર અવાજ તથા આંખો નિર્મણ હોય છે.

આમ, હઠયોગની સાધના દ્વારા તમે ઈશ્વરપ્રામિ કરી શકો છો. હઠયોગનાં વિવિધ પુસ્તકોમાં તેની સાધન પદ્ધતિમાં હોડી ઘણી વિવિધતા હોવા છતાં, સમજપૂર્વક ગુરુના માર્ગદર્શન ડેઢળ સાધના કરવાથી યોગસિદ્ધિ કરી શકાય છે.

7.4 સાંખ્યદર્શન :

‘સાંખ્યદર્શન’ શબ્દનો અર્થ :

‘દર્શન’ અર્થાતું જોવું, એ દર્શનનો સામાન્ય અર્થ છે. આપણે તેને અધ્યાત્મજ્ઞાનના આધારે જોઈએ તો દર્શન એટલે અંતઃદર્શન, જેમાં ઈન્દ્રિયોથી જોવું શક્ય નથી.

મહર્ષિ કપિલમણીત દર્શન એ સાંખ્યદર્શનના નામે પ્રસિદ્ધ છે. 'સંખ્યા' શબ્દમાંથી 'સાંખ્ય' શબ્દની નિષ્પત્તિ છે. આ 'સંખ્યા' શબ્દના અર્થ મુખ્યપણે બે છે અને એ બેચ શબ્દ એ સાંખ્યદર્શનની વિશેષતા છે. પ્રથમ અર્થ સંખ્યા એટલે એક, બે, ત્રણ વગેરે બીજો અર્થ સંખ્યા એટલે સમુપૂર્વક, તેનો અર્થ સમ્ભગ્રજ્ઞાન થાય. સાંખ્ય મતે પ્રકૃતિ-પુરુષ વિવેક એ સમ્ભગ્રજ્ઞાન છે.

સાંખ્યદર્શનની પ્રાચીનતા અને વ્યાપ:

સાંખ્યદર્શન અત્યંત પ્રાચીન દર્શન છે. ગીતામાં પડ્યા આ શબ્દ વારંવાર પ્રયોગથેલો મળે છે. આ ઉપરાંત સાંખ્યનું વર્જિન ઉપનિષદો, મહાભારત, ભાગવત, આયુર્વેદ, પાતંજલયોગ, શૈવતન્ત્ર તથા ચરકસંહિતામાં મળે છે.

સાંખ્યદર્શન પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડ મુખ્યત્વે બે તત્ત્વનું બનેલું છે. ચેતન અર્થાત્ પુરુષ અને અચેતન અર્થાત્ પ્રકૃતિ. સાંખ્યદર્શન પ્રમાણે આપણે પુરુષ છીએ. પુરુષ અને પ્રકૃતિમાં અત્યંત ગાહેરો સંબંધ છે, આથી આપણે પ્રકૃતિ હોઈએ તેવું લાગે છે. આ બનેના સંયોગથી જે માયાનું નિર્માણ થાય છે, તેનું વિચ્છેદ કરું એ જ યોગ છે.

પુરુષ :

પુરુષ એટલે ચેતન તત્ત્વ. સાંખ્યના મત પ્રમાણે પુરુષનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે, અને તેની સત્તાનો કોઈ પડ્યા રીતે નિષેધ કરી શકતો નથી. પુરુષ સંતૂમ છે, અર્થાત્ તેને કંઈ જોઈતું નથી, તે કંઈ કરતા નથી અને કોઈ ભોગ પડ્યા કરતા નથી. ના તો તે કોઈને પેદા કરે છે, ના કોઈએ એને પેદા કર્યો છે. અર્થાત્ તે સત્ત્વ છે. કાળ દ્વારા તેનું છેદન થતું નથી, તથા ભૂત, ભવિષ્યમાં તેને બાંધી ન શકાય. તે નિર્ગુણાતીત છે.

પ્રકૃતિ :


પ્રકૃતિ એ અચેતન છે, જડ છે. તેમાં ચેતન તત્ત્વ ન હોવાને કારણે આપમેળે કંઈ કરી શકતો નથી. પ્રકૃતિ એ અનાદિ છે. કોઈએ પ્રકૃતિને પેદા કર્યો નથી, પરંતુ આ પેદા કરે છે.

સાંખ્યદર્શનના સિદ્ધાંતો :

- શૂન્યમાંથી કંઈ પડ્યા બનાવવું અશક્ય છે. કંઈ હોય જ નહિ, તો એમાંથી કોઈ સર્જન શક્ય જ નથી. માર્ટીનું માટલું બનાવવું હોય, તો એના માટે માર્ટી જરૂરી છે, પરંતુ કંઈ હોય જ નહિ તો માટલાનું સર્જન શક્ય જ નથી.
- કારણ અને કાર્ય વચ્ચે અત્યંત ધનિષ સંબંધ છે, જેમ કે માર્ટી અને માટલા દર્શનો ધનિષ સંબંધ.
- કોઈપણ કાર્ય કરવા માટે એને અનુરૂપ જ કારણ હોવું જોઈએ. માર્ટીનું માટલું બનાવવા માટે માર્ટીની જરૂર પડે છે, સોનાની મદદથી તે ન જ બનાવી શકાય. કપડું બનાવવા માટે રૂન. જ જરૂર પડે. આમ, દરેક કાર્ય માટે ચોક્કસ કારણ હોય.
- સ્થૂળરૂપમાં પ્રકાશિત થતા પહેલાં ફળ એ સૂક્ષ્મરૂપમાં કારણની અંદર છુપાયલું હોય છે. કપડા તેથાર થતા પહેલાં સૂક્ષ્મરૂપમાં રૂમાં રહેલું હોય છે, સરસવનું તેલ મેળવવું હોય તો લોખંડને પીસવાથી ન મળે.
- કારણ અને કાર્ય ત્યારે જ એકબીજા સાથે એકરૂપ થઈ જાય છે, જ્યારે કારણનું ફરીથી સૂક્ષ્મકરણ થઈ શકે. માર્ટીનું માટલું બનાવવામાં આવે, તો તેના અંતમાં તે ફરીથી માર્ટીનો રેવાઈ જશે. તે જ પ્રમાણે સૂચિના વિનાશ પછી તે પાછી મૂળ કારણમાં ફેરવાઈ જશે.

સાંઘ્યદર્શનની સાધના પદ્ધતિ :

સાંઘ્યદર્શન ઈશ્વરના અસ્તિત્વ બાબતે ઉદાહરણ હુદાસીન છે. સૃષ્ટિનું નિર્માણ ઈશ્વરે નાથી, પરંતુ પ્રકૃતિમાંથી થયું છે એમ માને છે. પ્રકૃતિમાંથી નીચે પ્રમાણે તત્ત્વો ઉત્પન્ન થયાં છે, તે દરેક પર અનુંશ રાખવાથી જીવ મુક્ત થાય છે.



આમ, સાંઘ્યના સિદ્ધાંતો મોટું વ્યવહારિક જીવનમાં પ્રયોગ એ જ યોગ છે. યોગ ઈશ્વરને સ્વીકારે છે, જ્યારે સાંઘ્યમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી. જેઓ નાસ્તિક છે, જેમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તેઓ સાંઘ્યયોગ દ્વારા સૃષ્ટિને સમજુને પરમપદ મામ કરી શકે છે.

૭ તમારી પ્રગતિ ચકાસો :

- (1) ‘હઠયોગ’ શબ્દનો અર્થ સમજાવો.

.....
.....
.....
.....
.....

- (2) હઠયોગનાં પરંપરાગત પુસ્તકોનાં નામ જણાવો.

.....
.....
.....
.....

(3) હઠ્યોગનાં પગથિયાં જગ્ઘાવો.

.....
.....
.....
.....
.....

(4) 'સાંખ્યદર્શન'માં ઈશ્વરનું મહત્વ જગ્ઘાવો.

.....
.....
.....
.....
.....

(5) પુરુષ અને પ્રકૃતિ એટલે શું ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....

(6) 'સાંખ્યદર્શન' શબ્દનો અર્થ જગ્ઘાવો.

.....
.....
.....
.....
.....

7.5 અનાસક્તિ યોગ :

મહાભારતના એક લાખ શ્લોકોમાંથી લીખ્યપર્વના 700 શ્લોકના મહાકાવ્યને શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે, જેના વ્યાસમુનિ રચયિતા છે. તેની રચના ઉત્તમ પ્રેરિની છે, જે સમગ્ર માનવજ્ઞતિ માટે અને ઉપયોગી છે.

આ ગીતા પર અનેક મહાપુરુષોએ પોતાની ટીકાઓ કરી છે, જેમ કે,

લોકમાન્ય તિલક મહારાજ	:	ભગવત ગીતા રહસ્ય, કર્મયોગશાસ્ત્ર
અરવિંદ	:	પૂર્ણયોગ
વિવેકાનંદ	:	રાજ્યયોગ
કાકસાહેબ કાલેલકર	:	ગીતાગ્રંથ
કિશોરલાલ મશરુમવાલા	:	ગીતા મંથન
આચાર્ય વિનોભાઈ	:	ગીતા પ્રવચનો, સામ્યયોગ
ગાંધીજી	:	અનાસક્તિયોગ

'અનાસક્તિ' એટલે કર્મકળ ત્યાગનો સિદ્ધાંન, ફિયાસક્રિન છોડો અને કર્મ કરો. અનાસક્તિમાં અહિસા આવી જ શાય છે. સત્ત પ્રવૃત્તિમાં જીવન ગાળવું અને એના ફળમાં આસક્તિ ન રાખવી એટલે 'અનાસક્તિયોગ' 'મમતા તુ ગઈ મેરે મન સે' એ ભાવ રાખવો.

અનાસક્તિનું ઉત્તમ ઉદાહરણ તુલસીકૃત રામાયણમાં છે. ભગવાન શ્રીરામ રાજ બનવાના હતા, ત્યારે તથા બીજા દિવસે વનવાસ જવાનું સાંખળે છે ત્યારે, બંને સમયે તેમના મુખારવિદમાં કંઈ જ ફરક પડતો નથી. આનું નામ છે અનાસક્તિ.

અનાસક્તિયોગ એટલે જે અભ્યાસ દ્વારા તમારી અનાસક્તિ વધે, અને તેને તમે પ્રયોગ કરીને ઈશ્વર સુધી પહોંચો.

ગાંધીજીના મતે અનાસક્તિ યોગ :

સ્ત્રીઓ, વૈશ્ય તથા શૂદ્ર જંવા, જેમને અક્ષરજ્ઞાન થોંઠું જ છે. જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઈશ્વરા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને માટે ગાંધીજીએ આ અનુવાદ કર્યો છે.

શ્રીમદ્ ભગવદ્ગીતાનો આ અનુવાદ લખતી વખતે ગાંધીજી ગીતા જીવન જીવનાની પોતાની સાધનામાંથી માંડ વખત કાઢી શક્યા હતા. તેમણે હિમાલયમાં કૌસાનીના મુકામમાં તા. 24-6-'29ને દિવસે આ અનુવાદ પૂરો કર્યો, અને એ આખી ચોપડી રાજકોરી હિલચાલની મહાધમાલ દરમિયાન ઉતાવળે છપાઈ ગઈ.

ગાંધીજીએ એને માટે 'અનાશક્તિયોગ' એવું ચોટ્ટુક નામ આપ્યું. આ અનુવાદ બરાબર દાંડીકૂચને દિવસે (તા. 12-3-'30) પ્રકાશિત થયો; અને ગાંધીજી પોતાના 80 સાથીઓ સાથે આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે એની પહેલી નકલો એમના અને એમના એ સાથીઓના હથમાં મુકાઈ.

ગ્રાચીન ભારતીય પરંપરામાં જે મુખ્ય યોગનું વર્ણિન છે, તેમાં આ નથો. મહાત્મા ગાંધીએ પ્રથમ વખત આ શબ્દ આપ્યો. એમણે એમના જીવનનું બધું કાર્ય અનાસક્તિ દ્વારા કરી જીવનને યોગમય બનાવ્યું. જે અનાસક્તિના અભ્યાસ સતત કરે છે, તેમના જીવનની બધી કિયા યોગાભ્યાસ બરાબર છે. ગાંધીજીને પોતાનાં બધાં કાર્યોને ઈશ્વરને સમર્પિત કરી, પોતાને એક દ્રસ્તી ગજાવ્યા. એમનો અનાસક્તિયોગ ખરેખર સુપ્રસિદ્ધ ગીતાના કર્મયોગ પર જ આધારિત છે. તેની બધી કિયા સંપૂર્ણ અનાસક્તિ દ્વારા જ તેવલ પોતાનું કર્તવ્ય નિભાવવા કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ નહું કંઈ નથી કર્યું, જીવનમાં કરીને બતાવ્યું છે એ જ આની ખૂબી છે.

7.6 કુંડલીની યોગ :

આપણે આપણનું સમગ્ર જીવન સુખ મેળવવાની આશામાં વિતાવીએ છીએને. સુખ અંદર જ છે અને તેને પ્રામ કરવા માટે આપણે અંતર્મુખ થયું જોઈએ.

દરેક મનુષ્યમાં એક દિવ્યશક્તિ વસેલી છે, જેનું નામ કુંડલીની છે. આ શક્તિનાં બે રૂપ છે. એકને કારણે આ બાધ્ય જગતનું નિર્મિત થાય છે, અને બીજાને કારણે પરમ સત્યનું જ્ઞાન થાય છે. આ શક્તિનું બાધ્ય અંગ બરાબર કાર્ય કરે છે, પરંતુ અંતર અંગ સુષુપ્ત છે. જ્યારે આંતરિક કુંડલીની શક્તિ જગ્યાત થાય છે, ત્યારે આપણા શરીરની અંદર જુદી જુદી યૌગિક પ્રક્રિયાઓ થવા માટે છે, અને તે આપણને "આત્મ" તરફ દોરી જાય છે.

કુંડલીનીનો ઉલ્લેખ લગભગ બધી જ પ્રાણાલિકાઓમાં એક અથવા બીજા રૂપે કરવામાં આવ્યો છે. આ કુંડલીની એ પરાશક્તિ છે, જેને ભારતના ઋષિજ્ઞનો વિશ્વજ્ઞનની તરીકે પૂજે છે. શક્તિ એ શિવની પત્ની છે, તે નિર્જુલા નિરાકાર બ્રહ્મનું સહીય રૂપ છે. આનંદના ઉપાસકો તેને 'આનંદ' કહે છે, જ્યારે યોગીઓ તેને લક્ષ્ય માને છે. જ્યારે તે આપણી અંદર જગ્યાત થાય છે, ત્યારે આપણે તેને અંતરમાં પૂર્ણ પ્રકાશરૂપે જળહળતી જોઈ શકીએ છીએ.

આ દેવી શક્તિ એ આપણા આત્માની શક્તિ છે. વિશ્વની ભધ્યમાં રહીને તે તેનું નિયંત્રણ કરીને પાલનપોષણ કરે છે, તેવી રીતે તે શરીરના મધ્યભાગમાં કરોડ્ઝજુની નીચે મૂલાધાર ચક્કમાં રહીને 72,000 નાડીઓ દ્વારા આપણા શરીરનું સંચાલન અને નિયંત્રણ કરે છે.

કુંડલીની જગૃતિની પ્રક્રિયા :

માનવશરીરમાં કુંડલીની શરીરની મધ્યમાં કરોડ૨જજુને છેડે આવેલા મૂલાધાર ચક્કમાં છે, મૂળ જેનો આધાર છે તેને મૂલાધાર કહેવાય છે. તેમાં શક્તિ સાડા ત્રણ અંદરનું ગુંચણું વાળીને સૂક્ષ્મ રીતે નિવાસ કરે છે, તેથી તેને કુંડલીની, ગુંચણું વાળેલી કુંડળ આકારની કરેવામાં આવે છે. સુષુપ્તા નાડી કે શરીરની 72,000 નાડીઓનું નિયંત્રણ કરે છે, તે જ્યાં કુંડલીની ગુંચણું વાળીને રહેલી છે ત્યાંથી શરૂ થઈને મસ્તકના મધ્યમાં પરમશિવનું ધામ છે ત્યાં સુધી વિસ્તરેલી છે. તેમાં ચિત્રિક્ષી નામની સૂક્ષ્મ નાડી છે, જેની મદદથી કુંડલીની ઉપર નીચે આવ-જા કરે.

આ કુંડલીની શક્તિ અનેક પ્રકારે જગાડી શકાય છે. આ સુષુપ્ત કુંડલીની ઈશ્વરની અનન્ય ભક્તિથી, પ્રાણાયામ, મુદ્રા, જ્યોતિરિક્ષણ, ધ્યાન આદિ સાધનાથી જગૃત રીતી શકાય છે, ઉપરાંત ગુરુ પાસેથી શક્તિચંત્ર દ્વારા પણ જગૃત કરી શકાય છે.

નીચેનાં 7 ચકોનો અનુભવ યોગ અને ધ્યાન દ્વારા થાય છે. શરીરરચના વિજ્ઞાનનો ગ્રન્થ્યાસ કરવાથી તમે તેને શોધી શકશો નહિ.

જ્ઞાન, ભક્તિ કે રાજ્યોગના પથિકનું ધ્યાન કુંડલીની જગરણ તરફ નથી છોટું. તે તો તેમને માટે માર્ગ પર આવતી એક ધટનાછે. માત્ર હઠ્યોગમાં આના માટે રાસ સાધના પ્રયોજવામાં આવી છે. માર્ગ ગારે તે હોય પણ અધ્યાત્મપથ પર ચાલનાર અને આગળ વધનાર સાધકના જીવનમાં કુંડલીની જગરણની ઘટના કોઈ સ્વરૂપે બને છે.

ચક્ક	૧ મુલાખાર ચક્ક	૨ સ્વાપિકાન ચક્ક	૩ મહિષૂર ચક્ક	૪ આનપાહત ચક્ક	૫ વિશુદ્ધ ચક્ક	૬ આજાચક્ક	૭ સહારનાર ચક્ક
ચક્કસ્થાન	ગુદાથી બે અંગળ ઉપર અને ઉપસ્થ મૂલથી બે આંગળ થૈની સ્થાનનાં	મૂલાખાર ચક્કથી બે આંગળ (ઉપર તરીકે)	નાલિન	કુદા	કુદા	બંને લ્યામરોની વચ્ચે કુપળાં	મરતકમાં તાહુની ઉપર
આકૃતિ	લાલ રંગના પ્રકાશથી ઉજુજુઘળ થયેલ એ પંખું વાજુ કુમળ સમાન	સિદ્ધારીયા રંગથી પ્રકાશિત પ્રકાશથી દ પંખુંવાળા કુમળ સમાન	વાડળી રંગથી પ્રકાશિત દસ પંખું ધરવાનું કુમળ સમાન	સિદ્ધારીયા રંગના પ્રકાશથી પ્રકાશિત ૧૨ પંખુંવાળો	દુંઘળા પ્રકાશથી પ્રકાશિત ૧૬ પંખુંવાળોવાળા કુમળ જીવી આકૃતિ	શેત પ્રકાશથી પ્રકાશિત દુંઘળા પ્રકાશથી પ્રકાશિત ૨ પંખુંવાળો	વિવિધ રંગના પ્રકાશથી પ્રકાશિત સહલ પાંખુંવાળો વાળા કુમળ જીવી આકૃતિ
કુ. ૧૨ છ્યાત્રાનું ૫૧	આરોગ્ય, ચિમાની સૈંપદ અવસ્થા, કાલે પ્રાણદક્ષતા નિલંઘ	સર્જન રંને પલનમાં સમધિપણું અને જિફ્ફા શક્તિ સાથે જોડાયેલું પર સરરાસ્તની વાસ	સર્જન રંને પલનમાં કાયદુલંઘનું ઝાન, શક્તિ સાથે જોડાયેલું જ્ય કરે, યોગની આહેકાર સાથે જોડાયેલું.	શાંતિના, શોકમુકા, દીર્ઘજીવી, કવિ હાશનાની થવાથી, સ્થૂળ દુપ્તમાં અંતઃ સ્નાપ સાથે, મન, શરીર, આહેકાર સાથે જોડાયેલું.	લિન-ટિના, ચક્કાના ધ્યાનથી કે કણ નણે છે તે બ્યુ કણ સાચા વિષેકની જોગાયુદ્ધ	અમરત્વ અનુકૂ	

૭ તમારી પ્રગતિ ચકાસો :

(7) 'અનાસક્તિ યોગ' એટલે શું ?

.....
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..

(8) શરીરમાં કેટલાં ચકો આવેલાં છે ? ક્યાં ક્યાં ? તે દરેકનું સ્થાન જણાવો.

.....
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..

(9) કુંડલીની સૂક્ષ્મ રીતે માનવશરીરમાં ક્યાં આવેલી હોય છે ?

.....
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..

(10) ગાંધીજીએ ગીતાનો અનુવાદ શા માટે કર્યો ?


.....
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..
 ..

7.7 સારાંશ :

હાયોગ દ્વારા શારીરિક રીતે કષ વેઢીને તેનાં ચાર પગથિયાં દ્વારા સમાધિની સ્થિતિએ ઘડ્યોચાય છે. સાંખ્યદર્શન એ ઘટદર્શનોમાંનું એક છે, જે ભારતીય પરંપરામાં ઉત્તમ ગ્રંથ છે, જેમાં નાસ્તિક કે જેઓ ઈ ભર વિશ્વાસી નથી તેઓ પક્ષ વિશ્વાસ કરે છે. ગાંધીજી રચિત અનાસક્તિયોગ તથા કુંડલીની યોગ દરેક દ્વારા આનન્દાવાથી અંતે મોક્ષ મળે છે.

7.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

- (1) સામાન્ય રીતે આપણે હઠ શબ્દનો અર્થ જીદ કે ખોટો આગ્રહ એવો કરીએ છીએ, પરંતુ હઠયોગમાં આ અર્થ નથી. હઠ શબ્દમાં બે અક્ષરો છે - 'હ' અને 'ઠ'. નાકના જમજા નસકોરાને 'હ' અથવા સૂર્યનાડી કહે છે, જ્યારે ડાબા નસકોરાને 'ઠ' અર્થાત્ ચંદ્રનાડી કહે છે. એટલે કે 'હ' અને 'ઠ' બંને શબ્દો અનુક્રમે જમજા અને ડાબા નસકોરા માટે વપરાય છે.
- (2)
 - હઠયોગ પ્રદીપિકા
 - શિવસંહિતા
 - ઘેરેં સંહિતા
- (3)



- (4) સાંખ્યદર્શનમાં ઈશ્વરનું મહત્વ નથી. તે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતું નથી, તેના મત પ્રમાણે ઈશ્વરથી આ જગતનું નિર્માણ થયું નથી, પરંતુ જગતની ઉત્પત્તિ પ્રકૃતિ. અને પુરુષથી થઈ છે.

- (5) પુરુષ : પુરુષ એટલે ચેતન તત્ત્વ. સાંખ્યના મત પ્રમાણે પુરુષનું અસ્તિત્વ સ્વયંसિદ્ધ છે, અને તેની સત્તાનો કોઈ પણ રીતે નિર્ભેષ કરી શકતો નથી. પુરુષ સંતૂર છે, અથાત્ તેને કંઈ જોઈતું નથી. તે કંઈ કરતા નથી અને કોઈ ભોગ પણ કરતા નથી. ના તો તે કોઈને પેદા કરે છે, ના કોઈએ અને પેદા કર્યો છે. અર્થાત્ તે સત્ય છે. કાળ દ્વારા તેનું છેદન થયું નથી તથા ભૂત, ભવિષ્યમાં તેને બાંધી ન શકાય, તે ત્રિગુણાદી છે.

પ્રકૃતિ : પ્રકૃતિ એ અચેતન છે, જડ છે, તેમાં ચેતન તત્ત્વ ન હોવાને કારણે આપમેળે કંઈ કરી શકતો નથી. પ્રકૃતિ એ અનાદિ છે. કોઈએ પ્રકૃતિને પેદા કર્યો નથી, પરંતુ આ પેદા કરે છે.

- (6) ‘સાંખ્યદર્શન’ શબ્દનો અર્થ : ‘દર્શન’ અર્થાત્ જોવું, એ દર્શનનો સામાન્ય અર્થ છે. આપણે તેને આધ્યાત્મજ્ઞાનના આધારે જોઈએ તો દર્શન એટલે ગંતઃદર્શન, જેમાં ઈન્દ્રિયોથી જોવું શક્ય નથી.

મહર્ષિ કપિલમજ્ઞીત દર્શન એ સાંખ્યદર્શનના નામે પ્રસિદ્ધ છે. ‘સંખ્યા’ શબ્દમાંથી ‘સંખ્ય’ શબ્દની નિર્ણયિત છે. આ ‘સંખ્યા’ શબ્દના અર્થ મુખ્યપણે બે છે અને એ બેદ્ય શાદ એ સાંખ્યદર્શનની વિશેષતા છે. પ્રથમ અર્થ સંખ્યા એટલે એક, બે, ત્રણ વગેરે. બીજો અર્થ સંખ્યા એટલે ભમ્પૂર્વક તેનો અર્થ સમ્યગ્જ્ઞાન થાય. સાંખ્ય માત્ર પ્રકૃતિ-પુરુષ વિવેક એ સમ્યગ્જ્ઞાન છે.

- (7) ‘અનાસક્તિ’ એટલે કર્મકણ, ત્યાગનો સિદ્ધાંત, ફળાસક્તિ જોડો અને કર્મ કરો. અનાસક્તિમાં અહિસા આવી જ જ્ઞાય છે. સત્તુ પ્રવૃત્તિમાં જીવન ગાળવું અને એના ફળમાં આસક્તિ ન રાખવી એટલે ‘અનાસક્તિયોગ’ ‘મમતા તુ ગઈ મેરે મન સે’ એ ભાવ રાખવો.

(8) શરીરમાં કુલ સાત ચકો આવેલ છે. તેમનાં નામ તથા સ્થાન નીચે મુજબ છે.

	ચક	સ્થાન
1	મૂલાધાર ચક	ગુદાથી બે આંગળ ઉપર
2	સ્વાધિષ્ઠાન ચક	મૂલાધાર ચકથી બે આંગળ નીચે
3	મણિપુર ચક	નાભિ
4	અનાહિત ચક	ફ્રદ્ય
5	વિશુદ્ધ ચક	કંઠ
6	આશા ચક	બંને અમરોની ઉપર
7	સહસ્રાર ચક	મસ્તકમાં તાલુની ઉપર

(9) માનવશરીરમાં કુંડલીની શરીરની મધ્યમાં કરોડરજજુને છેઠે આવેલા મૂલાધાર ચકમાં છે, મૂળ જેનો આધાર છે તેને મૂલાધાર કહેવાય છે. તેમાં શક્તિ સાડા નાશ અંટાનું ગુંચળું વાળીને સૂક્ષ્મ રીતે નિવાસ કરે છે

(10) સ્ત્રીઓ, વૈશ્ય તથા શૂદ્ર જેવા, જેમને અસરક્ષાન થોડું જ છે. જેમને મૂળ સંરક્ષૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઈદ્ઘા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને માટે ગાંધીજીએ આ અનુવાદ કર્યો છે.

એકમ-૪ : અષ્ટાંગ્યોગ - યમ તથા નિયમ

યોગના ધ્યાન પ્રકારો વિશે આપણે જાણ્યું. આ ઉપરાંત અન્ય પ્રકારો પક્ષ છે, પક્ષ અહીં સમાવવા શક્ય નથી. એવો પ્રશ્ન થાય કે યોગના બધા પ્રકારોમાંથી એકનો લાલ શા માટે લેવો? વિવિધ યોગાભ્યાસમાંથી થોંં થોંં લઈ પોતાની ખપ પ્રમાણે યોગાભ્યાસ ગોઠવી શકાય, તથા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રગતિ કરી શકાય. અહીં આપણે 'અષ્ટાંગ્યોગ' વિશે વાત કરીશું, જે સામાન્ય, ભધ્યમ તથા ઉત્તમ માણસ માટે સુલભ છે.

માળખું :

- 8.1 હેતુ
- 8.2 પ્રસ્તાવના
- 8.3 યમ
- 8.4 નિયમ
- 8.5 યમ-નિયમનું મહત્વ
- 8.6 સારાંશ
- 8.7 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો

8.1 હેતુ:


આ એકમના અંતે તમે ;

- અષ્ટાંગ્યોગ વિશે માહિતી મેળવી શકશો.
- પાંચ યમ : અહિસા, સત્ય, અસ્ત્રે, બ્રહ્મયર્થ તથા અપરિંગ્રહ વિશે જાણી શકશો તથા જીવનમાં તેનું મહત્વ તથા સ્થાન સમજીશરો.
- પાંચ નિયમો : તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન, શૌચ તથા સંતોષનું જીવનમાં મહત્વ સમજી જીવનમાં ઉતારી શકશો.
- યમ-નિયમની વ્યવહારમાં ઉપયોગિતા સમજી શકશો.

8.2 પ્રસ્તાવના :

આગળના એકમમાં આપણે વિવિધ યોગમાર્ગો વિશે જાણ્યું. વિવિધ યોગમાર્ગોમાં જે મુદ્દાઓ પર ભાર મુકાયો છે, તે બધાનો સમન્વય કરી કમબધ્ય ગોઠવકી કરતાં અષ્ટાંગ્યોગ બને છે. જેમ એક-એક પગથિયું ચઢી લક્ષ્ય સુધી પહોંચાય છે, તેમ યોગના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા મહર્ષિ પતંજલિને યોગવિજ્ઞાનને વિલાઘત કરીને આઠ ભાગ પાડ્યા છે, અર્થાત્ આઠ પગથિયાં આપ્યાં છે. તેનું વર્ણન મહર્ષિ પતંજલિ રચિત 'યોગદર્શન' માં વિસ્તારપૂર્વક કરેલું છે. યોગની પરિભાષામાં આ આઠ પગથિયાને 'અંગ' કહે છે, જેથી 'અષ્ટાંગ્યોગ' અર્થાત્ આઠ અંગ એવું નામ પણું છે.

અષ્ટાંગયોગનાં આठ પગથિયાં



યોગનાં આ આઠ પગથિયાં એક પછી એક સિદ્ધ કરવાનાં છે, એક સિદ્ધ થયા પછી જ બીજા પર જતું જરૂરી નથી. નીચેના પગથિયાં કેટલા જલ્દી સિદ્ધ થાય, તેટલા જરૂરી ઉપરનાં પગથિયાં સિદ્ધ કરી શકે છીએ. યમ-નિયમના પાલન વગર આસન અભ્યાસ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરીએ તો અભ્યાસમાં પરિપૂર્ણતા નથી આવતી. છતાં કેટલાંક આસન કે ધ્યાનથી યોગાભ્યાસ શરૂ કરી દે છે, પરંતુ યમ-નિયમ જેવા શરૂઆતનાં પગથિયાં જ અભ્યાસમાં દફતા અપાવે છે. પગથિયાં એકબીજાનાં પૂરક છે, એમ સમજને સાધના શરૂ કરવી જોઈએ.

અંતરંગ અને બહિરંગ યોગ

અષ્ટાંગયોગના આઠમાંથી મ્રથમ ચાર - યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ બહારની કિયા સાથે સંબંધિત છે. આથી તેને 'બહિરંગ યોગ' કહેવાય છે.

છેલ્લાં ચાર અંગો અર્થાત પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અંદરની કિય. અર્થાત અંત:કરણ સાથે સંબંધિત છે તેથી 'અંતરંગ યોગ' કહેવાય છે.

દરેક અંગો વિશે હવે આપણે વિસ્તારપૂર્વક સમજુશું.

8.3 યમ :

યમ એ અષ્ટાંગયોગનું મ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ પાંચ પ્રકારના યમનું વર્ણિન કર્યું છે, જે નીચે મુજબ છે.

- (1) અંહિસા
- (2) સત્ય
- (3) અસ્તેય
- (4) બ્રહ્મચર્ય
- (5) અપરિગ્રહ

(1) અહિસા:

સામાન્ય રીતે 'દુઃખ ન આપવું' તેને અહિસા કહેવામાં આવે છે, પછી તે શારીરિક હોય કે માનસિક. યોગની પરિભાષામાં હિસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. કોઈપણ જીવને શરીર, વાણી અને મનથી કષ્ટ નથી પહોંચાડવાનું, આમાં પોતે પણ આવી જઈએ.

શરીરની અહિસા અર્થાતું શારીરિક રીતે કોઈને કષ્ટ ન પહોંચાડવું તે. વાણીની અહિસા એટલે કટુવચન બોલી કોઈને દુઃખ ન પહોંચાડવું તે તથા મનની અહિસા એટલે મનથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છાવું તે, આવી અહિસાનું જે પાલન કરે છે તે યોગમાર્ગમાં ગુપ્તથી આગળ વર્ણી શકે છે.

અહિસા અન્ય યમ-નિયમોનું મૂળ છે, તેને પરમધર્મ કહેવાય છે. અહિસાના પાલનથી મોહ, કોષ તથા લોભનો નાશ થાય છે. મહર્ષિ પતંજલિએ અહિસાનું મહત્વ સમજવતાં યોગસુત્રમાં કહું છે કે, અહિસાનું પાલન કરનાર વ્યક્તિના સાત્ત્બિધમાં આવનારનો વેરભાવ દૂર થાય છે, તથા તે મિત્ર બને છે.

મહાત્મા ગાંધીએ પણ અહિસાનું મહત્વ સમજવતાં કહું છે કે અહિસાથી આપણે સમગ્ર જગતને મિત્ર બનાવી શકીએ છીએ, તેનાથી શાંતિ અને સુખમાં વધારો થાય છે. અભિમાન દૂર થાય છે અને નાત્રા વધે છે.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અહિસાનો અર્થ 'દ્વેષરહિત બનવું' તેવો કરે છે. દુનિયાના હિત-અહિતનો વિચાર કર્યા વિના જે કાર્ય કરવામાં આવે તે હિસા છે. ધર્મના વિકાસ માટે કે લોકકલ્યાણ માટે હિસા કરવામાં આવે તો તેમાં દોષ નથી. શ્રીકૃષ્ણે કહેલા આ અહિસાના વાસ્તવિક અર્થને જ્ઞાન્યા બાદ અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો હતો અને તેના હાથે સંદાર થયો, છતાં તેને પાપ લાગ્યું નહિએ.

આમ, પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું તે હિસા છે. જીબના સ્વાદ માટે પણુંઓને મારાવા તે હિસા છે, પરંતુ ડોક્ટર રોગીના શરીરને કષ્ટ આપી તેને સાજે કરે છે તે હિસા નથી. આમ, મન, વાણી અને શરીરથી અહિસાનું પાલન કરી યોગમાર્ગમાં આગળ વધવું જોઈએ.

(2) સત્ય:

આપણે જે વાત જેવી સંભળી છે, તેને તેવી રીતે કહેવી તેને સત્ય કહેવામાં આવે છે, પરંતુ સત્યની આ વ્યાખ્યા અપૂર્ણ છે. જીવનનાં સાચાં મૂલ્યોનો સ્વીકાર અને જૂદું બોલવાના સંપૂર્ણ ત્યાગને સત્ય કહેવાય. પરંતુ ઘણી વખત ખોટું બોલીને અન્યનું ભલું કરવાનું હોય છે. મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણી વખત જૂદું બોલીને દર્દીને સાજે કરવામાં આવે છે, છતાં તેને જૂદું નથી કહેવાનું.

સ્વાર્થ બનીને જૂદું બોલનારને અસંખ્ય વખત અસત્ય બોલવું પડે છે અને મન સતત તેમાં પરોવાયેલું રહે છે. મન શાંતિનો અનુભવ કરતું નથી, આથી જે આપણે બેલીએ તેમાં મન અને વાણી સમાન હોવાં જોઈએ. જેનાથી હિત થાય તે સત્ય અને જેનાથી અહિત થાય તે અસત્ય કહેવાય. આમ, સત્યને બરાબર સુમજૂને યોગમાર્ગના અન્યાસીએ સાહસ તથા પ્રમાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(3) અસ્તેય:

અસ્તેય એટલે ચોરી ન કરવી. અહીં અસ્તેયનો અર્થ સ્થૂળ રૂપમાં ન લેતાં સૂક્ષ્મરૂપમાં વિચારવો જોઈએ, જે પોતાનું નથી તેણું કંઈપણ પોતાનું માની અધિકાર રાખવો તેને ચોરી કહેવાય. બીજાની ચીજને તેની

રજી સિવાય લેવી તેને ચોરી કહેવાય, કર્તવ્યની ચોરી એ મોટી ગુપ્ત ચોરી હૈ. મજૂરી નક્કી કરાવીને જેટલો સમય અને જેટલું કામ કરાવવાનું નક્કી કર્યું છે, તેમાં ઘટાડે કરવો, આપસ કરવી, સોંપેલું કાર્ય ન કરવું - આ બધી બાબતો આજે સામાન્ય બની ગઈ છે. આ પણ ચોરી જ છે.

અસ્તેયનો અર્થ છે ધર્મપૂર્વક. જે વસ્તુ જેટલા પ્રમાણમાં પોતાને મળવી જોઈએ, તેને તેટલા જ પ્રમાણમાં લાવવી. પૂરી કિંમત ચૂકવીને કોઈ વસ્તુ મેળવવામાં આવે તો ચોરી નથી. પોતે ચોરીથી બચવું જોઈએ અને સાચે-સાચે બીજાને પણ બચાવવા જોઈએ. યોગમાર્ગના સાધકે આ બંને બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને 'ધર્મ'ના આ અંગ પર પ્રભુત્વ મેળવવું જોઈએ.

(4) ભ્રાહ્મચર્યઃ

ભ્રાહ્મચર્ય એટલે સ્ત્રીસંપર્ક ન કરવો - તેમ સામાન્ય રીતે સમજવામાં આવે છે, પરંતુ ભ્રાહ્મચર્યનો અર્થ છે ભ્રાહ્મામિ માટે આવશ્યક વર્તન. ભ્રાહ્મચર્ય એટલે વિચાર અને આચારમાં બધી દિન્દ્રિયોનો સંપર્મ, દિન્દ્રિય સંયમનો અર્થાત્ વિવેકની સાચે મર્યાદામાં રહીને દિન્દ્રિયોનો ઉપયોગ કરવો. ભ્રાહ્મચર્યનું પાલન મન, વચન અને શરીરથી થતું જોઈએ. શરીર કાબૂમાં રહે, પણ મન વિકારમાં રહે તો તેનો કોઈ અર્થ નથી. આપણે મન પર નિયંત્રણ લાવવાનું શીખવાનું છે.

વીર્યનું શાસ્ત્રોમાં વર્ષન કરાયું છે તે મુજબ વીર્ય અર્થાત્ તાકાત, તેજ, શારીરિક નહિ પરંતુ મનોદૈહિક તાકાત. ભ્રાહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક પ્રગતિ જલ્દી થાય છે તથા શક્તિનો સંચય થાય છે.

(5) અપરિગ્રહઃ

અપરિગ્રહ એટલે લોભને કારણે થતી સંગ્રહવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો જરૂરિયાત ઉપરાંતનો સંગ્રહ ન કરવો, ઓછી જરૂરિયાતો અને ખરેખર આવશ્યક હોય તેટલું જ પોતાની પાસે રાખવું એ સાધક માટે બહુ ઉપયોગી જીવનપદ્ધતિ છે. અપરિગ્રહ એ માત્ર સ્થૂળ સ્તર પર નહિ, પણ સાધકનું મન પણ દઢ હોટું જોઈએ. મનમાં લોભ જણે તો તે પણ નકામું છે.

ધનવાનના ધરોમાં બિનજરૂરી ધર્ષી વસ્તુઓ બગડી જતી હોય છે, જ્યારે : ઈલો તે મેળવવા આમથી તેમ ભટક્યા કરે છે. બધા પોતાની જરૂરિયાત મુજબ સંગ્રહ કરે તો અછત ઉભી થાય નહિ, અને બધા સંતોષથી રહી શકે. મનુષ્ય એટલો જ સાચો આનંદ મેળવી શકે છે, જેટલો અપરિગ્રહી હશે.

તમારી પ્રગતિ ચકાસો :

(1) અસ્ત્રાંગયોગનાં પગથિયાં કયાં છે ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(2) અહિસા એટલે શું ? શ્રીકૃષ્ણે અહિસાનો અર્થ શું કહ્યો છે ?

.....

(3) અસ્તેયનો સૂક્ષ્મ અર્થ સમજાવો.

.....

(4) અપરિગ્રહની વાખ્યા આપો.

.....

આમ, દ્વિદ્ધિયો પર સંયમ તથા મન પર કાબુ મેળવવા યમનું પાલન જરૂરી છે. સમાજનું વાતાવરણ દૂષિત હોય તો વ્યક્તિનો વિકાસ થતો નથી. યમ સમાજજીવનમાં પાળવાના નિયમો છે, જ્યાં યમનું પાલન થતું હોય તેવા સમાજમાં રહેનાર વ્યક્તિ સારો વિકાસ સાધી શકે છે. તમામ જીતિ, નમામ સ્થળ તથા તમામ સમયે આ પાંચેય યમનું પાલન થતું જોઈએ.

8.4 નિયમ :

મહર્ષિ પતંજલિના અધારાંગયોગનું બીજું પગથિયું નિયમ છે, તેમણે યમની જેમ પાંચ નિયમો આપ્યા છે, જે નીચે મુજબ છે.

- (1) શૌચ
- (2) સંતોષ
- (3) તપ
- (4) સ્વાધ્યાય
- (5) ઈશ્વરમાલિકિયાન.

(1) શૌચ :

શૌચ એટલે શુદ્ધિ કે પવિત્રતા. આ શુદ્ધિ બે પ્રકારની કદી શક્કાય

- સ્નાન વગેરેથી બાબ્દ શુદ્ધિ
- પવિત્ર ખોરાકથી આંતરિક શુદ્ધિ

આ તો થઈ શરીરની શુદ્ધિ, પણ સાથે સાથે મનની શુદ્ધિ પણ જરૂરી છે. અભિમાન, ઈર્ષા, રાગ, દેષ, દુઃખ વગેરેથી દૂર રહી મનની શુદ્ધિ કરવામાં આવે છે. અંદરની આંતરિક શુદ્ધિ થાય તો જ બાબ્દ શુદ્ધિનો કોઈ અર્થ છે.

સ્વાસ્થ્ય પવિત્રતા પર આધાર રાખે છે, બિમારીનું કારણ અપવિત્રતા છે. આથી જે કાંશે શરીરમાં અસ્વચ્છતા ઉત્પન્ન થાય, ત્યારે જ તેને દૂર કરો. જે સફાઈનું ઘ્યાન નથી રાખતા તે યોગના પ્રથમ નિયમને તોડે છે.

(2) સંતોષ :

શરીરને ટકાવવા જે પદાર્�ોની જરૂર છે, તે સિવાયના પદાર્થો મેળવવાની અનિન્યાને સંતોષ કહેવાય. જેની જરૂરિયાતો ઓછી તે વધુ સુખી. સુખનું મૂળ સંતોષ છે, ને દુઃખનું મૂળ દુઃખ છે. આથી જેને સુખી થતું હોય તેણે સંતોષી બનવું પડે.

સાદું જીવન અને ઉત્તમ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી હંમેશા પ્રસન્ન રહે છે તથા આનંદમય જીવન જીવે છે. કોઈપણ પરિસ્થિતિમાં તેના મોઢા પર પ્રસન્નતા રહે છે. આમ, યોગાન્યાસીઓએ સંતોષી રહેવું જોઈએ.

(3) તપ :

તપ શબ્દ 'તપ' ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ 'તપવું' એવો થાય છે. જેમ સુવર્ણને તપાવવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ બળી જાય છે, તેમ સાધકના મન તથા શરીરને તપાવીને તેને શુદ્ધ કરનારી કેટલીક ડિયાને તપ કહેવાય છે.

યોગસાધકે પોતાની સાંનામાં સફળ થવા માટે આકર્ષણ તપ કરવું જોઈએ. આ એપમાં શરીર, વાર્ષી તથા મનનું તપ આવી જાય છે. શારીરિક તથા માનસિક રીતે ફળની આશા વિનાના તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

(4) સ્વાધ્યાય :

સ્વાધ્યાયને સામાન્ય રીતે ગ્રંથ રીતે સમજ શકાય.

- વેદ, શાસ્ત્રોનું વાંચન
- વાંચેલા વિષય પર ચિંતન
- ઈશ્વરનો જપ.

આ સિવાય સૂક્ષ્મ અર્થમાં પોતાના જીવનમાં અધ્યયનો પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે, જેથી પોતાના 'સ્વ'ને ઓળખી શકાય. સ્વાધ્યાયથી મન અંતઃમુખી બને છે, તથા યોગમાં પ્ર.તિ માટે તે આવશ્યક છે.

(5) ઈશ્વરપ્રણિધાન :

પ્રણિધાન એટલે ધારણા કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણા કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો. સ્થૂળ રૂપમાં સેવાપૂજા, જપ, પાઠ, યજ વગેરે ભાવપૂર્વક કરવું તથા સૂક્ષ્મરૂપમાં તન, મન તથા આત્માથી પ્રેમપૂર્વક ઈશ્વરને સમર્પિત થઈ જવું તે ઈશ્વરપ્રણિધાન. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગ, ભ્યાસ સરળ બને છે તથા સરળતા પ્રાપ્ત થાય છે. મહર્ષિ પતંજલિ ઈશ્વરપ્રણિધાનનું મહત્વ સમજાવતાં કરે છે કે ઈશ્વરપ્રણિધાનથી મોક્ષ મળે છે.

8.5 યમ-નિયમનું મહત્વ :

આજની તનાવઘર્સ્ત આધુનિક દુનિયામાં યમ-નિયમનું પાલન કરવું અધરૂ છે, પરંતુ આંભવ તો નથી જ. યોગના વિધાથીઓએ આ બંનેનું શરીર, મન તથા વચનથી શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. યમ-નિયમના પાલનથી વ્યક્તિ તથા સમાજ બંનેનું ઘડતર થાય છે.

યોગનું અંતિમ લક્ષ્ય સુખ છે, શાંતિ છે, પરિપૂર્ણતા છે. આ માટે પ્રથમ તો વ્યક્તિએ પોતાના વર્તન-વ્યવહારમાં શુદ્ધિ લાવવી પડશે, ત્યારે જ માનસિક શાંતિ મળશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. છતાં બધા યમ-નિયમનું

પાલન કરવું શક્ય ન હોય, તો માત્ર એક જ ધમ કે નિયમને જીવનમાં ઉત્તરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ, ધમ-નિયમ એ અધિંગયોગના મૂળભૂત પાયા છે. ધોગાભાસની તૈયારીનું પગથિયાં છે, ત્યારબાદ જ સાધક આગળ વધી શકે છે. પાંચ ધમ તથા પાંચ નિયમના પાલનન્થી સાધક મનોશારીરિક રીતે સક્ષમ બને છે અને શરીર તથા મનના અન્ય અભ્યાસ જેવા કે આસન, પ્રાણાયામ માટે તૈયાર થાય છે. આમ, ધમ-નિયમની સાપ્તનાશી ધોગ દ્વારા ગ્રામ થનાર સિદ્ધિઓ સહજતાથી મળે છે.

૭ તમારી પ્રગતિ ચકાસો :

- (5) નિયમો કેટલા છે ? કયા કયા ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (6) તપ શબ્દનો અર્થ સમજાવી, તપનું મહત્વ જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (7) શૌચ એટલે શું ?

.....
.....
.....
.....
.....
.....
.....


8.6 સાંરાશ :

ધમના પાલનની ઉત્તમ સામાજિક વાતાવરણ સર્જ્ય છે, જ્યારે નિધનથી જરૂરી વ્યક્તિગત ગુણો ખીલે છે. ધમ-નિયમ બનેની સિદ્ધિઓ અસાધારણ છે. અહિસા તથા સત્યથી વેરનો ત્યાગ થાય છે. અસ્તેય તથા અપરિગ્રહથી મન પર કાબૂ આવે છે. સંતોષથી સુખ મળે છે, શૌચથી પવિત્રતા તથા તપથી મનના દોષો દૂર થાય છે. દરેક ધમ-નિયમનું પાલન કરવાથી ઈશ્વરમાસીનો માર્ગ સરળ બને છે.

8.7 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

(1)

અષ્ટંગયોગનાં આठ પગથિયાં



- (2) સામાન્ય રીતે 'દુઃખ ન આપવું' તેને અહિસા કહેવામાં આવે છે, પછી તે શરીરિક હોય કે માનસિક યોગની પરિભાષામાં હિસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. કોઈપણ જીવને શરીર, વાકી અને મનથી કષ્ટ નથી પહોંચાડવાનો, આમાં પોતે પણ આવી જઈએ.

ભગવત् ગીતામાં શ્રીકૃષ્ણ અહિસાનો અર્થ 'દેખરહિત બનવું' તેવો કરે છે. દુનિયાના હિત-અહિતનો વિચાર કર્યા વિના જે કાર્ય કરવામાં આવે તે હિસા છે. ધર્મના વિકાસ માટે કે લોકકલ્યાણ માટે હિસા કરવામાં આવે તો તેમાં દોષ નથી. શ્રીકૃષ્ણે કહેલા આ અહિસાના વાસ્તવિક અર્થને જાણ્યા બાદ અર્જુન પુષ્ટ કરવા તૈયાર થયો હતો અને તેના હાથે સંહાર થયો, છતાં તેને પાપ લાગું નહિ.

- (3) જે પોતાનું નથી તેવું કંઈપણ પોતાનું માની અધિકાર રાખવો તેને ચોરી કહેતાં ય. બીજાની ચીજને તેની રજા સિંહાય લેવી તેને ચોરી કહેવાય, કર્તવ્યની ચોરી એ મોટી ગુપ્ત ચોરી છે. મજૂરી નક્કી કરવીને જેટલો સમય અને જેટલું કામ કરાવવાનું નક્કી કર્યું છે, તેમાં ઘટાડો કરવો, આળસ કરવી, સોપેલું કાર્ય ન કરવું - આ બધી બાબતો આજે સામાન્ય બની ગઈ છે. આ પણ ચોરી જ છે.

અસ્તેયનો અર્થ છે ધર્મપૂર્વક. જે વસ્તુ જેટલા પ્રમાણમાં પોતાને મળવી જોઈએ, તેને તેટલા જ પ્રમાણમાં લાવવી. પૂરી કિમત ચૂકવીને કોઈ વસ્તુ મેળવવામાં આવે તો ચોરી નથી. પોતે ચોરીથી બચવું જોઈએ અને સાથે-સાથે બીજાને પણ બચાવવા જોઈએ. યોગમાર્ગના સાધકે આ બંને બાબતા પર ધ્યાન આપવું જોઈએ અને 'યમ'ના આ અંગ પર ગ્રલુંત્વ મેળવવું જોઈએ.

- (4) અપરિગ્રહ એટલે લોભને કારણે થતી સંગ્રહવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો જરૂરિયાત ઉપરાંતનો સંગ્રહ ન કરવો, ઓછી જરૂરિયાતો અને ખરેખર આવશ્યક હોય તેટલું જ પોતાની પાસે રાખવું

- (5) મહર્ષિ પતંજલિના અષ્ટંગયોગનું બીજું પગથિયું નિયમ છે, તેમજો યમની જેમ પાંચ નિયમો આપ્યા છે, જે નીચે મુજબ છે.

- (1) શૌચ
- (2) સંતોષ

- (3) તપ
- (4) સ્વાધ્યાય
- (5) હિશુરગ્રહિંદ્યાન.

- (6) તપ શબ્દ 'તપ' ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ 'તપવું' એવો થાય છે. જેમ મુવર્જને તપાવવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ બળી જાય છે, તેમ સાંકના મન તથા શરીરને તપાવીને તેને શુદ્ધ કરનારી કેટલીક કિયાને તપ કહેવાય છે.

યોગસાધકે પોતાની સાધનામાં સફળ થવા માટે આકર્ષે તપ કરવું જોઈએ. આ તપમાં શરીર, વાક્ષી તથા મનનું તપ આવી જાય છે. શારીરિક તથા માનસિક રીતે ફળનું આશા વિનાના તપથી સિદ્ધ ગ્રામ થાય છે.

- (7) શૌચ એટલે શુદ્ધિ કે પવિત્રતા. આ શુદ્ધિ બે ગુરુની કહી શકાય
- સ્નાન વગેરેથી બાખ શુદ્ધિ
 - પવિત્ર ખોરાકથી આંતરિક શુદ્ધિ

એકમ - 9 : અષ્ટાંગ્યોગ- આસન તથા પ્રાણાયામ

અષ્ટાંગ્યોગનાં પ્રથમ બે પગથિયાં યમ તથા નિયમ વિશે ઊડાજપૂર્વક અભ્યાસ આગળના એકમમાં કર્યો. ત્યારબાદ હવે અષ્ટાંગ્યોગનું ગ્રીજું પગથિયું આસન તથા ચોણું પગથિયું પ્રાણાયામનો અભ્યાસ આ જેકમમાં કરીશું. આ બજે નામ આજના સમાજમાં ખૂબ પ્રચલિત છે. યમ-નિયમની જેમ જ આ પણ કઠિન સાધના છે, જેનો ઘ્યાલ તમને અભ્યાસ બાદ આવશે.

માળખું :

- 9.1 હેતુ
- 9.2 પ્રસ્તાવના
- 9.3 આસન
- 9.4 પ્રાણાયામ
- 9.5 સારાંશ
- 9.6 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

9.1 હેતુ:

આ એકમના અંતે તમે ;

- આસનનો અર્થ, મહત્વ તથા લાભ જાણી શકશો.
- પ્રાણાયામ શું છે તથા તેના લાભનો ઊડાજપૂર્વક અભ્યાસ કરી શકશો.

9.2 પ્રસ્તાવના :

આધુનિક સમયમાં શારીરિક તંહુરસ્તી, સૌદર્ય તથા આરોગ્ય મામ કરવા માટે દુનિયાભરમાં વિવિધ કસરતોની સરખામણીમાં આસન તથા પ્રાણાયામે મહત્વનું સ્થાન પ્રાપ્ત લીધું છે. આસનનો પ્રચાર વધુ થવાના લીધે યોગ એટલે આસન એવો ઘ્યાલ સમાજમાં પ્રવર્તે છે, પરંતુ આસન કે પ્રાણાયામ યોગનો ભાગ છે, સંપૂર્ણ યોગ નથી. તે વૈજ્ઞાનિક છે. તેનો અર્થ તે જાણી તેમાં રહેલ સૂક્ષ્મવિજ્ઞાન વિશે આપણે હવે જાણીશું.

9.3 આસન :

આસનનો અર્થ :-

આસન એક સંસ્કૃત શબ્દ છે, જે "આસ" ધ્યાતુ પરથી આવ્યો છે. તેનો અર્થ બેસલું કે સ્થિર રહેણું કે વિશિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવી તે થાય છે, પણ માત્ર શબ્દના અર્થથી તેનો સાચો અર્થ પ્રગટ નથી થતો. મહર્ષિ પતંજલિ અનુસાર સુખપૂર્વકની સ્થિર સ્થિતિને આસન કહે છે. અર્દી સુખ તથા સ્થિર શબ્દને સમજવા જરૂરી છે.

થોડો સમય શાંતિથી સ્થિર બેસવાનો પ્રયત્ન કરો. તમારું શરીર બેસી નહીં શકે, અર્થાતું આપણું શરીર આપણા વશમાં નથી. ચોવીસ કલાક આપણે માત્ર આપણા શરીરને સુંદર રાખવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, છતાં તે આપણા નિયંત્રણમાં નથી. આસન અભ્યાસ દ્વારા આ મુશ્કેલી દૂર થશે. શરૂઆતમાં થોડો સમય કોઈ આસનમાં બેસવાથી તકલીફ થશે, પરંતુ ધીરે-ધીરે સુખપૂર્વકની સ્થિતિ પ્રાપ્ત થશે.

કોઈ લાંબી મુસાફરીમાં નીકળતા પહેલાં આપણે આપણા વાહનને બરાબર ચકાસી લઈએ છીએ, તેનું એન્જિન, હવા, બ્રેક, પેટ્રોલ બરાબર જોઈ લઈએ છીએ. યોગ માર્ગના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે આ માનવશરીર છે, જેને વાહન સાથે સરખાવી શકાય. આથી, લાંબી આધ્યાત્મિક મુસાફરીમાં નીકળતા પહેલાં શરીરરૂપી વાહનને ચકાસતું જરૂરી છે. આસનથી આ શરીરરૂપી વાહન ચકાસાય તો છે જ, અને સાથે-પાથે લાંબી મુસાફરી માટે તૈયાર પણ થાય છે.

આસન અને કસરત :

આજના સમયમાં આસનને શારીરિક કસરત તરીકે જોવામાં આવે છે. આપણે એકમ-2માંઝેયું, તે મ્રમાણે યોગ અને વ્યાયામમાં ખૂબ જ અંતર છે. આસન અને કસરત બંને બહારથો જોતાં શારીરિક હળનચલન થતું હોય તેવું લાગે છે. પરંતુ બજે વચ્ચેના તફાવતો વાંચ્યા બાદ તમે સરળતાથી સમજ શકશો કે આસન એ કસરત નથી જ.

	આસન	કસરત
(1)	આસન ખૂબ જ ધીરેથી જટકા વગર સરળતાથી કરવામાં આવે છે.	(1) કસરત જડપથી અંગોમાં જટકા આપ્ને કરાય છે.
(2)	આસન ખૂબ જ ધીરેથી થતા ઊર્જાનો વપરાશ ઓછો થાય છે તથા કોઈ પણ તંત્ર પર દબાણ આવતું નથી.	(2) કસરતમાં વધારે ઊર્જાનો ખર્ચ થતા કૃદયના ધબકારા, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર વગેરેની ડિયાગતિ વધે કે તથા અન્ય તંત્રો પર પણ દબાણ આવે છે.
(3)	આસનથી તનાં વધે છે તથા શાંતિ ભણે છે.	(3) કસરતથી તનાવ વધે છે તથા શરીર અને જનમાં અશાંતિ પેદા થાય છે.
(4)	શરીરના આંતરિક અવયવો પર ધ્યાન આપે છે. શારીરિક સુંદરતા તો માત્ર આડપેદાશ છે, લક્ષ્ય નથી હોતું.	(4) શરીરના આંતરિક અવયવો પર ધ્યાન નથી અપાતુ, માત્ર શારીરિક સુંદર. ॥ વધારવાનું લક્ષ્ય હોય છે.

આ ઉપરોક્ત અન્ય તફાવતો આપણે એકમ-2માં જોઈ ગયા. આ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આસન અને કસરતમાં આસમાન - જીવિનાનું અંતર છે. આસન કસરત નથી જ, તે યોગમાર્ગ પર આગળ વધવા શરીરને માત્ર તૈયાર કરવાની પદ્ધતિ કહી શકાય.

આસનોની સંખ્યા :

એમ મનાય છે કે કુલ 8નું લાખ યોનીઓ છે, અને તે દરેકનો જે આકાર છે તે મુજબ કુલ 84 લાખ આસનો છે. તેના નામોની યાદી નથી, તેમાંથી મુજ્ય 84 આસનો ઋષિમુનીઓને દ્વારા નક્કી કરવામાં આવ્યાં. “હઠ્યોગ પ્રદીપિકા”માં 16 તથા “ધરેડ સંહિતા”માં 32 આસનોનું વર્ણન છે. પરંતુ મહિર્ષ પતંજલિના “યોગસૂત્ર”માં એક પણ આસનનો ઉલ્લેખ નથી, પરંતુ તેમણે આસનની પરિભાષા તથા લાભની વાત કરી છે. આધુનિક જીવાનમાં કેટલાક લોકોએ મૂળભૂત આસનમાં ફરેફાર કરી પોતાની રીતે નામ આપ્યી વર્ણનો કર્યા છે, કયારેક એક આસનના જુદા જુદા નામ અપાય છે. આ મુશ્કેલીમાં ન પડતા ગુરુની સલાહ તુજુખ આસનોનો અભ્યાસ કરવો જોઈએ.

આસનોના પ્રકાર :-

આપણે જોયું તે મ્રમાણે આસનોની સંખ્યા ઘડી છે. આસનોને શરીર અને મન પર થતી અસર મ્રમાણે વહેંચવામાં આવે તો મુખ્યત્વે નીચે મ્રમાણે ત્રણ પ્રકાર પડે ;

(1)	ધ્યાનપ્રેરક આસન :	લાંબો સમય સ્થિરતા તથા સુપૂર્વક બેસીને મ્રાણાયામ, ધ્યાન વગેરે કરી શકાય તેને ધ્યાનપ્રેરક આસન નહે છે. જેમ કે, પદ્માસન, વજાસન
(2)	સ્વાસ્થ્યપ્રેરક આસન :	મોટાભાગનાં આસનોનો સમાવેશ. આ પ્રકારમાં થાય છે, જેનો હેતુ શરીરના વિવિધ અંગોનું સ્વાસ્થ્ય જળવવાનો છે. જેમ કે, ઉત્તાનપાદાસન, પવનમુક્તાસન.
(3)	આરામપ્રેરક આસન :	પ્રત્યેક આસન બાદ વિરામ કરી પણી બીજું આસન કરાય છે, જેથી થાક ઉત્તરી જાયતથા ફાયદો ભણે. આવાઅ સનનો સમાવેશ અહીં થાય છે. જેમ કે શવાસન, મકરાસન. (આસનો વિશે વધુ ત્રિડાષથી પ્રાયોગિક અભ્યાસમાં શીખીશું.)

શરીરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં મુખ્યત્વે નીચે પ્રમાણે પ્રકાર પડે છે :

	પ્રકાર	ઉદાહરણ
(1)	ચન્દ્રસૂઈને કરવાના આસનો	ઉત્તાનપાદાસન, પવન મુક્તાસન
(2)	ગીધસૂઈને કરવાનાં આસનો	શલભાસન, મૂજંગાસન
(3)	ગીબા રહીને કરવાનાં આસનો	અર્ધકટિયકાસન, તાડાસન
(4)	બેસીને કરવાનાં આસનો	જ્ઞાન શિરાસન, વજાસન
(5)	ધૂટષ પર ગીબા રહીને કરવાનાં આસનો	ઉષ્ણાસન, મયૂરાસન.

આસનોના લાભ : -

- (1) સ્થૂલરૂપમાં જોઈએ તો શરીરના બધા તંગો એકબીજા સાથે ઊડાખપૂર્વક જોડામેલ છે. શરીરની તંહુરસ્તી બધા તંત્રોના સુભેણથી પ્રામ થાય છે. યોગાસન શરીરના બધા તંત્રોમાં સંકલન લાવે છે.
- (2) સ્થૂલરૂપમાં શારીરિક સ્તર પર અસર કરતાં આસનો સુધમરૂપમાં માનસિક સ્તર પર અસર કરે છે. મન તનાવમુક્ત થઈ શકતાં થાય છે, તથા સાચા મુખની પ્રાર્થિ થાય છે.
- (3) શરીર તથા મનમાં થતી ચંચળતા તથા અસ્થિરતા દૂર થઈ જાય છે. શરીર તથા મન સ્થિર થતાં આરોગ્ય પ્રામ થાય છે.
- (4) આસનની સિદ્ધિ થયા બાદ દન્દો બાધ કરી શકતા નથી. દન્દ અર્થાત્ સુખ-દુઃખ, ઠી-ગરમી, પ્રકાશ-અંધકાર, શુભ-અશુભ વગેરે, એકબીજાથી વિપરીત સ્વભાવવાળાં જોડકાં, શરીરમાં આ બધાંને કોઈ પક્ષ પીડા વગર સહન કરવાની શક્તિ આવે છે.

આમ, દુંકમાં એમ કહી શકાય કે આસનથી શારીરિક ફાયદો તો થાય છે, પરંતુ તે માત્ર શારીરિક અભ્યાસ નથી, પક્ષ મનોશારીરિક છે. આ ઉપરાંત ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે પક્ષ એનું ધાર્યું મહત્વ છે.

તમારી પ્રગતિ ચકાસો :

- (1) આસન એટલે શું ? તેના પ્રકાર જણાવો.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

- (2) આસન તથા કસરત વયેનો તફાવત જ્ઞાવો.
-
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

9.4 પ્રાણાયામ :

પ્રાણાયામનો અર્થ :-

પ્રાણાયામ એ “પ્રાણ” અને “આયામ” બે શબ્દનો બનેલો છે, જેનો અર્થ પ્રાણનું નિયમન એવો થાય છે. પ્રાણને સામાન્ય ભાષામાં વાયુ કહેવામાં આવે છે, પરંતુ યૌગિક પરિભાષામાં સૂક્ષ્મરૂપે જોતાં પ્રાણને જીવનશક્તિ કહેવાય છે. આયામનો અર્થ દીર્ઘ કરવો અથવા વિસ્તાર કરવો એવો થાય છે. પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ઘ કરવાની વાત પ્રાણાયામમાં છે.

પ્રાણાયામ એ અધ્યાત્મિકયોગનું ચોથું પગથિયું છે. આસન બાદ તેનો ઉલ્લેખ છે, આથી આસન અભ્યાસ કર્યા પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ શરીર અને મનને જોડતી કરી છે. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવામાં આવે છે, તે જ રીતે મનની શુદ્ધિ માટે પ્રાણાયામની જરૂર છે. પ્રાણાયામને યોગનો આત્મા કહેવામાં આવે છે.

ધંજી વખત પ્રાણાયામને શાખ્યોશાસની વ્યાયામની એક પદ્ધતિ માની લેવામાં આવે છે, પરંતુ બનેમાં ખૂબ જ લિનતા છે. યૌગિક શ્વરસંકિયા ધીમી તથા ઊરી છે. તેમાં પેટ, છાતી તથા ખલાનાં ડલનાંથિન કરવામાં આવે છે, જે વિશે વિસ્તારથી તમે પ્રાયોગિકમાં અભ્યાસ કરશો.

પ્રાણાયામનું સ્વરૂપ :-

પ્રાણાયામમાં મુખ્યત્વે ત્રણ કિયાઓનો સમાવેશ થાય છે ;

પૂર્ક : નિયંત્રજા તથા સમાનતાથી શાસ લેવાની પ્રક્રિયા.

રેચક : નિયંત્રજા તથા સમાનતાથી શાસ લેવાની પ્રક્રિયા.

નિયંત્રજા તથા સમાનતાથી શાસ છોડવાની પ્રક્રિયા.

કુંભક : સલ્લાનતાની સાથે પ્રાણવાયુને શરીરની બહાર (આર્થિકુંભક) કે શરીરની અંદર (આંતરકુંભક) રોકવો.

પ્રાણાયામના પ્રકાર :

મહર્ષિ પતંજલિએ “યોગસૂત્ર”માં પ્રાણાયામનાં નામ નથી જાપ્યા, પરંતુ અન્ય પ્રમાણભૂત ગ્રંથો અનુસાર પ્રાણાયામ નીચે પ્રમાણે છે.

- (1) સૂર્યલેદન પ્રાણાયામ

- (2) ઉજાળી પ્રાણાયામ
- (3) સીતકરી પ્રાણાયામ
- (4) શીતલી પ્રાણાયામ
- (5) ભસ્ત્રકા પ્રાણાયામ
- (6) આમરી પ્રાણાયામ
- (7) મૂર્ખા પ્રાણાયામ
- (8) ખાવિની પ્રાણાયામ.

પ્રાણાયામનો અભ્યાસ આપણે પ્રાયોગિક વિભાગમાં વિસ્તારથી કરીશું.

પ્રાણાયામની અન્ય બ્લાબતો :

પ્રાણાયામનો અભ્યાસ કેટલાક વિશેષ આસનોમાં જ કરવો જોઈએ, કારણ કે આસન સમયે શરીર સ્થિર હોય છે. ધ્યાનાત્મક આસનો જેવાં કે પદ્માસન, સિદ્ધાસન, વજાસન, સ્વસ્તિકાસન વગેરે પ્રાણાયામ માટે અનુકૂળ છે. સાધકનો આસનમાં બેસવામાં તકલીફ હોય તો ખુરશી પર કે પલાંઠીવાળીને બેસી શકે. ધ્યાનમાં રાખવું કે સાધકના પીઠ, ગરદન તથા માણું સીધા એક રેખામાં હોવાં જોઈએ.

પ્રાણાયામમાં ધ્યાનની ગતિનું નિયંત્રણ કરવાનું હોય છે આ માટે હસ્તમુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પ્રાણવાયુ કહેવાય છે. આ મુદ્રાના ઉપયોગ દ્વારા બસે નસકોરાને ખોલી કે બંધ કરી શકાય છે. જેનો ઉપયોગ આપણે પ્રાયોગિક અભ્યાસમાં કરીશું.

પ્રણાવમુદ્રા :

પ્રાણાયામ માટે એકાંત તથા શુદ્ધ હવા જરૂરી છે, પ્રાતઃ કાળે પ્રાણાયામ કરવાથી વધુ ફાયદો મળે છે. પ્રાણાયામ નિયમિત, સતત તથા ખાલી પેટે કરવાના હોય છે. પ્રાણાયામથી થાક નથી લાગતો, પણ સ્કૂર્ટ અને તાજગીનો અનુભવ થાય છે.

શરૂઆતમાં કુંભકનો અભ્યાસ ન કરતાં માત્ર પૂરક અને રેચકનો અભ્યાસ કરવો જોઈએ ગુરુની હાજરીમાં જ તથા ગુરુની આજ્ઞા અનુસાર ખૂબ જ સ્થિરતા તથા ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો, કારણ કે પ્રાણાયામ ખોટી રીતે કરવામાં આવે તો માત્ર નુકસાન જ છે.

પ્રાણાયામના ફાયદા :

- પ્રાણાયામથી સ્થૂળ સ્તર પર શરીર સ્વસ્થ તથા તંદુરસ્ત બને છે, દરેક તંત્રો સુભેણપૂર્વક કાર્ય કરતાં આધુણ્ય વધે છે. ખાસ કરીને રૂધિરાભિસરણતંત્ર, અંતઃઝ્વાવી ગ્રંથિતંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર વગેરે પર ખૂબ પ્રભાવ પડે છે.
- પ્રાણાયામથી માનસિક રોગો દૂર થાય છે.
- મનમાં સતત વિચારો આવતા હોય તો યોગમાર્ગમાં આગળ વધી ન શકાય, પ્રાણાયામથી વિચારો ઓછા થાય છે તથા મન શાંત પડે છે.
- આધ્યાત્મિકસેને પ્રાણાયામનું ખૂબ મહત્વ છે. કુંડલીની જાગરણની પ્રક્રિયા, ચેતનાનો વિકાસ, ધ્યાન, સમાધિ વગેરે પ્રાણાયામ બાદ થાય છે.

આમ, પ્રાણાયામ એ આધ્યાત્મ વિકાસની કરી છે તથા સાથે-સાથે શારીરિક તથા માનસિક ફાયદા તો મળે જ છે.

૭ તમારી પ્રગતિ ચકાસો :

(3) પ્રાણાયામનો અર્થ સમજાવી ફાયદા જ્ઞાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(4) પ્રાણાયામમાં મુખ્યત્વે કઈ મુદ્રાનો ઉપયોગ થાય છે ? શાખી ?

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

(5) વિવિધ પ્રાણાયામનાં નામ જ્ઞાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

9.5 સારાંશ :

આધુનિક સમયમાં આપણે આસન તથા પ્રાણાયામને વ્યાયામ સ્વરૂપે લઈએ તે ખોટી પદ્ધતિ છે, તેનો સાચો અર્થ આપણે જાણ્યો. ગુરુની હાજરીમાં તેમના માર્ગદર્શન ડેટાન અભ્યાસ કરી યોગમાર્ગમાં આગળ વધી શકાય છે. આસન તથા પ્રાણાયામ માત્ર શારીરિક નહિ પણ એથી ય વધુ માનસિક અભ્યાસ છે એ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

9.6 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

(1) આસન એક સંસ્કૃત શબ્દ છે, જે "આસ" ધ્યાતુ પરથી આવ્યો છે. તેનો અર્થ બેસવું કે સ્થિર રહેવું કે વિશિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવી તે થાય છે, પણ માત્ર શબ્દના અર્થથી તેનો સાચો અર્થ પ્રગત નથી થતો. મહર્ષિ પતંજલિ અનુસાર સુખપૂર્વકની સ્થિર સ્થિતિને આપુન કહે છે. અહીં સુખ તથા સ્થિર શબ્દને સમજવા જરૂરી છે.

આસનોને શરીર અને મન પર ધતી અસર પ્રમાણે વહેંયવામાં આવે તો મુખ્યત્વે નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે ;

(1)	ધ્યાનપ્રેરક આસન :	લાંબો સમય સ્થિરતા તથા સુખપૂર્વક બેસીને પ્રાર્ગાયામ, ધ્યાન વગેરે કરી શકાય તેને ધ્યાનપ્રેરક આસન કહે છે. જેમ કે, પદ્માસન, વજાસન મોટાભાગના આસનોનો સમાવેશ આ પ્રકારમાં થાય છે, જેનો હેતુ શરીરના વિવિધ અંગોનું સ્વાસ્થ્ય જરૂરવવાનો છે. જેમ કે, ઉત્તાનપાદાસન, પવનમુક્તાસન.
(2)	સ્વાસ્થ્યપ્રેરક આસન :	
(3)	આરામપ્રેરક આસન :	પ્રતેક આસન બાદ વિરામ કરી પછી બીજું આસન કરાય છે, જેથી થાક ઉત્તરી થાય તથા ફાયદો મળે. આવા આસનનો સમાવેશ અર્હી થાય છે. જેમ કે શવાસન, મકરાસન.

(આસનોના વિશે વધુ ડિડાણથી પ્રાયોગિક અભ્યાસમાં શીખોશું.)

(2)

આસન	કસરત
(1) આસન ખૂબ જ ધીમેથી ઝટકા વગર સરળતાથી કરવામાં આવે છે.	(1) કસરત ઝડપણી અંગોમાં ઝટકા આપીને કરાય છે.
(2) આસન ખૂબ જ ધીરેથી થાતા ઊર્જાનો વપરાશ ઓછો થાય છે તથા કોઈ પણ તંત્ર પર દબાજા આવતું નથી.	(2) કસરતમાં વધું ઊર્જાનો ખર્ચ થતા હદ્યના ધબકારા, થસનતંત્ર, ઉત્સર્જનતંત્ર વગેરેની કિયાગતિ વધે છે તથા અન્ય તંત્રો પર પણ દબાજા આવે છે.
(3) આસનથી તનાવ ઘટે છે તથા શાંતિ મળે છે.	(3) કસરતથી તનાવ વધે છે તથા શરીર અને મનમાં અશાંતિ પેદા થાય છે.
(4) શરીરના અંતરિક અવયવો પર ધ્યાન આપે છે. શારીરિક સુંદરતા તો માત્ર આડપેદાશ છે, લક્ષ્ય નથી હોતું.	(4) શરીરના અંતરિક અવયવો પર ધ્યાન નથી અપાતુ, માત્ર શારીરિક સુંદરતા વધારવાનું લક્ષ્ય હોય છે.

(3) પ્રાણાયામના ફાયદા:

- પ્રાણાયામથી સ્થૂળ સ્તર પર શરીર સ્વસ્થ તથા તંદુરસ્ત બને છે, દરેક તંત્રો સુમેળપૂર્વક કાર્ય કરતા આયુષ્ય વધે છે. ખાસ કરીને રધિરાલિસરણતંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર વગેરે પર ખૂબ પ્રભાવ પડે છે.
 - પ્રાણાયામથી માનસિક રોગો દૂર થાય છે.
 - મનમાં સતત વિચારો આવતા હોય તો યોગમાર્ગમાં આગળ વધી ન શકાય, પ્રાણાયામથી વિચારો ઓદ્ધા થાય છે તથા મન શાંત પડે છે.
 - આધ્યાત્મિકસેત્રે પ્રાણાયામનું ખૂબ મહત્વ છે. કુંડલીની જગરણની પ્રક્રિયા, ચેતનાનો વિકાસ, ધ્યાન, સમાધિ વગેરે પ્રાણાયામ બાદ થાય છે.
- (4) પ્રાણાયામની ઉસ્તમુદ્રાને “પ્રણાવમુદ્રા” કહેવામાં આવે છે, પ્રાણાયામની પદ્ધતિમાં વારાફરતી ડાબા તથા જમણા નસકોરાને બંધ કરવાના હોય છે. આ રીતે આસની ગતિનું નિયંત્રણ થાય છે. આ પ્રક્રિયા માટે હાથનો ઉપયોગ આવશ્યક છે. આથી પ્રણાવમુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે.

(5) પ્રાણાયામના પ્રકાર :

મહર્ષિ પતંજલિએ “યોગસૂત્ર”માં પ્રાણાયામનાં નામ નથી આપ્યાં, પરંતુ અન્ય પ્રમાણભૂત ગ્રંથો અનુસાર પ્રાણાયામ નીચે પ્રમાણે છે.

- (1) સૂર્યભેદન પ્રાણાયામ
- (2) ઉજાયી પ્રાણાયામ
- (3) સીતકારી પ્રાણાયામ
- (4) શીતલી પ્રાણાયામ
- (5) ભક્તિકા પ્રાણાયામ
- (6) બ્રાહ્મરી પ્રાણાયામ
- (7) મૂર્ખી પ્રાણાયામ
- (8) લાવિની પ્રાણાયામ.

એકમ-10 : અષ્ટાંગયોગ :

અષ્ટાંગયોગનાં ચાર પગથિયા યમ, નિયમ, આસન તથા પ્રાણાયામ વિશે વિસ્તારથી જાણ્યું. હવે અંતરેગ યોગ અર્થાતું છેલ્લાં ચાર પગથિયાં વિશે આ એકમમાં સમજાશું. અહીં પ્રત્યાહાર, ધારક્ષા, ધ્યાન તથા સમાપ્તિ વિશે વાતો કરવામાં આવી છે.

માળખૂં :

- 10.1 હેતુ
- 10.2 પ્રસ્તાવના
- 10.3 પ્રત્યાહાર
- 10.4 ધારક્ષા
- 10.5 ધ્યાન
- 10.6 સમાપ્તિ
- 10.7 સારાંશ
- 10.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો.

10.1 હેતુ :

આ એકમના અભ્યાસ અંતે તમે :

- તમે પ્રત્યાહારની પ્રક્રિયા સમજી શકશો.
- ધારક્ષા દ્વારા મનને એકાગ્ર કરી શકશો.
- ધ્યાન દ્વારા વિચારોને દૂર કરી સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ જાણી શકશો.
- સમાપ્તિ દ્વારા ઈશ્વરને પામવાનો રસ્તો જાણી શકશો.

10.2 પ્રસ્તાવના :

આપણે અગાઉ જાણ્યું તેમ યમ, નિયમ, આસન તથા પ્રાણાયામ એ બહિરંગ યોગ છે તથા આ એકમના ચાર અંગો - પ્રત્યાહાર, ધારક્ષા, ધ્યાન અને સમાપ્તિ - એ અંતરેગ યોગ અર્થાતું અંતઃકરણ સાથે સંકળાયેલ છે. આ વિશે વિસ્તૃત માહિતી મેળવીશુ.

આજના આધુનિક સમયમાં વિશાળે બાબ્ધ જગત વિશે ખૂબ માહિતી મેળવી છે, પરંતુ અંદરના આંતરિક જગતમાં કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી. લાખો માઈલ દૂર આવેલ ઉપગ્રહ પર અંકુશ રાખી શક્ય છે, પણ મન પર નહિ. મનના વિચારો પર નહિ. મન એક સેકન્ડમાં તો હજારો માઈલ સુધી પહોંચી જાય છે, પરિજ્ઞામે દરેક મનુષ્યના જીવનમાં તનાવ ઉત્પન્ન થાય છે. આ તનાવનું નિવારક યોગ પાસે છે. તેમાં અષ્ટાંગયોગનાં છેલ્લાં ચાર પગથિયાં મનને અંતમુખી બનાવી પરમ સુખની પ્રાપ્તિ તરફ લઈ જાય છે.

10.3 પ્રત્યાહાર :

આપણું મન ઈન્દ્રિયો અર્થાતું આંખ, નાક, કાન, જલ તથા ત્વચાની મદદથી બાબ્ધ જગતમાં ભટકતું રહેતું હોય છે. આ બાબ્ધ વિષયમાંથી મનને પાછું વાળી આંતરિક વસ્તુ તરફ વાલવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ઈન્દ્રિયો કોઈને કોઈ કામમાં જોડાયેલી હોય છે, જેમ કે આંખ જોવાનું કર્ય કરે છે તથા તે કિયાની સાથે મન જોડાયેલું હોય છે. પ્રત્યાહાર દ્વારા મન પર અંકુશ લાવવાનો હોય છે, મન એ આંખને સાથ ના આપે તો મન ઈન્દ્રિયોના રંગે રંગાતું નથી તથા સાધકને અંતમુખી બનવામાં મદદ મળે છે.

યોગ પરિચય

આમ, પ્રત્યાહાર મનને અંતર્મુખી બનાવવાનું સાધન છે. સતત બાદ જગતમાં ભટકતું મન અંદરની દુનિયા સાથે જોડાય છે. પ્રત્યાહાર બાદ ધારકા તથા ધ્યાનમાં મપેશ થાય છે. આંખો બંધ કરી ધારકા કે ધ્યાન કરવા બેસો ત્યારે સતત વિચારો આવે છે, બંધ આંખે પણ મન ફર્યા કરે છે, મનને સ્થિર કરવું પડે. આ માટે ઈન્જિયો તથા મનને એકબીજીઓ અલગ કરવા પડે.

આ રીતે યોગાભ્યાસીએ ધમ, નિયમ, આસન તથા મ્રાણાયામના બદિરંગી અભ્યાસ બાદ પ્રત્યાહાર દ્વારા અંતર્ગતી અભ્યાસની શરૂઆત કરવી જોઈએ, પ્રત્યાહાર વગર ધારકા કે ધ્યાનનો અભ્યાસ અપૂર્વ છે.

10.4 ધારકા :

મન ખૂબ જ ચંચળ છે. એક સેકન્ડમાં હજારો વિચાર કરી નાખે છે. એક વિચારથી બીજી વિચાર પર ફૂદા કરે છે. ધારકા દ્વારા મનને એક વિષય પર લાંબા સમય સુધી બાંધી રાખવાનું પ્રક્રિયા છે, પરંતુ તેમાં વિષયની આસપાસ ફરવાની છૂટ હોય છે. એક ઉદાહરકા દ્વારા આને વધુ સ્પષ્ટ રીતે સમજું શકાશે.

ભગવાન શ્રીકૃષ્ણની ધારકા કરવાથી તેમના રંગ, રૂપ, લીલાઓ વાંચે તેમની જ બાબતો મનમાં ફરી શકે, અન્ય કોઈની નહિ. આ રીતે મન કાબૂમાં આવે છે, મનને વશ કરતાં ધારું કામ પાર પડે છે. એકાગ્રતા વધે છે, મનની શક્તિ સમજીશે. તેનો સાચી દિશામાં ઉપયોગ કરવાથી જરૂરી લક્ષ્ય પ્રાપ્ત થશે.

મહર્ષિ પતંજલિ અનુસાર મનને એક વિશેષ વિષયમાં બંધવું, તેને ધારકા કહેવામાં આવે છે. ધારકાની વિવિધ પ્રક્રિયાઓ નીચે મુજબ છે :

- આપકા મનમાં સતત આવતા વિચારોમાંથી એકને પસંદ ભી તેના પર મનને એકાગ્ર કરો. આ પ્રક્રિયામાં મનને કયા વિચાર કરવાના એ આપણે નક્કી કરવાનું છે. અને પ્રક્રિયામાં આપકાને ગમતા વિચાર કરવાના હોવાથી મનને જરૂરી સ્થિરતા પ્રાપ્ત થાય છે.
- યોગાભ્યાસી આંખો બંધ કરી કોઈ કાલ્યનિક પ્રકાશ પર મનને સ્થિર કરી શકે છે. આ પ્રકાશ પોતાની ઈંદ્રજિલ્દ કોઈપણ ચક પર (ચક વિશે આપણે કુંડલીની યોગમાં જીવ્યું) પ્રકાશ જોઈ શકે છે. આ રીતે પણ ધારકાની પ્રક્રિયા કરી શકાય છે.
- ઈશ્વર, ગુરુ કે કોઈ સંત પુરુષ પર પણ મનને એકાગ્ર કરી ધારકાની સ્થતિને પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત પરંપરામાં આપેલી ન્રાટક જેવી પદ્ધતિઓથી પણ મનને એકાગ્ર કરી શકાય છે.

ધારકાથી ધ્યાન તથા સમાપ્તિ થાય છે. આધ્યાત્મિક લક્ષ્યમાં એકાગ્રતા લાવવા ધારકા ઉપયોગી છે. આમ, પ્રત્યાહાર બાદ ધારકાનો અભ્યાસ કરી યોગી ધીમે-ધીમે તેના અંતિમ લક્ષ્ય તરફ આગળ વધે છે.

10.5 ધ્યાન :

વિવિધ યોગાંગોમાં આસનની જેમ, ધ્યાન પણ આજકાલ ખૂબ ચર્ચિત વિષય છે. ધક્કા લોકો ધ્યાન જ યોગ છે એમ માને છે. ધ્યાન વિશે નીચે પ્રમાણે ખોટા ખ્યાલો સમજામાં પ્રવર્તે છે :

- ધ્યાનનો અર્થ કોઈ શાંત સ્થળે પદ્માસનવાળી આંખો બંધ કરીને બેસી રહેવું તથા સતત વિચારો કર્યા કરવા તે નથી, માત્ર આંખો બંધ કરવાથી ધ્યાન લાગતું નથી..
- ધ્યાન એ ધારકા બાદ આપોઆપ થતી પ્રક્રિયા છે. ધ્યાન કરી નથી શકતું પણ થઈ જાય છે. આજકાલ ધ્યાન ધક્કા લોકો શીખવાડે છે, પરંતુ ખરેખર તો ધ્યાન વિશે માત્ર માહિતી કે પ્રારંભિક માર્ગદર્શન જ આપી

આપણે આગળ જોયું તે મુજબ, મનને એક વિષય સાથે જોડવું તે ધારકા છે. એ જ વિષયની પરિપક્વતા ધ્યાન કહેવાય છે. ધારકામાં શ્રીકૃષ્ણનું ઉદાહરણ જોયું તેને આગળ સમજુઓ. શ્રીકૃષ્ણની લીલાઓ, રૂપ, રંગ વગેરે સાથે વિચારો જોડાયેલા હોય તેને ધારકા કહેવાય. આ પ્રક્રિયા જપારે ધ્યાનમાં બદલાય છે ત્યારે મન તથા શ્રીકૃષ્ણ એકબીજાથી અલગ ન કરી શકાય.

ધ્યાનનો અભ્યાસ માત્ર ધ્યાનસનમાં જ કરવામાં આવે છે. ધ્યાનસનમાં લાંબો સમય સ્થિર તથા તનાવમુક્ત અવસ્થામાં બેસી શકાય છે. મુખ્યત્વે ચાર ધ્યાનસન છે :

- (1) પદ્માસન
- (2) સ્વસ્તિકાસન
- (3) સમાસન
- (4) સિદ્ધાસન

ધ્યાનની પદ્ધતિઓ :

ધ્યાનની સ્થિતિને પ્રામ કરવા માટે વિવિધ યોગમાર્ગોમાં વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, આ ઉચ્ચતમ સ્થિતિને પ્રામ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી. અધ્યાત્મયોગ મુજબ ધ્યાન એ સાતમું પગથિયું છે. જે અભ્યાસી ધ્યાનની સ્થિતિને પ્રામ કરવા હુંચતા હોય, તેમણે નિયમિત પ્રથમ છ પગથિયાંનો આનાસ કરવો પડે છે.

વળી, ધ્યાનમાં લાંબો સમય બેસવાનું હોય છે, આથી શારીરિક ક્ષમતા પણ જરૂરી છે. આરણ, ગ્રાઙ્ઝાયામ, પ્રત્યાહાર વગેરે અભ્યાસ દ્વારા શરીર તથા મનને ધ્યાનની પૂર્વતૈયારી રૂપે તૈયાર કરવાનું છે, જેથી સ્થાપનામાં અવરોધ ન બને.

ધ્યાન એ સરળ પ્રક્રિયા નથી. આવા ઉચ્ચકોટીના અભ્યાસમાં સાધકે ધીરજ, શ્રદ્ધા, આત્મબળ તથા ઉત્સાહ રાખવો જરૂરી છે. દરરોજ નિયમિત અભ્યાસ કરવાથી જ સરળતા પ્રામ થાય છે. ચંચળ મનને સ્થિર કરવા માટે નીચે મુજબ આધાર લઈ શકાય :

- હૃદ્યર
- સદ્ગુર
- પ્રકાશ
- જ્યોતિ
- સૂર્ય કે ચંદ્ર
- ચક

ધ્યાનના ફાયદા :

- શારીરિક રીતે સ્વસ્થતા પ્રામ થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે.
- યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે.
- નકારાત્મક લાગકીઓ દૂર થાય છે તથા અભ્યાસી નીરદ તથા દઢ મનોબળબળો બને છે.
- આધ્યાત્મિક માર્ગમાં ખૂલ જ આગળ વર્ષે છે તથા હિન્દુપ્રામિના દ્વારે આવીને ગેલ્બો રહે છે.

આમ, ધ્યાનથી સુખ, શાંતિ તથા સંતોષ પ્રામ થાય છે. જીવન શું છે તે જીવી તથા માઝી શકાય છે.

10.6 સમાધિ :

સમાધિ શું છે, તેનું શબ્દો દ્વારા વર્ણન શક્ય નથી, કારણ કે તે સ્થિતિનો મન તથા ઈન્ડ્રિયો અનુભવ કરી શકતા નથી. મન તથા આત્મા એક થાય તેને સમાધિ કહેવાય. સમાધિની સ્થિતિ પ્રામણ થતાં બધાં જ રહસ્યો જાણી શકાય છે. ઈન્ડ્રિયોથી ન સમજાય તેવી બાબતો સમાધિથી સમજાય છે. આખ્યાસી પૂર્ણતાને પામે છે. સમાધિની સ્થિતિને મોશ, મુક્તિ, પરમતત્ત્વની પ્રાપ્તિ, લય, અમરત્વ વગેરે જેવાં નામોદ્ય. સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમાધિના મુખ્યત્વે બે પ્રકાર છે.

- (1) સંપ્રણાત સમાધિ
- (2) અસંપ્રણાત સમાધિ

જ તમારી પ્રગતિ ચકાસો :

- (1) પારલાની વિવિધ પ્રક્રિયાઓ જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (2) ધ્યાનાસનનાં નામ જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (3) ધ્યાનના ફાયદા જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

- (4) સમાધિ એટલે શું ? તેના પ્રકાર જણાવો.

.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....
.....

10.7 સારાંશ :

આજના આધુનિક સમયમાં ભૌતિક સુખ-સંપત્તિ તો અખૂટ છે પરંતુ સુખ નથી. સમાધિ તથા તે પ્રામ કરવા માટેના યોગાંગોથી મનુષ્ય સુખ તથા શાંતિ પ્રામ કરી શકશે. આથી અણાંગયોગનાં આઠે પગથિયાને બરાબર સમજને તેને વ્યવહારમાં ઉતારવા જોઈએ.

10.8 તમારી પ્રગતિ ચકાસવા માટેના જવાબો :

(1) ધારણાની વિવિધ પ્રક્રિયાઓ :

- આપણા મનમાં સતત આવતા વિચારોમાંથી એકને પરંદ કરી તેના પર મનને રેંકાગ્ર કરો. આ પ્રક્રિયામાં મનને કથા વિચાર કરવાના એ આપણે નક્કી કરવાનું છે. આ પ્રક્રિયામાં આપણને ગમતા વિચાર કરવાના હોવાથી મનને ઝડપથી સ્થિરતા પ્રામ થાય છે.
- યોગાભ્યાસી આંખો બંધ કરી કોઈ કાલ્યનિક પ્રકાશ પર મનને સ્થિર કરી શકે છે. આ પ્રકાશ પોતાની ઈશ્વરા મુજબ કોઈપણ ચક પર (ચક વિશે આપણે કુંડલીની યોગમાં જાણ્યું) પ્રકાશ જરૂર શકે છે. આ રીતે પણ ધારણાની પ્રક્રિયા કરી શકાય છે.
- ઈશ્વર, ગુરુ કે કોઈ સંત પુરુષ પર પણ મનને એકાગ્ર કરી ધારણાની સ્થિતિને પ્રામ કરી શકાય છે. આ ઉપરાંત પરંપરામાં આપેલી ત્રાટક જેવી પદ્ધતિઓથી પણ મનને એકાગ્ર કરી શકાય છે.

(2) સમાસન :

- (1) સ્વસ્તિકાસન
- (2) પદ્માસન
- (3) સમાસન
- (4) સિદ્ધાસન

(3) ધ્યાનના ફાયદા :

- શારીરિક રીતે સ્વસ્થતા પ્રામ થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે.
- યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે.
- નકારાત્મક લાગકૃતીઓ દૂર થાય છે તથા અભ્યાસી નીડર તથા દઢ મનોબળવાળો બને છે.
- આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે તથા ઈશ્વરમાટિના દ્વારે આવીને ઊભો રહે છે.

(4) સમાધિ :

સમાધિ શું છે, તેનું શબ્દો દ્વારા વર્ણન શક્ય નથી, કારક કે તે સ્થિતિનો મન તથા ઈન્દ્રિયો અનુભવ કરી શકતા નથી. મન તથા આત્મા એક થાય તેને સમાધિ કહેવાય. સમાધિની સ્થિતિ ગામ થતાં બધાં જ રહણ્યો જાણ્યો શકાય છે. ઈન્દ્રિયોથી ન સમજાય તેવી બાબતો સમાધિથી સમજાય છે. અભ્યાસી પૂર્ણતાને પામે છે. સમાધિની સ્થિતિને મોક્ષ, મુક્તિ, પરમતાત્વની પ્રાપ્તિ, લય, અમરત્વ વગેરે જ્યાં નામોથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમાધિના મુખ્યત્વે બે પ્રકાર છે.